

SAVE MAX
Achievers Realty
Brokerage* Each Office Independently Owned & Operated

Paresh Peshva
Broker
416-302-4531
Off: 905-497-6701
Fax: 905-497-6700

170 Wilkison Rd., Unit # 3, Brampton, ON L6T 4Z3
realtorparesh@gmail.com

પરદેશમાં દેશની મહેક એટલે

સ્વદેશ

કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

FOR BUYING, SELLING & LEASING
Investment In Real Estate Can Make Your Future Better...

FOR SELLERS
Free Home Staging Consultation
Professional Photography & Virtual Tour
Attractive Advertising
Social Media Marketing
Customized Feature Sheet
Weekly Open House
Assist in Mortgage & Legal Services

FOR BUYERS
Team of Strong Mortgage Brokers
Team of Lawyers
Professional Home Inspectors
Step by Step Guidance Through out Buying Process

AMIT SHAH
Sales Representative
Dir: 647-995-5640
amit4tahomes@gmail.com

KOMAL SHAH
Sales Representative
Dir: 647-624-5640
komal4tahomes@gmail.com

Homekey236@gmail.com
Web: www.amitshah.ca

FRIDAY, 16 SEPTEMBER, 2022 Vol. 19, No. 37 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

યુપીમાં સામૂહિક રેપ બાદ બે દલિત સગીરાની હત્યા

ઉત્તર પ્રદેશમાં બળાત્કારીઓ બેખોફ : નરાધમોએ સગીરાની લાશ ઝાડ પર લટાકાવી દીધી, 6ની ધરપકડ

લખિમપુર-બિરિ

ઉત્તર પ્રદેશના લખિમપુર-બિરિના નિઘાસનમાં બે સગીર દલિત બહેનો પર કથિત બળાત્કાર, હત્યા બદલ 6 લોકોની ધરપકડ કરાઈ છે, જેમાંથી પાંચ મુસ્લિમ છે. બંને દલિત બહેનોના મૃતદેહ શેરડીના ખેતરમાં એક ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાયું છે કે બંને બહેનો પર બળાત્કાર કરાયા પછી તેમનું ગળુ દબાવી હત્યા કરાઈ હતી. દરમિયાન મૃતક બહેનોનો પરિવારની માગો પૂરી થવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટના આધ્યાસન પછી પરિવારે ગુરુવારે મોડી સાંજે બંને બહેનોના અંતિમ સંસ્કાર કરાયા હતા. આ મુદ્દે ઉત્તર પ્રદેશમાં ગુરુવારે આખો દિવસ રાજકીય આક્ષેપબાજી થઈ હતી. પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ સંજિવ સુમને જણાવ્યું કે, પ્રાથમિક

તપાસ મુજબ બંને દલિત બહેનો બુધવારે બપોરે બે આરોપીઓ જુનૈદ અને સોહૈલ સાથે તેમના ઘરેથી નીકળી હતી. જુનૈદ અને સોહૈલે બંને બહેનો પર બળાત્કાર કર્યા પછી તેમનું ગળુ દબાવી હત્યા કર્યાનું કબૂલ્યું છે. બંને બહેનો સાથે તેમના સંબંધ હતા અને તેઓ તેમના પર લગ્ન માટે દબાણ કરતી હતી. પોલીસે આ કેસમાં છ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં જુનૈદ અને સોહૈલ ઉપરાંત હકિમુર રહેમાન, કરિમુદ્દિન, આરિફ અને છોટુનો સમાવેશ

થાય છે. બળાત્કારના આરોપી જુનૈદ સાથે પોલીસની અથડામણ થઈ હતી, જેમાં તેને ગોળી વાગી હતી. પોલીસે તેની પાસેથી એક મોટરસાઈકલ, દેશી પિસ્તોલ અને કારતૂસો જપ્ત કરી હતી. અગાઉ દલિત સગીરાઓની માતાએ આક્ષેપ કર્યો હતો કે બંને બહેનોના અપહરણ થયા હતા. જોકે, દલિત બહેનોના પરિવારજનોએ બધા જ આરોપીઓને ફાંસી પર લટકાવવાની માગણી કરી હતી. એસસી-એસટી પંચે પણ આ કેસની નોંધ લીધી હતી.



ABOWATH
REAL ESTATE GROUP
VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

MAAZ ABOWATH
BROKER
416 893 4585
More Info on PAGE 2
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

SUPER VISA INSURANCE
Get Full REFUND if visa is declined
Get partial refund if parents leave early*
*conditions apply.... Ask NOW for a free quote..

Sanjiv Puri
Insurance Broker
Ph: 416-890-3232
Email: sanjivpuri@rogers.com

StarLife
Insurance & Investments Inc.
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS / NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

MORTGAGE ADVICE THAT COMES TO YOU

Dhires Shah
Mobile Mortgage Advisor
For expert mortgage advice contact me today

CIBC
dhires.shah@cibc.com

Tel : 647-248-0246

✓ Residential
✓ New Condos
✓ Investments
✓ Commercial

દુશામાં યાદ રાખશો
Zakir Patel
Broker
Cell: 416-561-7973
Office : 416-287-2222

RE/MAX COMMUNITY
Realty Inc., Brokerage
Independently Owned and Operated
1265, Morningside Ave. #203
Toronto, ON M1B 3V9
Email : patelzakir82@gmail.com

છેલ્લા ૪૪ વર્ષથી ટોરાન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમી ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરાન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

Ashok Travels 416-977-9896 અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬

Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.

www.ashoktravel.com
Ashok Travels Serving your travel needs in Canada since 1973
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

Need mortgage financing?
Look no further. Let me make it happen.

RBC Royal Bank

BHAVIN PATEL
Mobile Mortgage Specialist
Royal Bank of Canada
bhavin.patel@rbc.com
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069
Serving Greater Toronto Region Fax: 416-253-9461

SS & LAWYERS LLP

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

Avni Shah
B.A., JD
Barrister & Solicitor
ashah@sslawyers.ca
Tel : 416-818-4000
Fax : 416-740-4002

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

રમેશભાઈ વ્યાસ
(ડાયરેક્ટર અને પબ્લિશર, સ્વદેશ)

સંપર્ક : +1 647-236-2061 (Whatsapp Number)
Email :- rkvyas143@gmail.com

સ્વદેશ
Leading Gujarati Newspaper

પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા (ડાયરેક્ટર માર્કેટીંગ, સ્વદેશ)
(જાહેરખબર તથા પ્રેસનોટ આપવા માટે સંપર્ક કરો)

સંપર્ક : +1 416-302-4531, 437-421-2992
Email :- info@swadesh.news

સ્વદેશ
Leading Gujarati Newspaper



ઓન્ટેરિયોમાં અથડામણ દરમિયાન ટોરન્ટોના પોલીસ અધિકારીનું મોત : શકમંદ પણ ઠાર

અંધાધૂંધ ગોળીબારથી કુલ 3ના મોત, અન્ય ત્રણ ઇસમને ઈજા

ટોરોન્ટો

એક બંદૂકધારીએ કરેલા ગોળીબારમાં પોલીસ અધિકારીનું મોત નીપજ્યું હતું. આ ઘટના ઓન્ટેરિયોના એક રેસ્ટોરાં નજીક સોમવારે બની હતી. એક અજાણ્યા શખ્સે અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દેતા એક અન્ય વ્યક્તિનું પણ ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી.

આ ઘટના ટીમ હોર્ટન્સ રેસ્ટોરાં નજીક બપોરે બે વાગ્યે બની હતી. જ્યારે પશ્ચિમ ટોરોન્ટોના ત્રણ સમુદાયો

વચ્ચે અથડામણ ઉભી થઈ હતી. પોલીસે સાંજે જાહેર કર્યું હતું કે, તેમણે આ અથડામણમાં એક શકમંદને ઠાર કર્યો હતો. ટોરોન્ટોના પોલીસ વડા જેમ્સ રામરે કહ્યું હતું કે, આ ઘટનામાં 48 વર્ષીય કોન્સ્ટેબલ એન્ડ્રુ હોંગનું મોત નીપજ્યું હતું. જે પીલ અને યોર્ક રીજનલ પોલીસ તાલીમ માટે આવ્યો હતો અને રેસ્ટોરાંમાં ભોજન માટે ગયો હતો.

હોંગ છેલ્લા બાવીસ વર્ષથી પોલીસ ફોર્સમાં જોડાયો હતો. રેમરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,

આ ઘટના એના પરિવાર માટે અને ટોરોન્ટો પોલીસ વિભાગ માટે દુઃખદ છે. તેમણે સોમવારે હોંગના પરીજનોને મળીને સાંતવન આપ્યું હતું અને પોલીસ વિભાગ તરફથી તમામ પ્રકારની સહાયની ખાતરી આપી હતી. પીલ અને હેલ્પ તથા ટોરન્ટો પોલીસે સાંજે જણાવ્યું હતું કે, મિસાસાગામાં બીજા બે વ્યક્તિઓને પણ ઠાર કર્યા હતા. આમ આ ઘટનામાં એક પોલીસ અધિકારી સહિત ત્રણના મોત થયા છે અને અન્ય ત્રણને ઈજા પહોંચી હતી.

મહારાણીની અંતિમક્રિયાના દિવસે કેનેડામાં રજા જાહેર થવાની સંભાવના

રાજ્ય સરકારને રજા અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવા તાકીદ ક્યૂબેક

ટૂંકોએ કહ્યું હતું કે, સોમવારના દિવસે દેશના લોકો મહારાણીની અંતિમ ક્રિયામાં ભાગ લઈ શકે તે માટે દેશમાં રાષ્ટ્રીય જાહેર રજા વિષે વિચાર થઈ રહ્યો છે. ન્યુ-બર્સવિક ખાતે યોજાનારી મહારાણીની અંતિમ-ક્રિયામાં તે હાજરી આપશે અને લિબરલ પાર્ટી આ રિટીટમાં જોડાશે. અમે એવા પ્રયત્નો કરી રહ્યા છીએ કે, રાજ્યો અને કેન્દ્ર શાસિત વિસ્તારો આ અંતિમ ક્રિયામાં સંકલન જાળવીને કામ કરશે. સોમવારે કેનેડીયનો શોક પાળશે. વડાપ્રધાનના

કાર્યાલયે જણાવ્યું હતું કે, જ્યાં સુધી રાજ્યો આ વિધિમાં જોડાવવાનો નિર્ણય કરે એ પહેલા કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ માટે રજા જાહેર કરી છે. આશરે 90% કર્મચારીઓ રાજ્યમાં કામ કરી રહ્યા છે. તેથી રાજ્યમાં કામ કરતા કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાજ્ય સરકાર તરફથી રજા આપવામાં આવે તે જરૂરી છે. ઓન્ટોરિયો, સાસ્કેચવાન અને મેનિટોબાએ પણ 19મી સપ્ટેમ્બરને જાહેર રજા તરીકે માન્ય નથી રાખી. જ્યારે નોવા સ્કોશિયા, એન.બી.પી.ઈ.આઈ. અને ન્યુ ફોન્ડલેન્ડ અને લેબ્રાડોરે ફેડરલ સરકારના નિર્ણયની તરફેણ કરતા 19મી સપ્ટેમ્બરે જાહેર રજા રાખી છે.

હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં પ્રવેશ માટે કલાકો સુધી રાહ જોતા દર્દીઓ

ટોરોન્ટો

ઓન્ટેરિયોની હોસ્પિટલોમાં ઈમરજન્સી સેવા માટેના ઈઆર રૂમ્સમાં પ્રવેશ માટે લોકોએ લાંબો સમય રાહ જોવી પડે છે. આવા કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે અને અત્યારે એ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. ગયા વર્ષે કોરોનાના કપરા સમયમાં પણ આટલો સમય પ્રતિક્ષા કરવી નહોતી પડતી. હેલ્થ કવોલીટી ઓન્ટેરિયોના નવા જાહેર થયેલા ડેટા મુજબ દર્દીઓએ સરેરાશ ઈમરજન્સી રૂમમાં પ્રવેશ માટે સરેરાશ ૨૦.૭ કલાક રાહ જોવી પડે છે. આ આંકડા જુલાઈ માસના છે. જેમાં

પ્રાંતના લક્ષ્યાંક આઠ કલાક કરતા વધુ સમય બાદ જ દર્દીઓને જ ઈઆરમાં પ્રવેશ મળી શક્યો હતો. જૂનમાં એ આંક ૧૮.૧ કલાક હતો. જ્યારે મે માસમાં એ ૨૦.૧ કલાક હતો. છેલ્લો જે આંક આવ્યો છે એ સૌથી વધુ હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. જો કે, જુલાઈ માસમાં સ્ટાફની તંગી પણ હોવાથી આ સમય વધ્યો હોવાનું અનુમાન છે. ઓન્ટેરિયોની કેટલીક હોસ્પિટલોએ તેમના ઈઆર રૂમ્સ બંધ પણ કરી દીધા હતા. નર્સિંગ સ્ટાફની તંગીને પહોંચી વળવા કેટલાકે સ્વયંસેવી પ્લેટફોર્મનો પણ સહારો લેવો પડ્યો હતો.

ઓન્ટેરિયોમાં બિલેવન્ટ કોવિડના બુસ્ટર ડોઝની એપોઈન્ટમેન્ટ પ્રક્રિયાનો આરંભ

નવી રસી મૂળ વાઈરસ ઉપરાંત ઓમિક્રોન વેરીએન્ટ માટે ખૂબ અસરકારક

ઓન્ટેરિયો

ઓન્ટેરિયોના વયસ્કો માટે બિલેવન્ટ કોવિડ-19ના બુસ્ટર ડોઝ માટેની એપોઈન્ટમેન્ટ પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ છે. આ વેક્સીન મૂળ વાઈરસ ઉપરાંત ઓમિક્રોન વેરીએન્ટ માટે પણ ખૂબ અસરકારક સાબિત થઈ છે. આ મહિનાની શરૂઆતમાં જ હેલ્થ કેનેડાએ મોડેર્નાની અપડેટેડ રસીને માન્યતા આપી હતી. સોમવારે સવારે ૦૮.૦૦ કલાકથી

એપોઈન્ટમેન્ટ શરૂ થશે. જો કે, ખાસ કરીને જેમને વધુ શક્યતા હોય, તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. એમને 26મી સપ્ટેમ્બર સુધીમાં ડોઝ આપી દેવામાં આવશે. ત્યારબાદ 18 વર્ષથી વધુના તમામને આવરી લેવામાં આવશે. જેમાં- 70 વર્ષ અને એથી વધુ વયના ઓન્ટેરિયોવાસીઓને તથા લાંબા સમયથી કેર હોમ્સમાં રહેનારા, નિવૃત્ત ઘરોમાં રહેનારા અને વૃધ્ધાશ્રમમાં રહેનારાઓને તેમજ

ફસ્ટ નેશનલ, ઈન્યુટ્રસ અને મેટીસના રહીશોને પ્રાથમિકતા અપાશે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ વયના મૂળ નિવાસી ન હોય, તેમને પણ આવરી લેવાશે. 12 વર્ષથી વધુ વયના એવા લોકોને જેમની પ્રતિકાર શક્તિ ઓછી હોય, તેમને પણ આવરી લેવાશે. 18 વર્ષથી વધુ વયની સગર્ભા સ્ત્રીઓને તેમજ 18 વર્ષથી વધુ વયના હેલ્થકેર કામદારોને પણ આ યોજનામાં આવરી લેવાશે.

બીએપીએસ ચેરિટીઝ આયોજિત વોકમાં 1300થી વધુ નાગરિકો સહભાગી બન્યા



કેનેડાના 13 શહેરોમાં દોડનું આયોજન કરી હોસ્પિટલ માટે ફંડ અકત્ર કરાશે

ઓન્ટેરિયો

ટોરોન્ટોમાં BAPS ચેરિટીઝ દ્વારા 11 સપ્ટેમ્બર 2022ના રોજ વાર્ષિક વોકનું યોજન કરાયું હતું. જેમાં 5 વર્ષથી લઈને વરિષ્ઠ નાગરિકો મળી 1,300થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. BAPS ચેરિટીઝની તમામ પ્રવૃત્તિઓની જેમ, આ ઈવેન્ટ પણ આરોગ્ય પહેલ માટે જાગૃતિ લાવવા અને ભંડોળ એકત્ર કરવા યોજાઈ હતી. વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ એ દેશની સૌથી મોટી સામુદાયિક આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાંની એક છે, જેમાં ત્રણ સંકલિત હોસ્પિટલ બ્રામ્પટન સિવિક, ઈટોબીકોક જનરલ હોસ્પિટલ અને પીલ મેમોરિયલ સેન્ટર ફોર ઈન્ટીગ્રેટેડ હેલ્થ એન્ડ વેલનેસનો સમાવેશ થાય છે.

આ તકે ટોરોન્ટો સિટીના મેયર જહોન ટોરીએ કહ્યું હતું કે, જ્યારે હું અહીં આવું છું અને જોઉં છું કે આ અદભૂત BAPS સમુદાયના મૂળમાં ખરેખર શું છે, જે અન્યને મદદ કરે છે અને અન્યને ટેકો આપે છે ત્યારે હું હંમેશા ખુશ થાઉં છું. વિલિયમ ઓસ્લર હેલ્થ સિસ્ટમ ફાઉન્ડેશનના મેજર ગિક્સ એન્ડ કેમ્પેઈન્સના ડિરેક્ટર, શારી



લવલોકએ કહ્યું, તમે વિલિયમ ઓસ્લર માટે જે કંઈ કર્યું છે તેના માટે હું અમારી ઊંડી પ્રશંસા વ્યક્ત કરું છું. BAPS ચેરિટીઝ ઘણા વર્ષોથી ઓસ્લરના મિત્ર છે. CNIB ફાઉન્ડેશનના ટીમ ઓપરેશન્સના લીડ, કાર્મેલ બ્રોફીએ કહ્યું, CNIB વતી, હું BAPS કોમ્પ્લેક્સમાં અમારું સ્વાગત કરવા બદલ અને તમારા ઉદાર દાન બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું.

યોગેશ પટેલ (પ્રમુખ, BAPS ચેરિટીઝ, કેનેડા)એ જણાવ્યું હતું કે, આ વર્ષે, BAPS ચેરિટીઝ વોક સમગ્ર કેનેડાના 13 શહેરોમાં યોજાઈ રહી છે જેમાં 4,000થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

THINKING OF

BUYING, SELLING OR INVESTING?

આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ્સની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.
મોર્ટગેજ જોઇએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

CALL 416 893 4585 TODAY!!!

SUBHRO CHAKRABORTY
SALES REPRESENTATIVE

SUDHIR PARMAR
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

- Residential
- New Construction
- Investment
- Commercial

MOHAMMAD ABOWATH
SALES REPRESENTATIVE

MAAZ ABOWATH
BROKER - TEAM LEADER

IBRAHIM ABOWATH
SALES REPRESENTATIVE

416 893 4585

ABOWATH

REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

ABOWATH.COM

#1

RE/MAX
CROSSROADS REALTY INC.
#SellWithABOWATH
your Local REALTOR

ટોરન્ટોમાં મંદિરની દીવાલો પર ભારત વિરોધી લખાણથી વિવાદ

ભારતીય ઉચ્ચાયોગે ઘટનાને વખોડી જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગણી કરી

ભારત વિરોધી અને વિવાદિત લખાણથી અમને આઘાત લાગ્યો : મંદિર સંચાલકો

નવીદિલ્હી
ટોરન્ટોમાં સ્વામિનારાયણ મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ લખવામાં આવ્યું હોવાની ઘટના બની હતી. આ ઉપરાંત મંદિરની દીવાલને નુકસાન પણ પહોંચાડાયું હતું. આ ઘટના પાછળ ખાલિસ્તાની સમર્થકોનો હાથ હોવાની પ્રબળ આશંકા છે. બીજી તરફ ભારત સરકારે આ મામલે વિરોધ નોંધાવી ભારતીય ઉચ્ચાયોગે

કાર્યવાહીની માગણી કરી હતી. મંગળવારે ઓટાવા સ્થિત ભારતીય ઉચ્ચાયોગે આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરન્ટો ખાતેના BAPS સ્વામિનારાયણ મંદિરને નુકસાન પહોંચાડીને ભારત વિરોધી લખાણ લખવાની ઘટનાની અમે આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. કેનેડાના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે અને આરોપીઓ સામે

તાત્કાલિક આકરા પગલાં ભરવા આગ્રહ કરવામાં આવ્યો છે. કેનેડાના સાંસદ સોનિયા સિદ્ધુએ આ અંગેની ટ્વિટમાં લખ્યું હતું કે, ટોરન્ટો સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બનેલી દુર્ઘટનાથી વ્યથિત છું. જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. બ્રામ્પટનના મેયર પૈટ્રિક બ્રાઉને જણાવ્યું હતું કે, આ પ્રકારની નફરતને કોઈ સ્થાન નથી.

કેનેડાના ટોરન્ટો શહેર ખાતે બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરના સંચાલકોએ નિવેદન આપી જણાવ્યું હતું કે, મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્વોએ કચેલી ભારત વિરોધી લખાણોથી અમે આઘાત અનુભવીએ છીએ. એક સંસ્કૃતિ-ધામ સાથે બનેલી ઘટના બાદ મહંત સ્વામી મહારાજે સર્વે હૃદયભક્તો અને શુભેચ્છકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. આ વિકટ વેળાએ સહયોગ અને સહાનુભૂતિ આપવા બદલ ભારત અને કેનેડા સરકાર તેમજ તમામ સંસ્થાઓનો અમે આભારી છીએ.

કોરોનાની મહામારી બાદ મહત્તમ નાગરિકોને આર્થિક પ્રવૃત્તિની શોધ

સીઆઈબીસીના સરવેમાં 1500 લોકોએ મંતવ્યો આપ્યા

ટોરોન્ટો

એક નવા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, દેશમાં મહારોગચાળા બાદ કેનેડીયનોને પોતાની આર્થિક પ્રવૃત્તિ માટે ફરીથી વિચારવાની તક મળી છે. અનેક લોકો પોતાના નવા લક્ષ્યાંકો અને નવા કામકાજ શરૂ કરવા માટે વિચારી રહ્યા છે અને એ માટે તેઓ જુદા-જુદા સ્થળોના પ્રવાસનું આયોજન કરી રહ્યા છે. સીઆઈબીસી તરફથી આ અભ્યાસ મારુ / ઓપિનિયન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો. ઓગસ્ટની શરૂઆતમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, 67% કેનેડીયનો કોવિડ-19ના મહારોગચાળા બાદ પોતાની આર્થિક પ્રવૃત્તિઓની પ્રાથમિકતા બદલવાના વિચાર કરી

રહ્યા છે. કોવિડ પ્રતિબંધો પાછા ખેંચાયા બાદ દેશની આર્થિક પ્રવૃત્તિઓ પાછી પાટા ઉપર ચઢી રહી છે. આ અભ્યાસ બાદ અંદાજે 1500 કેનેડીયનોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને તેમના આર્થિક પ્રવૃત્તિઓ બાબતે અભિપ્રાય લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. 2 વર્ષ બાદ આ કેનેડીયનો ફરીથી નવી પ્રવૃત્તિ શોધી રહ્યા છે.

આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, રોગચાળાના આ વર્ષ દરમિયાન અનેક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં 12% લોકોએ તેમના નોકરી-ધંધા અને રહેઠાણ બદલાવ્યાં હતા.

આશરે બે તૃતીયાંશ કેનેડીયનોએ જણાવ્યું હતું કે, આગામી 12 મહિના દરમિયાન કામ માટે પ્રવાસ ખેડવા માંગે છે. જ્યારે 13% કેનેડીયનોએ જણાવ્યું હતું કે, તેઓ મોટેપાયે ખરીદી કરવા ઈચ્છે છે.



મહેમાનોને સત્કાર, પ્રીતિભોજન તથા અંતાક્ષરી જેવા કાર્યક્રમો યોજાયા

GSSMની બીજી વોલ્કથોન સાથે પિકનિક: હોસ્પિટલ માટે દાન એકત્ર

મિસિસાગા

11 સપ્ટેમ્બરે રવિવારે યોજાઈ હતી. સવારે 8:30 વાગ્યે મિસિસાગા વાલી બુલેવાડ, ઓન્ટેરિયો મિસિસાગા ખાતે સૌ સભ્યો એકત્ર થયા હતા. ટુરના આયોજક અને THPF હોસ્પિટલની FUNDRAISING કમિટીના સભ્યો કનુભાઈ, કલાબેન અને દિલીપભાઈ પટેલે સૌ સભ્યોને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ બ્રેકફાસ્ટમાં ઢોકળા, ચા અને કોફીનો સ્વાદ માણ્યા બાદ સૌ પાંચ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા. જે બાદ દિલીપભાઈ પટેલે સૌને આવકારી મહેમાનોનો સત્કાર કર્યો હતો. દિલીપભાઈએ જણાવ્યું હતું કે, 2019 ઓક્ટોબરથી અત્યાર સુધી આપણે \$ 440,400 ડોલર ઉભા કર્યા છે જે લોકોનું ડોનેશન છે. આ વર્ષ Walkathonનો અમારો ગોલ \$ 20,000 ડોલર એકત્રિત કરવાનો હતો. અત્યાર સુધી અમે \$ 13,000 ડોલર જેટલું ફંડ એકત્રિત કર્યું છે અમને લાગે છે, અને પૂરી આશા છે કે અમે \$15 હજાર ડોલર એકત્રિત કરી શકીશું.

દિલીપભાઈ પટેલે જણાવ્યું કે કલ્યાણીબેન પટેલના ગ્રાન્ડ ચિલ્ડ્રન મીરા, મૈથિલી, શ્રીના

અને રિષભે પોતાના બચાવેલા પોકેટ ખર્ચના પૈસા હોસ્પિટલ માટે દાન કર્યું છે. તથા પ્રભાબેન ગુલાબભાઈ પટેલના ગ્રાન્ડ ચિલ્ડ્રન મિલાન અને રાધિકાએ જરૂરી અને સુંદર કોસ એટલે કે જીએસએસએમ દ્વારા આયોજિત Walkathonને સપોર્ટ કર્યો છે. આ તકે રજનીભાઈ તથા શ્રીવીણાબેન પટેલે એક હજાર ડોલરનું donation THPF માટે અને એક હજાર ડોલરનું જીએસએમ ઈવેન્ટ સ્પોન્સરશિપ માટે અને કલ્પનાબેન પટેલે એક હજાર ડોલર જીએસએમની ઈવેન્ટ સ્પોન્સરશિપ માટે આપ્યા હતા. મહેમાનો દીપીકા ડમેરલા (City councillor ward 7), દિપક આનંક (MP Dr. Farida Atcha-Physician at THP)ની હાજરીમાં કાર્યક્રમ આગળ ધપ્યો હતો. વોલેન્ટિયરના પિક્ચર ચંપકભાઈ ટેલરે લીધા હતા. વોકમાં મેમ્બર અને નોન મેમ્બરે ખૂબ જ સારી રીતે ભાગ લીધો હતો. બપોરે ખીચડી, રીંગણ બટાકાનું શાક, સારેવડા, પુરી, બુંદીના લાડવા તથા છાશ પીરસવામાં આવ્યા હતા. અંતે ભાઈઓ અને બહેનો અંતાક્ષરી રમ્યા હતા.

DIPTESH PATEL
+1 (647) 409-2976

Travel Services Off: 905-790-8989

ONE-WAY SPECIAL FESTIVAL OFFERS

ETIHAD	TORONTO TO AHMEDABAD (ETIHAD AIRWAYS - ONE STOP)	
03 DEC	TORONTO	AUH → AMD
31 DEC	TORONTO	AUH → AMD
01 JAN 2023	TORONTO	AUH → AMD

TORONTO TO BOMBAY (ETIHAD AIRWAYS - ONE STOP)	
05 DEC	TORONTO → AUH → BOM
10 DEC	TORONTO → AUH → BOM

ONE-WAY SPECIAL RATES FROM BOMBAY TO TORONTO

NOW HIRING **NOW HIRING**

(KL878 BOM-AMS)	KLM		(KL691 AMS-YYZ)
16 DEC	BOM	AMS	TORONTO
20 DEC	BOM	AMS	TORONTO
13 JAN 2023	BOM	AMS	TORONTO
16 JAN 2023	BOM	AMS	TORONTO

WITH 2 BAGGAGE 23KG EACH
All tickets are non refundable and non Changeable Condition Apply*

tico.ca | travelservices@bellnet.ca | IATA

2565 Steels Ave. E., Unit #20, Brampton, ON, L6T 4L6

SUPER VISA MEDICAL INSURANCE Up to 45% DISCOUNT with deductible

VISITOR TO CANADA INSURANCE

LIFE INSURANCE

MORTGAGE /LINE OF CREDIT INSURANCE

AGE	\$ 250,000		\$500,000		\$1000,000	
	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female	Male & Female
30 Yrs	\$ 8.00	\$ 12.00	\$ 11.00	\$ 18.00	\$ 20.00	\$ 27.00
40 Yrs	\$ 11.00	\$ 15.00	\$ 14.00	\$ 21.00	\$ 25.00	\$ 36.00
50 Yrs	\$ 25.00	\$ 35.00	\$ 32.00	\$ 45.00	\$ 60.00	\$ 85.00
60 Yrs	\$ 60.00	\$ 80.00	\$ 107.00	\$ 150.00	\$ 190.00	\$ 236.00

Rates Quotes are Preferred Plus Non Smoker Term 10 With Medical Test & Rates are Subject to Change.

- NO MEDICAL TEST LIFE INSURANCE (up to age) **85**
- LIFE INSURANCE FOR REFUGEES, STUDENTS, KIDS, ON WORK PERMIT
- GURANTEED MONEY BACK (Life, Critical Illness & Disability Insurance)
- Corporate owned Life and Critical Insurance
- Key Person Insurance • RRSP • RESP • TFSA

Davinder Singh Chawla
TOLL : 1866.623.0865

Call For **HONEST ADVICE 416.320.4614**
www.financialhuttltd.co Email : - Davindersinghfh@gmail.com



તંત્રી સ્થાનેથી

કવીન એલિઝાબેથ: રાજવીપણાનું ઔચિત્ય જાળવનારી પ્રતિભા

ખ્રિટનની મહારાણીએ જીવનના સાડા નવ દાયકા જીવને ગત ગુરુવારે અંતિમ શ્વાસ લીધો. કવીન એલિઝાબેથ બીજાં જ્યારે 25 વર્ષનાં હતાં ત્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું નિધન થયું અને 1952માં તેમણે ખ્રિટન રાજની ગાદી સંભાળી હતી. જે બાદ છેલ્લા શ્વાસ સુધી તેમણે એ જવાબદારી નિભાવી. દુનિયાના ઇતિહાસમાં કદાચિત કોઈ મહિલાએ આટલું લાંબું શાસન કર્યું હોય, એવું એલિઝાબેથના



તંત્રી - સ્વદેશ

કિસ્સામાં જ છે.

ખ્રિટનના ૧૫ વડા પ્રધાન સાથે પણ તેમણે કામ કર્યું અને ગયા અઠવાડિયે ઓક્સિસમાં પ્રવેશેલા લિઝ ટ્રસના આગમન વખતે તે જ ખ્રિટનના સૌથી ઉચ્ચ રાજવી પદે હતાં. અમેરિકાના 14 પ્રમુખોમાંથી 13ને તે મળ્યાં છે અને અનેક રાજવી પ્રસંગોથી માંડીને રાજ્ય સંબંધિત કાર્યક્રમો માટે વિવિધ રાષ્ટ્રો, રાજ્યોની મુલાકાતો લીધી છે. કવીન એલિઝાબેથે ઇતિહાસ રચ્યો છે. ખ્રિટનની ૧૦૦૦ વર્ષ જુની રાજગાદી ઉપર સૌથી લાંબો સમય શાસન કરનાર કવીન એલિઝાબેથનું જીવન એટલે કે એવી વાસ્તવિક જીવન પણ ઉતાર ચઢાવવાળું રહ્યું છે. કવીન એલિઝાબેથ બીજાં ગાદી ઉપર હતાં તે દરમિયાન અનેક ઘટનાના તેઓ સાક્ષી રહ્યા. અનેક યુદ્ધો જોયાં, મંદી જોઈ, પડી ભાંગતી અર્થ વ્યવસ્થા જોઈ, મહામારીઓ જોઈ, બ્રેકિંગ સુદાં જોઈ. ખ્રિટનનાં વડાપ્રધાન માર્ગારેટ થેચર અને કવીન એલિઝાબેથ વચ્ચેના સંબંધો ખુબ જટિલ હતાં. 11 વર્ષ સુધી ખ્રિટનના વડાપ્રધાન રહેલાં માર્ગારેટ થેચર અને ખ્રિટનના રાણી વચ્ચે હંમેશા બહુ ડ્રાય અને ઔપચારિક સંબંધો રહ્યા. સામાન્ય રીતે કવીન હંમેશા રાજકારણથી પોતાને દુર રાખતા. પરંતુ જ્યારે તેમને લાગતું હતું કે વડાપ્રધાન 'અનકેરિંગ' છે. ત્યારે તેઓ પોતાનું વલણ સ્પષ્ટ કરતા.

દક્ષિણ આફ્રિકા પર શાસનના મામલે રંગભેદી નીતિ અને તેને લગતા પ્રતિબંધો લાદવાનો માર્ગારેટનો કટ્ટર ઈન્કાર કવીનને ગમ્યો ન હતો. તેમને લાગતું હતું કે થેચર કારણ વગર વિવાદ ઉભા કરી રહ્યા છે. વડાપ્રધાન માર્ગારેટ થેચર આવા કોઈ પ્રતિબંધોની તરફેણમાં નહોતા. જેનાથી શ્વેત અને અશ્વેત વચ્ચેનો અલગાવ ચાલુ રહે, આ મામલે તે બીજા કોમનવેલ્થ દેશોની સાથે સંમત નહોતા. મીડિયામાં અવારનવાર થેચર અને કવીન વચ્ચેના તંગ સંબંધો વિશે લખાયાં. જો કે થેચરે પોતાની આત્મકથામાં નોંધ્યું હતું કે, મીડિયાએ ભલે એમ સાબિત કરવાનો પ્રયાસ કર્યો કે ડાઉનિંગ સ્ટ્રીટ અને પેલેસ વચ્ચે વિખવાદો છે. પણ કવીને સરકારના કામ પ્રત્યે હંમેશા યોગ્ય અભિગમ રાખ્યો. આ તો રાજકારણ અને રાજવી વચ્ચેના સંબંધોની વાત હતી. પણ દીકરા ચાર્લ્સની પત્ની પ્રિન્સેસ ડાયના સાથે કવીનના સંબંધો પણ હંમેશા ચર્ચાનો વિષય રહ્યા. પ્રિન્સ ચાર્લ્સ પહેલેથી જ કેમિલા પાર્કર સાથે સંબંધોમાં હતા. આમ છતાં પણ ડાયના સાથે તેમણે લગ્ન કર્યાં. ડાયના ડિપ્રેશન અને બુલિમિયાનો શિકાર બની.

તેના વહેવાર પ્રત્યે સમયાંતરે કવીન એલિઝાબેથનું વલણ બદલાયું, તે તેને અમુક હદે સમજ્યા અને તેમની વચ્ચેનો સંબંધ બહેતર બન્યો. ડાયનાએ રોયલ બાયોગ્રાફર ઈનગ્રિડ સીવોર્ડને એમ પણ કહ્યું હતું કે તેનાં સાસુ વિશ્વના શ્રેષ્ઠ સાસુ છે. પણ પ્રિન્સ ચાર્લ્સ સાથે સંબંધ બગડ્યા એટલે સાસુમા સાથે પણ સમસ્યા સર્જાઈ. ડાયનાના વધુ પડતા સંવેદનશીલ સ્વભાવ સામે કવીન એલિઝાબેથને વાંધો હતો.

તે બન્ને આગવી પ્રતિભા ધરાવનારી સ્ત્રીઓ હતી અને ક્યારેય એકબીજા સાથે મોકળાશથી વાત ન કરી શકી. કવીન કહેવાયુ કે તે ઘરની સમસ્યાઓ ઉકેલવાની માથાકુટને બદલે કામમાં વ્યસ્ત રહેવાનું તેઓને ગમતુ હતુ. ડાયના પ્રિન્સ ચાર્લ્સથી છૂટી પડી અને તેનું મોત થયું તે પછી તેને રોયલ ન ગણવાની રાજવી પરિવારની જડતા પણ લોકોને કઠી ગઈ.

કવીન એલિઝાબેથે તેના જીવનકાળ દરમિયાન જેટલું રાજવીપણું જાળવ્યું, તેટલું કદાચ બીજા કોઈએ હજી સુધી જાળવ્યું નથી. કવીન એલિઝાબેથ આખી દુનિયાનાં રાણી હતાં એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આકસ્મિક રીતે જ રાજગાદી ઉપર સ્થપાયેલાં લિલિબેટ, કવીન એલિઝાબેથ બીજાંનું ટાઈટલ સ્વીકારીને બહુ શાલિનતાથી, નિષ્ઠાથી તો ક્યારેક રાજવી જડતાથી પોતાના નાગરિકો માટે પોતાનું જીવન અર્પી દીધું. આખી દુનિયામાં પહેલાંની સરખામણીએ રાજવીઓનું શાસન હવે ઘણું ઓછું થયું છે. આજે પણ વિશ્વમાં 44 મોનાર્કીઝ છે જેમાંથી 13 એશિયામાં છે, 12 યુરોપમાં છે, 10 ઉત્તર અમેરિકામાં છે, 6 ઓશિયાનામાં છે અને આફ્રિકામાં છે. દક્ષિણ અમેરિકામાં કોઈ મોનાર્કીઝ નથી. જ્યારે ખ્રિટને રાજાશાહીમાંથી લોકશાહી તરફનો બદલાવ સ્વીકાર્યો ત્યારે પણ મોનાર્કી - એટલે કે રાજાશાહી એક બંધારણીય આવશ્યકતા હતી.

ખ્રિટનના મામલે વડા પ્રધાન સરકારના વડા છે પણ રાષ્ટ્રના વડા નથી. તેઓ રાજકારણથી પણ ઉપર છે અને રાષ્ટ્રના મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. એક રિપોર્ટ અનુસાર કવીનનાં એક બાળપણનાં મિત્ર સોનિયા બેરીએ એક સમયે કહ્યું હતું કે, “શક્ય હોત તો કવીન એલિઝાબેથ બીજાંને પોતાને માટે બહુ જુદી જિંદગી પસંદ કરી હોત. મોકો મળ્યો હોત તો તે લગ્ન કરી, પોતાનાં કુતરાં અને અશ્વો સાથે શાંતિથી રહ્યા હોત. સત્તા પર, ટોચ પર - જિંદગી સતત એકલવાઈ હોય છે, ભલેને તમે રાણી શું કામ ન હો.”

હવે ખ્રિટનમાં કિવન એલિઝાબેથના નિધન બાદ દફનવિધી હજુ થઈ નથી. પ્રિન્સ ચાર્લ્સ કિંગ તો બની ગયા પણ તેમનો રાજ્યાભિષેક હજુ બાકી છે. આવા સસમયે જ ખ્રિટનમાં રાજાશાહીને નાબૂદ કરવા માટે પણ ઝુંબેશ શરૂ થઈ છે. ખ્રિટનની રાજધાની લંડન સહિતનાં શહેરોમાં ‘નોટ માય કિંગ’ એટલે કે ‘મારો રાજા નહીં’ અને ‘એબોલિશ ધ મોનાર્કી’ એટલે કે ‘રાજાશાહી નાબૂદ કરો’ લખેલાં પ્લેકાર્ડ સાથે લોકો દેખાવો કરી રહ્યા છે. ઘણાં પ્લેકાર્ડ પર એવાં પણ લખાણ છે કે, રાજા પોતાની સત્તા અને સંપત્તિ સાચવવા જ સક્રિય હોય છે, તમારી સેવા નથી કરતા. જો કે, ખ્રિટનમાં શરૂ થયેલી આ ઝુંબેશને ડામવા સરકાર ગંભીર બની છે. દેખાવો રોકવા માટે સરકારે પોલીસને તમામ પગલા ભરવા પણ ફરમાન કરી દીધું છે. તેના કારણ વળી નવી મોકાણ મંડાઈ છે. ખ્રિટનમાં પણ હવે ફીડમ ઓફ એક્સપ્રેશન એટલે કે અભિવ્યક્તિની આઝાદી નથી રહી એવો દેકારો શરૂ થયો છે. ખ્રિટનમાં અભિવ્યક્તિની આઝાદીનો મુદ્દો બહુ સંવેદનશીલ છે. ખ્રિટિશ પ્રજા પોતાની લોકશાહી પરંપરા માટે અને અભિવ્યક્તિની આઝાદીના જતન માટે ગર્વ અનુભવે છે. લોકોને પોતાના વિચારો સ્વતંત્ર રીતે વ્યક્ત નથી કરવા દેવાતા એવી ઇાપ પડે તો ખ્રિટનમાં નવું કમઠાણ ઉભું થઈ જાય તેથી એલિઝાબેથ ટ્રસની સરકાર બહુ સખ્તાઈથી વર્તી નથી શકતી. અત્યાર સુધીમાં આંગળીના વેટે ગણાય એટલા લોકોની જ ધરપકડ કરાઈ છે.

Manoj Gadh

manoj1968@yahoo.ca



ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice



✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach



✓ Bedbug

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



✓ Animal Control



✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates





CALL SANKET TRIVEDI - 647.339.3926

Government Licensed Structural Exterminator



DIVINE YOGA

By Geeta

Children Yoga Class

Every Tuesday 5-6 PM

Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join today on ZOOM!

: Classes Available :
One to One Individual
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at
divineyogabygeeta@gmail.com
IG & FB: @divineyogabygeeta



હિન્દી પ્રાદેશિક ભાષાની પ્રતિસ્પર્ધા નહીં, સખી છે: ગૃહમંત્રી અમિત શાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હિન્દીના ઉપયોગ પર ભાર મૂકાયો સુરત

સુરતમાં પહેલીવાર યોજાયેલા અખિલ ભારતીય રાજસભા સંમેલનમાં કેન્દ્ર સરકારના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે હિન્દી પ્રાદેશિક ભાષાની પ્રતિસ્પર્ધા નહીં, સખી છે. આઝાદીના અમૃત મહોત્સવની જ્યારે ઉજવણી થઈ રહી છે ત્યારે આગામી 25 વર્ષોમાં આપણો દેશ કોઈ પણ ભાષાની લઘુતાગ્રંથિમાં ન બંધાઈ રહે તે સૌથી મહત્વપૂર્ણ છે.



હિન્દીને પ્રાથમિક શિક્ષણમાં જ સ્વભાષા તરીકે ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. હવે આગામી સમયમાં મેડિકલ સહિત એન્જિનિયરિંગના અભ્યાસક્રમ પણ રાજભાષા હિન્દીમાં ભણાવવામાં આવશે જેનાથી છેવાડા વિદ્યાર્થીઓને પણ સીધો લાભ મળશે. હિન્દીને રાજભાષા તરીકે સ્વીકાર કરવાની સાથે-સાથે યુવાઓમાં હિન્દી પ્રત્યે જે લઘુતાગ્રંથિ તે દુર કરવાનો સમય પાકી ગયો છે. હિન્દી ભાષાના મુળાક્ષરો આજે દેશ-દુનિયાની 70થી વધુ ભાષાએ સ્વીકાર કર્યા છે.

સુરતના ઈન્ડોર સ્ટેડિયમમાં હિન્દી દિવસ સમારોહ અને દ્વિતીય અખિલ ભારતીય રાજભાષા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય મહેમાન અમિત શાહે કહ્યું હતું, ખુદ મહાત્મા ગાંધીજી પણ હિન્દી વિના આપણા રાષ્ટ્રને મુંગુ ગણતા હતા ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 હેઠળ રાજભાષા

વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ: સુરતના દિવ્યાંગ મોરેએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

કિર્ગીસ્તાનમાં વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિવ્યાંગ મોરે દ્વારા ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને દેશને ગોલ્ડ મેડલ અપાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે. કિર્ગીસ્તાનમાં ચાલી રહેલી વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પાકિસ્તાન, ઉજબેકીસ્તાન, સિરીયા, ઈરાક, ઈરાન, અફઘાનિસ્તાન, કિર્ગીસ્તા, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા 14-15 દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં પહેલા જ દિવસે

ભારતનું પ્રતિનિધિત્વ કરતા સુરતના દિવ્યાંગ મોરેએ દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતના દિવ્યાંગ મોરેએ સ્ટ્રેન્થ લિફ્ટિંગ 68kg ગ્રુપમાં ટોટલ 547.5 kg વજન ઊંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિવ્યાંગ મોરે એ 547.5kg વજનો રેકોર્ડ સાથે વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગમાં 480kg ટોટલ હાઈએસ્ટ વજન વર્લ્ડ રેકોર્ડ તોડી પોતાના નામે ન્યૂ 547.5kg વજનો રેકોર્ડ કરી સુરત ગુજરાતનું નામ રોશન કર્યું છે. દિવ્યાંગ મોરે એક જિમ ટ્રેનર છે. આ ઉપરાંત સુરતમાં થોડા સમય પેલા નેશનલ પાવર લિફ્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મેલ અને ફિમેલ આ બે કેટેગરી છે.

Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial
24 Hour Service • 7 Days a Week

Preventing the Spread of COVID-19 :
Our disinfectant services that we offer are:

1 Spray Services

2 Fogging Services

3 Sanitation Services

All Pest Control:
Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants.
Total Interior & Exterior Pest Control

Removal:
Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornets, Yellow Jackets

First Time Customer gets
10% Off
on your first home service
*Mention this offer while booking

Free Estimates &
Written Guarantee

Special Service For Bedbug Control
www.imperialpestcontrol.ca
info@imperialpestcontrol.ca
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820

ગોવર્ધનથાળ

સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

Weekend Special

રગડા પેટિસ, પાંઉભાજી,
છોલેપુરી, કટલેસ,
ખાસ્તા કચોરી,
સેવ ઉસળ, સમોસા ચાટ

Takeout & Catering

Limited થાળી
(with sweet & Farsan)

\$9.00 +Tax

Limited થાળી
(without sweet & Farsan)

\$7.50 +Tax

CATERING SPECIAL

\$ 14.99 10 items
+Tax
Sweet, Farsan, Subji,
Kathor, Puri, Dal, Rice
Papad, Pickle, Kachumber

સ્પેશિયલ ડીલ ફોર નવરાત્રિ, ગરબા ઇવેન્ટ

દાબેલી
\$ 1.25/Each

વડાપાંઉ
\$ 1.25/Each

પાપડીનો લોટ
\$ 1.25/Each

Call us for details

Franchise
Opportunity
in GTA

રસોઈકામ
કરી શકે તેવા
બહેનોની જરૂર છે.


ફોન નં: ૪૧૬-૪૩૮-૦૫૪૪ ૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧

૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2

બેચરાજી તાલુકામાં કુવાના ખોદકામ વેળા ભગવાન બુદ્ધની દુર્લભ મૂર્તિ મળી આવી સયાજીગંજમાં મગરનો વધુ એક હુમલો : યુવકને લોકોએ બચાવ્યો

મહેસાણા

બેચરાજીના ગાલુ ગામમાં આવેલા ઠાકોર વાસમાં કાંતિજી ધુળાજી ઠાકોરના ઘર પાસે કૂવો ખોદવાની કામગીરી કરવામાં આવી હતી. કૂવા માટે 10 ફૂટ સુધી નીચે ખોદાણ કરવામાં આવ્યું હતું. ત્યાં અચાનક ખોદકામ કરતા લોકોના ઓજારો પર પથ્થર જેવું કંઈક ટકરાયું હતું. જેથી તેઓએ વધુ ખોદકામ કરીને પથ્થર બહાર કાઢ્યા હતા. તેમણે પથ્થરને બહાર કાઢીને ધ્યાનથી જોયું તો તે ભગવાની મૂર્તિઓ લાગી હતી. તેઓએ મૂર્તિઓને બરાબર સાફ કરી ત્યારે



બહાર પડી કે આ ભગવાન બુદ્ધની મૂર્તિઓ હતી.

કુવાના ખોદકામ દરમિયાન સફેદ અને કાળા કલરની ભગવાન બુદ્ધની આરસની મૂર્તિઓ મળી આવી હતી. આ અંગે ગામના સરપંચને જાણ કરવામાં આવી હતી. તેઓ પણ

પોલીસ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેથી પોલીસની હાજરીમાં જેસીબીની મદદથી મૂર્તિઓ બહાર કાઢવામાં આવી હતી. જેમાં ભગવાન બુદ્ધની મૂર્તિઓ ખંડિત હોવાનું દેખાયું હતું.

જોકે, આ મૂર્તિઓ પ્રાચીન મૂર્તિઓ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું. ભગવાન બુદ્ધની મૂર્તિઓ સાથે અન્ય ચીજવસ્તુઓ પણ મળી આવી છે. ત્યારે હવે આ મૂર્તિઓને પુરાતત્વ વિભાગમાં સોંપવામાં આવે તો આ મૂર્તિઓ કેટલી જૂની છે તેની યોગ્ય માહિતી મળી શકશે.

વડોદરા

વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં મગર સાથે ફાઈટ બનાવો બનતા હોવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવા જ એક બનાવમાં ગંભીર રીતે ગવાયેલા યુવકને સારવાર માટે સયાજી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ત્રણ દિવસ પહેલા કલાલીના એક મકાનની બહાર 13 ફૂટના વગેરે હતો. જેને કારણે બાળકો અને પરિવાર ગભરાઈને ઘરમાં પુરાઈ રહ્યો હતો. આ મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.

સયાજીગંજ વિસ્તારમાં વિશ્વામિત્રી નદી નજીક આવેલી ફાસ્ટ ટ્રેક કોર્ટની સામે મગર અને એક યુવક વચ્ચે ફાઈટ થઈ હતી. મગરે યુવક ઉપર હુમલો કરતા તેણે બચવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મગર તેને કરી દીધો હતો અને નદીમાં ખેંચી ગયો હતો.

આ દ્રશ્યને નજરે જોનાર એક મહિલાએ બૂમાબૂમ કરી મુકતા અકોટા વિસ્તારના યુવકો દોડી આવ્યા હતા. જે બાદ લાકડીઓ તેમજ પથ્થરથી પ્રતિકાર કરાતા યુવકને મગરના મોંઢામાંથી છોડાવાયો હતો. અને 108ની મદદથી ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગૃહબંધન તૂટ્યું: આપ પાર્ટી દેશમાં બાપ બનવા જઈ રહ્યાનો BTPનો આક્ષેપ

વડોદરા

ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભાજપના સહકારથી જ બાપ બનવા માંગી રહ્યો છે અને દેશમાં ટોપી વાળા ઓ પાઘડી વાળાઓને હેરાન કરી રહ્યા છે જેને ધ્યાનમાં રાખી હવે આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બી.ટી.પી આપ સાથે ગૃહબંધ તોડી બિટીપી હવે એકલા હાથે ચૂંટણી લડશે એવો ખુલાસો જાતે બિટીપી સંયોજક અને આદિવાસીઓ મસીહા ગણાતા છોટુભાઈ વસાવાએ કર્યો છે. તેમનું માનવું છે કે આપ ગૃહબંધન જે કર્યું તેમાં તેઓ ટોપી પહેરીને આવી જાય છે જે સંસ્કૃતિ નથી આ સાથે મને એવું લાગે છે કે આ ટોપીવાલાથી ચેતવા જેવો છે. ગુજરાતમાં ચાર્ટર પ્લેન લઈને આવે છે.

વડોદરામાં પ્રેમિકાના ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મળેલા પ્રેમીનું મોત

મૃતદેહની પોસ્ટમોર્ટમ કરાયું, શકમંદોની પૂછતાછ હાથ ધરાઈ

વડોદરા

પ્રેમિકાના ઘરેથી લોહી લુહાણ હાલતમાં મળી આવેલ 24 વર્ષીય યુવકનું મોત નીપજતા મૃતકના પરિજનોએ યુવતી સહિતના સંબંધીઓ સામે શંકા ઉપજાવી પોલીસ પાસે તટસ્થ તપાસની માંગ કરી છે. હાલ યુવકનું મોત ખરેખર કઈ રીતે થયું તે દિશામાં પોલીસે મૃતદેહની પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી શકમંદોની પૂછતાછ હાથ ધરી છે.

નવાપુરા રહેતા કનૈયાલાલ સોલંકીનો 24 વર્ષીય પુત્ર હર્ષ સોલંકીને વિસ્તારમાં જ રહેતી સમાજની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે અંગે બંનેના પરિવારજનોને જાણ હતી. ગઈકાલે

તે યુવતીને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ દરમિયાન રાત્રે અઢી વાગ્યાના સુમારે કથિત ઘટના ઘટી હોવાના મેસેજ મળતા યુવકના પરિવારજનો યુવતીના ઘરે દોડી ગયા હતા. જ્યાં હર્ષ લોહી લુહાણ હાલતમાં બેભાન અવસ્થામાં જમીન પર નજરે ચડ્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં સાડા ત્રણ વાગ્યાના સુમારે હર્ષને મૃત જાહેર કરાયો હતો. મૃતકના પરિવારજનોએ યુવતીના સંબંધી સામે શંકા ઉપજાવતા પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી શકમંદોની અટકાયત સાથે પૂછપરછ શરૂ કરી હતી.

સચિવાલય સામે પૂર્વ સૈનિકોનો મોરચો, આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ

ગાંધીનગર

72 વર્ષના પૂર્વ સૈનિક કાનજીભાઈ મોથલિયાના મૃત્યુ બાદ પોલીસ અને આંદોલનકારી વચ્ચે કલાકો સુધી સમજાવટને અંતે સોમવારે મોડી રાતે પરિવારજનોએ મૃતદેહ સ્વિકાર્યો હતો. બીજી તરફ સિવિલ કેમ્પસમાં એકત્ર થયેલા પૂર્વ સૈનિકોએ રાતે જ સચિવાલયના ગેટ નંબર એકની સામે મોરચા બંધી કરીને અમરાણાંત ઉપવાસ શરૂ કર્યા છે. એટલું જ નહિ, સરકાર વિરોધી સૂત્રોચ્ચાર અને આક્રોશ ઠલવાતા પોલીસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. 36 કલાકના ઘટનાક્રમ પછી પણ સરકાર તરફથી માંગણીઓ મુદ્દે ચર્ચા, આશ્વાસન માટે આગેવાનોને બોલાવવામાં ન આવતા પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોમાં ભારે રોષ ભભૂક્યો છે.



UNLOCK HIDDEN GEMS IN REAL ESTATE

CALL US TO FIND PROPERTY WITH POSITIVE CASH FLOW

ZIVASA
Realty Inc., Brokerage

647.972.1000

www.zivasa.com



Bhagat Dhull



Bharat Batra



Harit Gaba



Himanshu & Anshu Batta



Rajiv Arora

Rajesh Khurana
Broker

રાજકોટ જિલ્લામાં ઉમેદવારોનું ભાવિ 29 વર્ષ સુધીના મતદાર સમૂહ ઉપર નિર્ભર

રાજકોટ જિલ્લામાં 23 લાખમાંથી હવે 4.69 લાખ મતદારો 18થી 29ની વયનાં

રાજકોટ

રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભાના આઠ મત વિસ્તારોમાં વર્ષ 2021ના પ્રારંભે 18થી 19 વર્ષનાં વયજૂથમાં 14760 અને 20થી 29 વર્ષનાં વયજૂથમાં 409722 મતદારો નોંધાયેલાં હતા. વર્ષ 2022નાં આરંભે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા થઈ એ પછી નવા 27887 મતદારો ઉમેરાયા છે. તેથી મતદારો 419631 થવા પામ્યા છે. તેથી મતદારો 419631 થવા પામ્યા છે. બંને એઈજગુરુપનાં મળીને મતદારસંખ્યા એક વર્ષમાં વધીને 424482 માંથી

કુલ 447518 સુધી પહોંચી હતી. એ પછી, તાજેતરમાં મતદારયાદીની ખાસ સુધારણા કરીને નવાં નામો ઉમેરાવાતાં અને 1 ઓક્ટોબર સુધીમાં 18 વર્ષ પૂર્ણ કરનારાઓને પણ સમાવી લેવામાં આવતાં 20થી 29ના વયજૂથમાં 10250 તથા 18થી 19વર્ષનાં ગુરુપમાં 12091(બંનેના મળીને કુલ 22341) મતદારો વધ્યા છે, જેને લીધે હવે 18થી 29 વર્ષની વયવાળા મતદારોની સંખ્યા 469859 થવા પામી છે. આવી આંકડાકીય ભાંજગડને બાજુ પર

મૂકતાં પણ એટલી વાત ચોક્કસ છે કે રાજકોટ જિલ્લાની અંદાજિત 23.0૫ લાખની કુલ મતદાર સંખ્યામાં આ બંને વયજૂથવાળા યુવા મતદારોનું પ્રમાણ 20.37 ટકા થાય છે. કુલ વસતી સાપેક્ષ તેમનું પ્રમાણ 21.82 ટકા મનાય છે. અલબત્ત, 30થી 39 અને 40થી 49ના વયજૂથની મળીને મતદાર ટકાવારી અને સંખ્યા ઉક્ત બંને જૂથ કરતાં પણ વધારે થવા જાય છે. આ મતદારો ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવે તેવી શક્યતા વધુ છે.

રાજકોટ-69 બેઠકમાં વિજય રૂપાણીનું નામ કમી થતા નવા ઉમેદવારની શોધ

રાજકોટ

પક્ષ ટિકીટ આપશે તો રાજકોટ-69માં ચૂંટણી લડીશ તેમ તાજેતરમાં નિવેદન આપનાર વિજય રૂપાણીને ભાજપે ગુજરાતથી દૂર દૂર પંજાબમાં પ્રભાર સોંપ્યો છે ત્યારે આ ભાજપ માટે અતિ મહત્વની આ બેઠક માટે કોઈ નવા પણ ભાજપમાં જુના નેતાઓ માટે માર્ગ મોકળો થયો છે અને સક્ષમ પ્રતિષ્ઠિત ઉમેદવાર પર મંજૂરીની મ્હોર મારવા પ્રક્રિયા હાથ ધરી છે. આ બેઠકનું સૌરાષ્ટ્ર સહિત રાજ્યના રાજકારણમાં ખાસ્સુ મહત્વ રહ્યું છે, કોંગ્રેસ તરફી

પવન વખતે ઈ.સ.૧૯૭૫થી ૧૯૮૦ આ બેઠક પર શહેરમાં આજે પણ ખૂબ આદરથી નામ લેવાય છે તે જનસંઘના સ્વ.અરવિંદ મણિયાર જીત્યા હતા. ઈ.સ.૨૦૧૨માં રાજકોટ-૨ કહેવાતી આ બેઠકનું નવા સીમાંકન સાથે રાજકોટ (પશ્ચિમ)-૬૯ એવું નામકરણ થયું છે અને સતત બે ટર્મ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેના પર જીત્યા છે. બેઠકના ઈતિહાસમાં એકમાત્ર ઈ.સ.૧૯૮૦-૧૯૮૫ ટર્મ માટે જ કોંગ્રેસના મણીભાઈ રાણપરા આ બેઠક પર જીત્યા હતા.



સૌરાષ્ટ્રનાં 32 જળાશયોમાં પાણીની ભારે આવક, વધુ 4 ડેમ ઓવરફ્લો થયા

રાજકોટ

સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં સારા વરસાદથી 32 જેટલા ડેમોમાં અર્ધા ફૂટથી અઢી ફૂટ સુધીની પાણીની આવક નોંધાઈ છે જ્યારે ઉપલેટા પાસેનાં મોજ સહિતનાં વધુ પાંચ જેટલા જળાશયો ઓવરફ્લો થતા હેઠવાસનાં અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વર્ષે મેઘરાજા મહેરબાન થતા મોટા ભાગનાં જળાશયો ભરાઈ જતાં લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શિયાળુ અને ઉનાળુ પાક માટે પણ ઉજળુ ચિત્ર ઉપસ્યુ હોય ખેડૂતોમાં ખુશી છે. રાજકોટ જિલ્લાનાં સિંચાઈ વિભાગ હસ્તકનાં 27 માંથી ભાદર - 1 અને ભાદર - 2 સહિત 18 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે જ્યારે કુલ સંગ્રહશક્તિનાં 96 ટકા જીવંત જથ્થો હાલ છે.

પ્રાચીતીર્થમાં ભાદરવા મહિને પિતૃતર્પણ કરવા માટે ઉમટી રહેલા ભાવિક-ભક્તો

પ્રાચી

પ્રાચીતીર્થનું અનેરું મહત્વ હોવાથી પ્રાચી તીર્થમાં પિતૃમાસ જેમકે કારતક માસ, ચૈત્ર માસ, ભાદરવા માસ દરમિયાન યાત્રિકોનો ભારે ધસારો રહે છે. પ્રાચી તીર્થમાં હાલ પણ ભાદરવા માસ નિમિત્તે પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણ વિધિ કરાવવા તેમજ મોક્ષ પીપળે પાણી રેડવા યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

લોકવાયકા અને પુરાણજ્ઞાની પંડિતોનાં મત પ્રમાણે, પ્રાચીતીર્થની પવિત્ર ભૂમિ પરથી પસાર થતી પવિત્ર સરસ્વતી નદી વહે છે. જે જગતની એક માત્ર નદી છે, જે પૂર્વ દિશામાં સૂર્યની સામે વહે છે. જેથી આ પવિત્ર સરસ્વતી નદીને પૂર્વવાહીની નદી કહેવાય છે.

આ પ્રાચી તીર્થની ભૂમિ પર ધર્મરાજ યુધિરિ પિતૃ તર્પણ કર્યું હતું. આ તીર્થક્ષેત્રમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં સ્નાન કરવાથી, અહીં ધર્મરાજે વાવેલા મોક્ષ પીપળાને પાણી રેડવાથી પિતૃતર્પણનું કાશી કરતા પણ અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

શ્રીમદ ભાગવતપુરાણ મુજબ શ્રદ્ધકાર્ય કે મૃતક પાછળ આત્માની મુક્તિ અર્થે થતા કર્મકાંડ માટેનાં ઉત્તમ સ્થળોમાં પ્રભાસક્ષેત્ર સ્થાન પામે છે. આ પ્રભાસક્ષેત્રમાં દ્વારકા, સોમનાથ અને પ્રાચી તીર્થનો સમાવેશ થાય છે. આ પ્રાચી તીર્થમાં મોક્ષ પીપળા નીચે ભગવાન શ્રીકૃષ્ણએ યદુકુળનો મોક્ષ કર્યો હતો તેમજ આ મોક્ષ પીપળા નીચે શ્રી મહાપ્રભુજી ભગવાને ઉદ્ધવને છેવટનું જ્ઞાન આપ્યું હતું.

અલંગમાં જહાજ કટિંગની સુવિધાથી યુરોપિયન યુનિયનના રાજદૂતો સંતુષ્ટ

ભાવનગર

યુરોપિયન દેશોના રાજદૂતો સાથે ગાંધીનગરમાં કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જે બાદ બુધવારે યુરોપિયન યુનિયનના ત્રણ દેશના પ્રતિનિધિ મંડળે અલંગની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અંશત્ સફળ નિવડી હોય તેમ અલંગમાં ઉપલબ્ધ જહાજ કટિંગ, અન્ય સુવિધાઓથી રાજદૂતો સંતુષ્ટ થયા હતા અને યુરોપના શિપને અલંગ મોકલવા સકારાત્મક વલણ દાખવ્યું હતું. અલંગ શિપરિસાયકલીંગ યાર્ડમાં આજે નોર્વેના મુંબઈ સ્થિત કોનસ્યુલેટ જનરલ એમ્મા બો, રોયલ નોર્વેયન કોનસ્યુલેટ જનરલ આર્ને જેન ફ્લોલો, ડેન્માર્ક એમ્બસીના પારસ ગુપ્તા અને ડેન્માર્કના ટ્રેડ પોલિસીના કાઉન્સિલર મિઆ ઇજસિંગ લાયડોમનું પ્રતિનિધિ મંડળ ચારેક કલાકની મુલાકાતે આવ્યું હતું.

SHARP
INTERNATIONAL
IMMIGRATION SERVICES

CANADA
IMMIGRATION

icrc
IMMIGRATION CONSULTANTS OF
CANADA REGULATORY BOARD

crcic
CANADIAN REGULATORY BOARD

**SPOUSAL SPONSORSHIP
SPECIALIST (98 percent success ratio)**

Last minute student admission

Please contact us on
416-745-2466 or 91-9428973911

- Conestoga
- Seneca
- Humber
- Lambton
- Fanshawe
- Georgian
- Algoma
- Canadore
- Algoma
- Saskatchewan polytechnic
- Mohawk

**ONLINE IELTS
SPOKEN ENGLISH CLASSES
ON ZOOM**

- LMIA/WORK PERMIT • EXPRESS ENTRY
- CANADIAN EXPERIENCE CLASS
- SUPER VISA & VISITOR VISA
- STUDY & WORK PERMIT
- Work / Study /Visitor Permit Extension
- PARENTS/CHILD/SPOUSAL SPONSORSHIP
- REFUGEES/APPEALS /
DETENTION REVIEWS /
CRIMINAL PARDONS
- POST GRADUATION WORK PERMIT
- CITIZENSHIP & PR CARD RENEWAL
APPLICATIONS

CANADA	94- 499 Main Street South, Shoppers World Mall, Brampton, Ont. Ph : 416-745-2466, 905-230-7855
VADODARA	101-102 Siddharth Complex, Beside Express Hotel, Alkapuri, Vadodara 390007. Ph : 91-94289 73911, 91-95121 57817
AHMEDABAD	139 Iscon Emporio, Beside Star Bazaar Satellite Ahmedabad 380015. Ph : 91-94289 73911, 91-98256 79911

: Specialized in :

**Job Offer & LMIA
Entrepreneur
Investor Business
Self Employed
Farm Investor**

Email.: info@siis.ca Website.: www.siis.ca

કચ્છના મોટા રણમાં નવું ફ્લેમિંગો સિટી આર્ટીફિશીયલ બ્રિડીંગ પ્લેટફોર્મ સફળ

રણમાં થોડી ઊંચાણવાળી જગ્યાએ લેસર ફ્લેમિંગો નવા માળા બનાવે અને નાના બેટ ઉપર ગ્રેટર ફ્લેમિંગો રહે છે

ભુજ

કચ્છનું મોટું રણ ફ્લેમિંગો સિટી તરીકે વિશ્વ વિખ્યાત છે. હવે, ફ્લેમિંગો સિટી નજીક નવું ફ્લેમિંગો સિટી આકાર પામી રહ્યું છે. વન વિભાગે પ્રયોગરૂપે આર્ટીફિશીયલ બ્રિડીંગ પ્લેટફોર્મ બનાવ્યાં હતાં તે સફળ રહેતાં મોટા રણ અભ્યારણ્યમાં નવું મિની ફ્લેમિંગો સિટી આકાર પામ્યું છે. આ નવી વસાહત અત્યારે ૧૨થી ૧૫ હજાર ફ્લેમિંગોથી રંગબેરંગી બની ચૂકી છે. કુલ ૪.૫૦ લાખ હેક્ટરમાં પાથરાયેલી કચ્છ વાર્ડલ્ડ લાઈફ સેન્ચ્યુરી ફ્લેમિંગોનું સુરક્ષિત રહેઠાણ છે. ચોમાસાનું પાણી ભરાયું હોય તે પછી શિયાળામાં ઓક્ટોબરથી ડીસેમ્બર માસ દરમિયાન ફ્લેમિંગો સિટીમાં હજારોની સંખ્યામાં ફ્લેમિંગો નેસ્ટિંગ કરે છે. આ વર્ષે સારો વરસાદ થતાં અને પાકિસ્તાનથી આવેલા પૂરના પાણી ભરાવાથી આ બ્રિડીંગ પ્લેટફોર્મ ઉપર હજારો ફ્લેમિંગોએ નેસ્ટિંગ કર્યાં છે. આમ, કચ્છના મોટા અભ્યારણ્યમાં



શિયાળા અગાઉ જ નવું ફ્લેમિંગો સિટી આકાર પામ્યું છે. કચ્છ રણ વન્યપ્રાણી અભ્યારણ્યમાં વર્ષ-૨૦૧૯ ના ચોમાસા દરમિયાન બ્રિડીંગ સાઈટના નિરીક્ષણ અને અભ્યાસ દ્વારા તાથા અગાઉની બ્રિડીંગ સાઈટના અભ્યાસના અનુભવે એવું જાણવા મળ્યું કે સામાન્ય રીતે રણમાં થોડી ઊંચાણ વાળી જગ્યાએ ઉપર લેસર ફ્લેમિંગો દ્વારા નવા માળા બનાવવામાં આવે છે તાથા ઊંચા ટેકરા વાળા ભાગો કે જે સામાન્ય રીતે ચોમાસા દરમિયાન ખુલ્લા જોવા મળતા હોય છે અને જેના પર ઘાસનો ઉગાવો હોતો નથી તેવા નાના બેટ જેવા ભાગો ઉપર ગ્રેટર ફ્લેમિંગો દ્વારા વસાહત બનાવવામાં આવતી હોય છે.

વિસાવદરમાં બે યુવાને મિત્રને મગરના જડબામાંથી છોડાવ્યો

વિસાવદર

વિસાવદર માણદિયા પાસે આંબાજળ ડેમ અને આંબાજળ નદીમાં સેકડો મગરો વસવાટ કરે છે. જ્યાં બુધવારે ત્વિજ ભીખુભાઈ દાફડા, હનીશ અને ચંદુભાઈ નામના ત્રણેય યુવકો બળદને લઈ નદીમાં પાણી પીવડાવવા માટે આવ્યા હતા અને બળદ નદીમાં પાણી પીતા હતા તેવામાં ત્વિજ નામના ૨૦ વર્ષીય યુવકનો પગ મગરે પકડી લીધો હતો. અચાનક જ પાણીમાંથી આવેલા મગરે ત્વિજનો પગ પકડતા તેણે રાડા રાડ કરી મૂકી હતી. જેથી તેની સાથે રહેલા હનીશ અને ચંદુભાઈ નામના બંને યુવકોએ હિંમતભેર મગર પર પથ્થરોનો ઘા શરૂ કર્યો હતા. તેથી મગરને પથ્થર લાગતા તેણે ત્વિકનો પગ મૂકી દીધો હતો. બાદમાં ત્વિકને પગના ભાગે ઈજા થતા તેને ખાનગી વાહન મારફતે વિસાવદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પગના ભાગે વધુ ઈજા જણાતા અને વધુ સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

કિશોરી પર દુષ્કર્મના કેસમાં ૨ પ્રજ્ઞાયક્ષુ, ૨ બધીર સહિત ૫ શખ્સને આજીવન કેદ આરોપી નાનજીભાઈને ડા. ૫૦,૦૦૦નો દંડ ફટકારાયો

રાજકોટ

૨૦૧૮ની સાલમાં માતા સાથે રહેતી ભોગ બનનાર કિશોરીનું પેટ વધી જતાં તેની માતા ડોક્ટર પાસે લઈ ગઈ હતી. જ્યાં ભોગ બનનાર કિશોરી ગર્ભવતી હોવાનું નિદાન થયું હતું. જેથી તેની માતાએ પુછપરછ કરતાં એક બાળ આરોપી અને બે આધેડ સહિત ત્રણના નામ આપ્યા હતાં. જેમણે પોતાની સાથે અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાનું જણાવ્યું હતું. જેથી ભોગ બનનાર કિશોરીની માતાએ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે પાંચ આધેડ અને એક બાળ આરોપી સહિત છની ધરપકડ કરી હતી. જે બાદ તપાસમાં ભૂણાનાં પિતા તરીકે આરોપી નાનજી હોવાનું ખુલ્યું હતું. આ કેસ ચાલવા દરમિયાન ભોગ બનનાર કિશોરી, તેની માતા ઉપરાંત ડોક્ટરની જુબાની નોંધવામાં આવી હતી. બીજા કેસમાં મવડી રોડ પરનાં ઉદયનગરમાં રહેતા આરોપી વિમલ ઉર્ફે કાનો હરેશ



ચૌહાણ (ઉ.વ. ૨૭)ને એક કિશોરી પર દુષ્કર્મનાં ગુનામાં પોકસો કોર્ટનાં જજ જ.ડી. સુથારે આજીવન કેદની સજા ફટકારી હતી.

આરોપી ભોગ બનનાર કિશોરીનું અપહરણ કરી ગયા બાદ ૨૫ દિવસ દરમિયાન તેની ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે અંગે ભોગ બનનાર કિશોરીની માતાએ માલવિયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાવતા આરોપીની પોકસો સહિતની કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. આ બંને કેસોમાં સરકાર પક્ષ તરફથી જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલા હતાં.

દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય તરીકે દંડીસ્વામીની નિયુક્તિ

દ્વારકા

શારદાપીઠ દ્વારકામાં બ્રહ્મકાલીન પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદ સરસ્વતિને શ્રદ્ધાંજલિ આપવા સભા યોજવામાં આવી હતી. જેમાં જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના ઈચ્છાપત્રનું વાંચન થયા બાદ બદ્રીનાથના શંકરાચાર્ય તરીકે સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદજી તથા દ્વારકા શારદાપીઠાધિશ્વર શંકરાચાર્ય તરીકે દંડી સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની શંકરાચાર્ય તરીકેની ઘોષણા કરી નિયુક્તિ કરવામાં આવી હતી.

ભાવનગર કન્ટેનર નિર્માણનું હબ બનવાની દિશા તરફ આગળ વધ્યું

ભાવનગર

ભાવનગરની કંપનીને ૧૦ હજાર કન્ટેનર નિર્માણનો ઓર્ડર મળતા કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં ભાવનગર હબ બનવાની દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ ઉપરાંત ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરીના કારણે સડક માર્ગે ૧૦થી ૧૨ કલાકનો જે પ્રવાસ થતો હવે તે ત્રણ કલાકમાં પૂર્ણ કરવો શક્ય બન્યો હોવાનું ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી સર્ધાનંદ સોનોવાલે જણાવ્યું હતું. તેમણે ભારતમાં સમુદ્રીય જળમાર્ગોને વધુ સુવિધાસભર બનાવવા માટે સરકાર કટિબદ્ધ છે તેમ ઉમેર્યું હતું.

WANTED HOTEL MANAGER

Motel Manager for 13 Unit Motel, live in Quarter two bedroom plus \$30,000 salary per year, two weeks holiday pay, duties are answer phone, check in customer, clean rooms, laundry, banking, etc.

Contact Information
Manoj Parekh 250-691-1322 or
 email : babasai2007@gmail.com

First Flight

FFCL Couriers Inc.

દુનીયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6</p> <p>11 LB \$55 વધુ દર LB ના \$6</p> <p>23 KG \$185, વધુ દર KG ના \$10</p> <p>30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે ફરી આપીશું (Extra Charge)</p>
--	--

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

Brampton (West)	Scarborough	Mississauga
<p>519, Ray lawson boulevard , Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p>WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road & Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p>WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: SAT-SUN :----- 11.00 AM to 5.00 PM -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM ----: WEEKENDS :---- 11.00 AM TO 5.00PM</p>

૬૪૭-૭૬૧-૧૩૧૭ www.firstflightcanada.com

સ્વદેશ

CANADA

Registration # 869127209
Publication Mail Agreement /
Email : info@swadesh.news

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS
 23 Lyric Road,
 Brampton ON L6S 0B4.
 416-996-7755

Registered Address
 713, Markham Road, Scarborough M1H 2A8.

Editor : Manoj Gandhi

Director & Publisher : Rameshbhai Vyas

Director Marketing : Pareshkumar Champakbhai Peshwa

Director : Nilesh Tailor

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE **MAC AGENCIES** : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT (INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh



ઐશ્વર્યાની પોનિચિન સેલ્વનના ઓટીટી રાઈટ્સ 125 કરોડમાં વેચાયા

મુંબઈ : ઐશ્વર્યા રાયની ફિલ્મ પોનિચિન સેલ્વનના ઓટીટી રાઈટ્સ ૧૨૫ કરોડ રૂપિયામાં વેચાઈ ગયા છે. ફિલ્મની સ્વિલિંગ પહેલાં ૪ આ સોદો પાર પડી ગયો છે. ઐશ્વર્યા રાય ઉપરાંત ચિયાન વિક્રમ, ત્રિશા ફૂલ્કર અને કાર્તિક જેવા કલાકારોની આ ફિલ્મ સાથેના વિખ્યાત સર્જક મણીરત્નને બનાવી છે. વર્ષો પછી મણીરત્નને અને ઐશ્વર્યાનું કોલબ્લેન્ડિંગ બોવા ચાહકો ઉત્સુક છે. આ ફિલ્મના ટીઝર્સને બહુ સારો પ્રતિસાદ સાંપડ્યો છે. હાલ ઓટીટી પ્લેટફોર્મ ગમે તેવા મોટા સ્ટાર કે ગમે તેવાં મોટાં બેનરની ફિલ્મો પણ તત્કાળ ખરીદવા ઉત્સુક નથી.



સ્પર્દા

FRIDAY, 16 SEPTEMBER, 2022

09

બોક્સ ઓફિસ પર 'બ્રહ્માસ્ત્ર'નો તરખાટ: 150 કરોડની કમાણી



રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર એ બોક્સ ઓફિસ પર તરખાટ મચાવવાનું ચાલુ રાખ્યું છે. રિલિઝના બીજા દિવસે આ ફિલ્મે ભારતમાં 43 કરોડ રૂપિયાની કમાણી કરી હોવાના મીડિયા રિપોર્ટસ સામે આવી રહ્યા છે. આ અહેવાલો પ્રમાણે પહેલા દિવસે જ્યાં બ્રહ્માસ્ત્ર ફિલ્મે ભારતમાં 37 કરોડની કમાણી કરી હતી ત્યારે બીજા દિવસે તેની કમાણીમાં ઉછાળ આવ્યો હતો અને આ ફિલ્મ 43 કરોડ રૂપિયા ભારતમાંથી કમાઈ છે. આમ ભારતમાં તેની કમાણી 80 કરોડ પર પહોંચી ચૂકી છે. ફિલ્મની કમાણી વિકેન્ડમાં 150 કરોડને પાર પહોંચી ગઈ હતી. ટૂંકમાં જ ફિલ્મ 200 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. પહેલા દિવસે આખી દુનિયામાંથી ફિલ્મે 75 કરોડનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે સૌથી સારો દેખાવ મુંબઈમાં કર્યો છે. આ સિવાય દિલ્હી, કોલકાતા, ચંદીગઢ જેવા શહેરોમાં પણ બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર જોરદાર દેખાવ કરી રહી છે.

અજય દેવગણ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની થેન્ક ગોડ સામે કોર્ટ કેસ



મુંબઈ : અજય દેવગણ તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સામે યુપીની કોર્ટમાં તેમની આગામી ફિલ્મ થેન્ક ગોડમાં લોકોની ધાર્મિક લાગણી દૂભવવા બદલ કેસ દાખલ કરાયો છે. ફિલ્મના કલાકારો ઉપરાંત સર્જક ઈન્દ્ર કુમાર ઈરાનીને પણ ફિલ્મમાં પ્રતિવાદી તરીકે દર્શાવવામાં આવ્યા છે. યુપીના જૌનપુરના એક વકીલના દાવા મુજબ આ ફિલ્મમાં ચિત્રગુપ્ત મોટી રીતે ચિત્રણ કરાયું છે. ભારતીય માન્યતા અનુસાર ચિત્રલોક યમલોકના દેવ છે. તેઓ દરેક વ્યક્તિનાં સારાં-નરસાં કર્મનો હિસાબ કરીને તેનો ન્યાય કરે છે. પરંતુ, ફિલ્મમાં ચિત્રગુપ્ત તથા આ યમલોકની કાર્યપ્રક્રિયાની મજાક ઉડાવવામાં આવી છે અને તે રીતે ધાર્મિક લાગણી દૂભાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

દસ વર્ષમાં પ્રિયંકાને હોલિવૂડમાં ચોક્કપણ સારો રોલ ન મળ્યો

મુંબઈ : અમેરિકન ટીવી શો 'કવોન્ટિકો'માં એલેક્સ પેરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને ખ્યાલિત મેળવનારી પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી. પ્રિયંકા આજે જ્યાં પણ છે તે પોતાના દમ પર છે.

અમેરિકન ટીવી શો 'કવોન્ટિકો'માં એલેક્સ પેરિશની ભૂમિકા ભજવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અને ખ્યાલિત મેળવનારી પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરૂર નથી. પ્રિયંકા આજે જ્યાં પણ છે તે પોતાના દમ પર છે. તેણે દરેક પગલે પોતાની જાતને સાબિત કરી છે.

તાજેતરમાં પ્રિયંકાએ કહ્યું હતું કે તેણે અંગ્રેજી ભાષામાં તેના અભિનયમાં હજી ઘણું હાંસલ કરવાનું બાકી છે. યુએસ ઈન્ડસ્ટ્રીમાં ૧૦ વર્ષ સક્રિય રહ્યા બાદ આખરે તે ઈચ્છે તે પ્રકારના રોલ કરવા સક્ષમ છે.

એક ઓનલાઈન પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકાએ કહ્યું, હું એક સિદ્ધિ મેળવનાર છું. હું એવી વ્યક્તિ છું જેની પાસે લક્ષ્ય છે. મને ચેલેન્જિસ, વિકાસ અને નોલેજ પસંદ છે. જ્યારે તમે આ બધી વસ્તુઓને જોડો છો અને ઘણું છું જે હું કરવા માંગુ છું. મેં ટોચના ફિલ્મ નિર્માતાઓ સાથે કામ કર્યું છે અને મેં એવી ફિલ્મો કરી છે જેનો મને ખરેખર ગર્વ છે. હવે એક અભિનેત્રી તરીકે હોલિવૂડમાં પણ એવું જ કરવા માંગુ છું જે મેં ભારતમાં કર્યું છે. હું એક અભિનેત્રી તરીકે યુએસમાં હજી નવી છું. ૧૦ વર્ષ સુધી અહીં કામ કર્યા પછી હું એવા સ્ટેજ પર પહોંચી ગઈ છું જ્યાં હું ગમે તે રોલ કરવા માંગુ છું. મેં આ ઈન્ડસ્ટ્રી માટે સખત મહેનત કરી છે જ્યાં હું જે લોકો સાથે કામ કરું છું તેમાં મને વિશ્વાસ છે.



જેક્લિન પછી નોરા ફતેહી દિલ્હી પોલીસ સમક્ષ હાજર



સુકેશ ચંદ્રશેખર દ્વારા 200 કરોડ થી ખંડણી ઉઘરાવવાનાં કેસમાં દિલ્હી પોલીસ દ્વારા અપાયેલા સમન્સને પગલે બોલીવુડ ડાન્સર નોરા ફતેહી આજે દિલ્હી પોલીસ સમક્ષ હાજર થઈ હતી. નોરા પોલીસ કચેરી ખાતે બ્લેક હૂડીમાં સજ્જ થઈને આવી હતી જેથી મીડિયાના કેમેરાથી પોતાનો ચહેરો છુપાવી શકાય. નોરા ફતેહીએ પણ સુકેશ પાસેથી કરોડો રૂપિયાની ભેટ સોગાદો મેળવી હોવાનો આરોપ છે. અગાઉ ઈડી દ્વારા પણ તેની પૂછપરછ થઈ ચૂકી છે. જોકે, આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જેક્લિન ફર્નાન્ડીઝને સહ આરોપી દર્શાવવામાં આવી છે પણ નોરા ફતેહીને સાક્ષી જ ગણવામાં આવી છે. જેક્લિન આ મુદ્દે ઉકળાટ પણ ઠાલવી ચૂકી છે. તેના દાવા અનુસાર પોતે પણ આ કેસમાં ઠગાઈનો ભોગ જ બની છે.

પ્રેગ્નન્સીમાં 99 ટકા પોઝિટિવ વિચારું છું : બિપાશા બાશુ

મુંબઈ : અભિનેત્રી બિપાશા બાસુ પોતાની પ્રેગ્નન્સીને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેને ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. બિપાશાએ હવે આ ટ્રોલિંગ પર મૌન તોડ્યું છે. બિપાશા કહે છે કે તેને ઘણો પ્રેમ મળી રહ્યો છે. આ સ્થિતિમાં તે ટ્રોલ્સ પર ધ્યાન આપવા માંગતી નથી, માત્ર સારી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બિપાશાએ એમ પણ કહ્યું કે દરેક વ્યક્તિએ પોતાના શરીરને પ્રેમ કરવો જોઈએ. ઓગસ્ટ મહિનામાં અભિનેત્રી બિપાશા બાસુએ સોશિયલ મિડિયા પર એક પોસ્ટ કરીને પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ પતિ કરણસિંહ ગોવર સાથે તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો શેર હતી. આ તસવીરોમાં બિપાશા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.

અભિનેત્રી બિપાશા બાસુ તેની પ્રેગ્નન્સીને લઈને ઈન્ટરનેટ પર ઘણી ટ્રોલ થઈ. અભિનેત્રીએ ટ્રોલને જડબાતોડ જવાબ પણ આપ્યો હતો અને

કહ્યું, હું દરેકના વિચારોનું સન્માન કરું છું પણ મને જીવન મારી રીતે જીવવું ગમે છે. હું ૯૯ ટકા સારી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરું છું અને તે નકારાત્મક વસ્તુઓ પર નહીં, આ જીવન આગળ વધવાનો માર્ગ છે. અન્ય લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે, તેઓ તમને શું કહે છે તે મુજબ તમે તમારું જીવન જીવી શકતા નથી. હું મારા શરીરને ખૂબ પ્રેમ કરું છું મને લાગે છે કે આપણે બધાએ આપણા શરીરને પ્રેમ કરવો જોઈએ.

બિપાશાએ વધુમાં કહ્યું કે, મને લાગે છે કે જો આપણે આપણા શરીરને પ્રેમ કરીએ તો તમે સ્વસ્થ રહેશો અને સારું જીવન જીવી શકશો. હું જલદી જ માતા બનવાની છું, જેના કારણે મારા શરીરમાં બદલાવ આવી રહ્યા છે. હું આ સમયે મુક્તરીતે જીવવા માંગુ છું અને હું તેને ખુલ્લેઆમ બતાવવા માંગુ છું. કારણ કે આ ક્ષણ કાયમ રહેતી નથી.



સિંગર અનન્યા બિરલા હવે ફિલ્મોમાં એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કરશે



મુંબઈ : ઉદ્યોગપતિ કુમાર મંગલમ બિરલાની દીકરી અનન્યાએ એક સિંગર તરીકે કારકિર્દી બનાવ્યા બાદ હવે તે અભિનય ક્ષેત્રે પણ શરુઆત કરી રહી છે. તે બોબી દેઓલ સાથેની ફિલ્મમાં સ્ક્રીન શેર કરશે. કુણાલ કોહલી શેરલોગ હોમ્સની કથાઓ પરથી ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મનું ટાઈટલ શ્લોક, ધી દેશી શેરલોક નક્કી થયું છે. ફિલ્મમાં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે અનન્યા પણ સ્ક્રીન શેર કરી રહી છે. આ ઉપરાંત તે એક સફળ વ્યવસાયિક પણ છે. બોબી દેઓલની કારકિર્દી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ડગમગી ગઈ હતી. પરંતુ આશ્રમ વેબ સિરીઝે તેની કારકિર્દીને નવું જોમ આપ્યું હતું.

જુહી ચાવલાનું ઓટીટી ડેબ્યૂ, આયેશા મુલ્કાનું પણ પુનરાગમન

મુંબઈ : ઓટીટી ૯૦ના દાયકાની અભિનેત્રીઓને સ્ક્રીન પર કમબેક માટેનું અનુકૂળ પ્લેટફોર્મ બની રહ્યાં છે. જુહી ચાવલા પોતાનું વેબ ડેબ્યૂ કાર્મ મીલર સિરીઝ હશ હશ થી કરી રહી છે. આ સિરીઝમાં જ વર્ષો પછી આયેશા મુલ્કા પણ અભિનય કરતી જોવા મળશે. જુહી ચાવલા સમયાંતરે ફિલ્મોમાં દેખાતી રહી છે. આઈપીએલ કેન્ટ્રાઈઝીને લીધે તેની સ્ક્રીન પ્રેક્ષક પણ સતત રહેતી હોય છે. જોકે, આયેશા મુલ્કા ૯૦ના દાયકામાં તમામ ટોચના હીરો સાથે સુપરહિટ ફિલ્મો કર્યા બાદ લગભગ ગાયબ થઈ ગઈ હતી. ચાર-પાંચ વર્ષ પહેલાં તે છૂટીછવાઈ એક બે ફિલ્મોમાં દેખાઈ હતી.



આ અગાઉ માધુરી દીક્ષિત, રવિના દંડન તથા કાજોલ સહિતની અભિનેત્રીઓ પણ ઓટીટી પ્લેટફોર્મને અપનાવી ચુકી છે. કેટલીય અભિનેત્રીઓને તો એવું પણ લાગે છે કે ૯૦ના દાયકામાં બનતી ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા ફિલ્મોને કારણે તેમની અભિનય ક્ષમતાનો સાચો ઉપયોગ થયો જ ન હતો પરંતુ હવે ઓટીટી પર પડકારજનક ભૂમિકાઓ ભજવીને તેમને સંતોષ મળી રહ્યો છે. હશ હશ સિરીઝમાં જુહી, આયેશા, સોહ અલી ખાન, કૃતિકા કામરા સહિતની હિરોઈનો છે અને તેનું ટિગ્દર્શન પણ તનુજા યન્નાએ કર્યું છે. આમ આ ફિલ્મમાં નિર્માણનાં મોટાભાગના પાસાંમાં મહિલાઓએ પ્રદાન આપ્યું છે.



MADHUR - YATRI & CHORUS GROUP - 2022 NAVRATRI "RAAS GARBA"

SOLD OUT

**Brampton
Saturday
24 Sep 2022**
**Waterloo
Friday
30 Sep 2022**
**Markham
Saturday
01 Oct 2022**
**Scarborough
Friday
07 Oct 2022**
**Brampton
Saturday
08 Oct 2022**

મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ૨૦૨૨ નવરાત્રી રાસ ગરબા


Madhur Shah

 Music Composer,
 Director & Singer
 Since last 30 years

Chirag Shah
 Chorus Singer

૨૦૨૨ નવરાત્રી રાસ ગરબા મા મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ના તમામ કલાકાર નવરાત્રી ને પૂર જોશમા ઉજવવા માટે સુંદર ગરબા અને રાસ સાથે સંગીત ની રમઝટ માનવા તૈયાર છે. બે વર્ષ ના કોવીડ-૧૯ ના મહામારીરોગ પછી ફવે સમય આવ્યો છે નવરાત્રીની માતાજી ની આસ્થાને પરિપૂર્ણ કરવા માટે અને આ સુંદર સમય ને શ્રદ્ધા સાથે ભરપૂર આનંદ માણી કોવીડ-૧૯ ને વિદાય આપવી છે. ચાલો મધુર યાત્રી અને કોરસ ગ્રુપ ના કલાકાર સાથે આપ નવરાત્રીને જ્ઞાનદાર ઉજવવા માટે તૈયાર થઈ જાઓ ૭ ઓક્ટોબર ૨૦૨૨ ને શુક્રવારે સાજે ૭ વાગે સાઈ મંદિર મારખમ મા પ્રવેશ કી વગર રાસ ગરબા ની મજા માણો. વધુ માહિતી માટે ૪૧૬ ૫૭૫ ૫૩૧૨


Vaishali Shah
 Chorus Singer

Yatri Shah

 Music Director &
 Lead Female Singer
 for the last 30 years

Aarti Bhatia
 Chorus Singer

Mayurika Trivedi
 Chorus Singer

Hiral Bhatt
 Chorus Singer

Rajesh Bhatia
 Chorus Singer

Harshita Kakkad
 Public Relations MYCG

Ashok Shah
 Res.Hon.Manager MYCG

Vahin Shah
 Singer/Keyboard player

Mahin Shah
 Maracas Player

Thank you Madhur - Yatri & Chorus Group stage artist for very sincere and hard efforts to make Navratri 2022 Raas Garba celebration most memorable by entertaining more than 10,000 Raas Garba Premi Bhai Bahen 5 different venues performances, from 24/ September 2022 to 08/ October 2022 without monetary rewards..... Harshita Kakkad {Public Relations-MYCG}

Shiv Financial Services
 presents
Madhur Yatri & Chorus Group
 To support Sri Radha Krishna Temple of Scarborough
Saturday - Sep 24, 2022 @ 7.00pm
Venue: Hindu Sabha
 9225 The Gore Rd, Brampton ON L6P 0B6
 For ticket & more info:
 Jagdish Sevak: 647-236-7620
 Manisha sevak: 647-770-3876

Kitchner-Waterloo Community
 presents
Madhur Yatri & Chorus Group
Friday - Sep 30, 2022 @ 7.00pm
Venue: Albert McCormick Community Centre
 500 Parkside Drive, Waterloo, Waterloo ON N2L 5J4
 entrance through Waterloo Public Library doors on old Albert Street
 For ticket & more info:
 Kamal Singh: 226-338-1474
 Gayatri Singh: 226-606-1647

24 Gam Patidar Samaj
 presents
Madhur Yatri & Chorus Group
Saturday - Oct 01, 2022 @ 7.00pm
Venue: Armenian Community Centre of Toronto
 45 Hallcrown Pl, North York, ON M2J 4Y4
 For ticket & more info:
 Mahender Patel: 647-454-5830

Sai Mandir સાઈ મંદિર
 presents
Madhur Yatri & Chorus Group
Friday - Oct 07, 2022 @ 7.00pm
Venue: Sai Mandir સાઈ મંદિર
 2721 Markham Rd, Unit # 6
 Toronto Ontario M1X 1N5
 For more info:
 Raghu : 416-575-5312

Dashkoshi Leuva Patidar Samaj
 presents
Madhur Yatri & Chorus Group
Saturday - Oct 08, 2022 @ 7.00pm
Venue: Hindu Sabha
 9225 The Gore Rd, Brampton ON L6P 0B6
 For ticket & more info:
 Sanjay/Dipti Patel: 647-469-9274 Jignesh/Varsha Patel: 647-575-8420
 Jayesh/Rekha Patel: 647-895-0385 Anil/Devayani Patel: 647-746-6423



૪૮ વર્ષના સાથ અને સહકાર માટે ગુજરાતી ભાઈ-બહેનોનો અશોક ટ્રાવેલ્સ ખૂબજ અભાર માને છે.
અશોક ટ્રાવેલ્સ ASHOK TRAVELS
416.977.9896 www.ashoktravel.com
 ટોરાન્ટો-કેનેડાની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી TICO 1486999





॥ संस्कृति ॥

સ્વદેશ
Leading Gujarati Newspaper

સ્વદેશમાં જાહેર ખબર પ્રસિદ્ધ કરાવવા માટે સંપર્ક કરો

પરેશકુમાર ચંપકભાઈ પેશ્વા
(માર્કેટીંગ ડાયરેક્ટર)

+1 416-302-4531, 437-421-2992
Email :- info@swadesh.news

Rameshbhai Vyas
Director & Publisher
SWADESH

Paresh Peshva
Marketing Director
SWADESH

શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીની જ્ઞાની દુનિયાને અલવિદા

શંકરાચાર્ય સ્વરૂપાનંદ : એક નિર્ભિક વ્યક્તિત્વ

ઉત્તરાખંડના બદ્રીનાથના જ્યોતિર્મઠ અને ગુજરાતના દ્વારકામાં આવેલી શારદાપીઠ દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું રવિવારે નિધન થયું. ૯ વર્ષની ઉંમરે ઘર છોડીને સન્યાસ લેનાર સ્વામી સ્વરૂપાનંદજી ૯૯ વર્ષના હતા. મધ્યપ્રદેશના નરસિંહપુરના પરમહંસી ગંગા આશ્રમમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. સ્વરૂપાનંદજીએ રવિવારે બપોરે સાડા ૩ વાગ્યે અંતિમ શ્વાસ લીધા આ સમયે ભારતના તખ્તેથી એક નોંધપાત્ર વ્યક્તિત્વનું વિદાય થયું. પોતાના જીવનકાળ દરમિયાન સ્વામી સ્વરૂપાનંદે કરેલા નિવેદનો અનેક વખત વિવાદ સર્જનારા રહ્યા હતા. તેઓએ હિન્દુ ધર્મના કેટલાક મુદ્દે ખુલ્લેઆમ પોતાનો મત વ્યક્ત કર્યો હતો.

સ્વરૂપાનંદ સરસ્વતીજી ૧૯૮૧માં દ્વારકાની શારદાપીઠમના શંકરાચાર્ય બન્યા હતા. ભારતમાં એક સમયે શંકરાચાર્યનું મહત્વ હતું. પણ ધીરેધીરે એ મહત્વ ઘટતું ગયું. કેમ કે હિંદુ ધર્મમાં સંપ્રદાયોની સંખ્યા વધતી ગઈ. નવા નવા સંપ્રદાય બનતા ગયા અને તેના ગુરુઓનો પ્રભાવ વધતા શંકરાચાર્યનો કોઈ ખાસ વર્ગ ન રહ્યો કે અનુયાયીઓ પણ ન રહ્યાં. પરિણામે મોટાભાગના શંકરાચાર્ય શોભાના ગાંઠિયા જેવા બનીને રહી ગયા. એક સમયે ભારતમાં તેમના પડ્યા બોલ ઝીલાતા હતા. પરંતુ સમય જતા સ્થિતિ બદલાઈ ગઈ. મોટાભાગના શંકરાચાર્ય પણ વાસ્તવિકતા સ્વીકારીને પોતાની જાતને સંકોરીને બેસી ગયા. તેથી જાહેરજીવનમાં પણ તેમનું કોઈ મહત્વ ના રહ્યું.

સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી પણ આવા જ શંકરાચાર્ય હતા. સ્વામીજીએ હિંદુ ધર્મમાં શંકરાચાર્યના હોદ્દાનું મહત્વ ફરી પ્રસ્થાપિત કરવા બહુ પ્રયત્ન કર્યાં. તેના કારણે વિવાદો બહુ થયા. એક ધર્મગુરુ હોવા છતાં તેઓએ અનેક મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય આપ્યા. સત્તાધીશોને કડવી લાગે એવી વાતો કરતા પણ તેઓ અચકાતા ન હતા. પોતાના જીવનકાળમાં તેમણે હિંદુઓને સત્યનો આયનો બતાવવાની કોશિશ પણ કરી. સાથે જ ધર્મના નામે ચાલતાં ઘણાં ધર્તિંગો સામે પણ અવાજ ઉઠાવ્યો.

આ વિચારોને કારણે વિવાદો થવા છતાં તેનાથી ડગ્યા વિના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી આખી જીંદગી પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા. સ્વરૂપાનંદજી ગંગા સહિતની હિંદુઓ માટે પવિત્ર મનાતી નદીઓના શુદ્ધિકરણ અંગે સતર્ક હતા.



તેમના આગ્રહથી જ સૌથી પહેલાં ૧૯૮૦ના દાયકામાં ગંગા નદીના શુદ્ધિકરણનું અભિયાન હાથ ધરાયું હતું. અટલ બિહારી વાજપેયીએ પણ આ અંગે પ્રયત્નો કર્યા પણ ઝાઝી સફળતા મળી ન હતી.

૨૦૦૪માં કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા આવી તે બાદ આ પ્રયાસોમાં ઓટ આવી. ૨૦૦૮માં શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ગંગા સેવા અભિયાનને આગળ ધપાવવા વડા પ્રધાન ડો. મનમોહન સિંહને મળ્યા હતા. તેમના આગ્રહના કારણે કોંગ્રેસ સરકારે આ અભિયાન ફરી શરૂ કર્યું હતું.

અલાહાબાદના ૨૦૧૩ના મહાકુંભમાં ગંગા

અને તેમાં એક વિવાદ કેદારનાથના પૂર વખતનો છે. ૨૦૧૩માં આવેલા કેદારનાથના પૂર માટે તીર્થયાત્રીઓને જ દોષિત ગણાવ્યા હતા. તેમણે તે સમયે કહ્યું હતું કે, લોકોએ ધર્મસ્થળોને પિકનિક અને હનીમૂન સ્પોટ બનાવી દીધાં છે.

આ કારણે કેદારનાથ પર આવો પ્રકોપ ઉતર્યો છે.

જો કે, આ વાતને કારણે બહુ બખેડો નહોતો થયો. જે બાદ એપ્રિલ ૨૦૧૬માં વૈશાખી અને અર્ધકુંભ મેળા સ્નાનના પ્રસંગે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં આ જ મુદ્દો તેમણે ફરી ઉઠાવ્યો હતો. એ વખતે તેમણે કેદારનાથ અને ઉત્તરાખંડમાં આવેલા પૂરની વાત કરતા કહ્યું કે,

સ્વરૂપાનંદએ ભારત દેશમાં શંકરાચાર્યનું મહત્વ પુનઃ સ્થાપિત કરવા અથાગ પ્રયત્નો કરતા રહ્યા. આ સાથે જ ધર્મના નામે ચાલતાં ઘણાં ધર્તિંગો સામે પણ અવાજ ઉઠાવ્યો જેને કારણે અનેક વખત વિવાદો પણ થયા

અને યમુનાની પવિત્રતા યથાવત્ જાળવવા માટે ધાર્મિક નેતાઓએ ઉત્તરાખંડના રાજ્યપાલ અઝીઝ કુરેશીને સન્માનિત કર્યા હતા. ગંગા નદીની પવિત્રતા જાળવવા લોકો સભાન બને તે હેતુ સ્વરૂપાનંદ સરસ્વતીજીની પહેલ કરી હતી. સ્વામી સ્વરૂપાનંદજીએ વિવાદો પણ બહુ સર્જ્યા

ગંગા નદી પર બનતા ડેમ, અલકનંદા નદીમાં બંધ બનાવીને ધારી દેવી મંદિરને ડૂબાડી દેવાયું અને યાત્રિકો પવિત્ર સ્થળોએ મર્યાદાઓ ઓળંગે છે. તેના કારણે ભગવાનનો પ્રકોપ ઉતરે છે. આ નિવેદને ભારે વિવાદ પેદા કર્યો હતો. પણ સ્વામીજી પોતાની વાત પર અડગ રહ્યા હતા.

જો કે સ્વામીજીએ સૌથી મોટો વિવાદ સાંઈબાબા અંગે કરેલાં નિવેદનોના કારણે થયો હતો. આસ્થાએ લોકોની અંગત બાબત છે અને જેને જેમાં શ્રદ્ધા રાખવી હોય તેમાં રાખે. લોકોને સાંઈબાબામાં શ્રદ્ધા હોય તો લોકો તેમાં શ્રદ્ધા રાખે તેમાં કશું ખોટું નથી પણ સ્વામીજીને તેની સામે ભારે વાંધો હતો. ૨૩ જૂન ૨૦૧૪નાં રોજ આયોજિત ધર્મ સંસદમાં સ્વરૂપાનંદજીએ સાંઈબાબાની પૂજાને હિન્દુ વિરોધી ગણાવી હતી. આ સાથે જ સમગ્ર દેશમાં સાંઈ ભક્તોમાં સ્વામી સામે ભારે આક્રોશ ફેલાયો હતો. ઠેર ઠેર વિરોધપ્રદર્શનો થવા છતાં સ્વરૂપાનંદ તેમની વાત પર અડગ રહ્યા હતા. આમ તે નિર્ભિક વ્યક્તિત્વ ધરાવતા માણસ હતા.

તેમણે સાંઈબાબાના ભક્તોને ભગવાન રામની પૂજા, ગંગામાં સ્નાન અને હર-હર મહાદેવના જપ કરવાનો અધિકાર નથી તેવું પણ કહી દીધેલું. આ ધર્મ સંસદમાં સ્વામીજીની પહેલથી સર્વસંમતિથી સાંઈબાબાનો પૂજાનો બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ હતી. આ ઘટનાથી તેમની સામે અનેક ભક્તોમાં નારાજગી ફેલાઈ હતી. ૨૦૧૬માં સ્વામીજીએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ સાંઈબાબાની પૂજા છે. જ્યાં પણ ખોટા લોકોની પૂજા થાય છે ત્યાં દુષ્કાળ અને મોત જેવી સ્થિતિ ઊભી થાય છે. ધર્મગુરુ તરીકે સ્વામીજીનું આ નિવેદન યોગ્ય નહોતું અને તેનો વિરોધ પણ થયો હતો.

સ્વામીજીએ આવું જ વલણ મહારાષ્ટ્રના શનિ શિંગળાપુર મંદિરમાં મહિલાઓને પ્રવેશની મંજૂરી મળવા મુદ્દે લીધું હતું. તેમણે કહ્યું કે, મહિલાઓએ શનિના દર્શન ન કરવા જોઈએ. કેમ કે શનિની પૂજાથી તેમનું અનિષ્ઠ થઈ શકે છે. તેમના પર બળાત્કાર જેવી અપ્રિય ઘટનાઓ વધશે. એક ધર્મગુરુએ આવી વાત ના કરવી જોઈએ એવું સૌ માનતા પણ સ્વામીજીને કોઈની પરવા નહોતી. સ્વામીજી રાજકીયરીતે કોંગ્રેસના તરફદાર હતા અને ભાજપના વિરોધી હતા. આ કારણે કેન્દ્ર સરકાર પર અયોધ્યામાં રામ મંદિરના નામ પર જનતાને મૂર્ખ બનાવવાનો આરોપ લગાવ્યો હતો. મોદી અંગે સવાલ પૂછનાર યુવકને તેમણે તમાચો પણ ઠોકી દીધો હતો. ખેર, હવે સ્વામીજીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. ત્યારે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સૌએ કરવી રહી.

મહાન ટેનિસ ખેલાડી રોજર ફેડરરે નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હી

સપ્ટેમ્બર 2022નો મહિનો જાણે નિવૃત્તિનો મહિનો છે. ભારતીય અને વિશ્વ ક્રિકેટ જગતમાંથી રાજનામાની સાથે ટેનિસ કોર્ટને સેરેના વિલિયમ્સે પણ અલવિદા કહ્યું છે. આ યાદીમાં ગુરૂવારે વધુ એક નામ જોડાયું છે. ઓસ્ટ્રેલિયન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન અને અમેરિકન ઓપન-એમ વિશ્વની ચારે અગ્રણી ટેનિસ સ્પર્ધાઓમાં વિજેતા બનીને વીસ જેટલાં ગ્રાન્ડ સ્લામ સિંગલ્સ ટાઇટલના વિજેતા બનેલ રોજર ફેડરરે ટેનિસની દુનિયાને અલવિદા કરવાની જાહેરાત કરી છે. સ્વિટ્ઝર્લેન્ડમાં જન્મેલો આ ખેલાડીએ ટેનિસની રમતને એક નવી ઓળખ આપી છે. માત્ર ટેનિસ નહિ પરંતુ ઉમદા ભગીરથ કાર્યોને કારણે પણ



ફેડરરના રેકોર્ડ

- » એસોસિએશન ઓફ ટેનિસ પ્રોફેશનલ્સ (ATP) દ્વારા 310 અઠવાડિયા માટે વિશ્વમાં નંબર 1 ક્રમ મળ્યો
- » સતત 237 અઠવાડિયા સુધી નંબર-1 ખેલાડીનું બહુમાન
- » પાંચ વખત વર્ષના અંતે નંબર 1 ખેલાડી રહ્યો
- » જુમી કોનર્સ પછી બીજા સૌથી વધુ 103 ATP સિંગલ્સ ટાઇટલ જીત્યા
- » 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ
- » ઐતિહાસિક 8 મેન્સ સિંગલ્સ વિમ્બલ્ડન ટાઇટલ
- » પાંચ મેન્સ સિંગલ્સ યુએસ ઓપન ટાઇટલ
- » યર એન્ડ ચેમ્પિયનશિપ્સનો ખિતાબ રેકોર્ડ છ વખત

નામના મેળવનાર ફેડરરે આજે 15મી સપ્ટેમ્બર, 2022ના રોજ ટેનિસ કોર્ટમાંથી બહાર જવાનો નિર્ધાર કર્યો છે. ટેનિસ દિગ્ગજે રિટાયરમેન્ટ અંગેની દિવટમાં જણાવ્યું કે આપ સૌને ખબર છે કે છેલ્લા 3 વર્ષ અનેક કારણોસર મારા માટે મુશ્કેલીભર્યા રહ્યાં છે. આ સમયગાળામાં અનેક ઈન્જરી(ઈજા) અને સર્જરી(ઉપચાર)માંથી પસાર થવું પડ્યું છે. મેં ફરી ટેનિસ કોર્ટમાં પહોંચવા અથવા પરિશ્રમ કર્યો છે પરંતુ હું પણ મારી બોડીની ક્ષમતા અને મર્યાદા વિશે જાણું છું. મારું શરીર હવે જવાબ આપી રહ્યું છે. મોડું થઈ ગયું છે હવે. હું 41 વર્ષનો થયો છું. આ દિવટમાં પોતાની ભાવના અને ઈજા સામે લડીને અંતે એક યોદ્ધા તરીકે ફેડરરે નિવૃત્તિની જાહેરાત કરી છે.

વર્લ્ડ કપ માટેની ભારતની ટીમ જાહેર જસપ્રીત બુમરાહ, હર્ષલ પટેલ ફિટ

અવેશ ખાન અને બિશ્નોઈ ટીમમાંથી બહાર : શમી, સેમસન, કિશનને સ્થાન નહીં

મુંબઈ

આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં રમાનાર ટી-20ના વર્લ્ડ કપ માટેની ભારતની 11 ખેલાડીઓ અને ચાર સ્ટેન્ડ બાય ખેલાડીઓની ટીમ ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેર કરી છે. જેમાં ખાસ કોઈ અણધાર્યા ખેલાડીઓનો સમાવેશ કે બાદબાકી નથી થઈ. ચાહકો માટે ખુશીના સમાચાર એ છે કે મેચ વીનર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ફિટ થઈ જતા બંનેનો સમાવેશ થયો છે. યુ.એ.ઈ.માં રમાયેલ એશિયા કપમાં



ખેલાડીઓ પર વિશ્વાસ જારી રાખ્યો છે. રિષભ પંત અને દિનેશ કાર્તિક બંનેને વિકેટ કિપર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. સેમસન અને ઈશાન કિશન પણ ટીમમાં સ્થાન માટે આશા રાખતા હશે. એશિયા કપની ટીમમાં સામેલ લેગ સ્પિનર રવિ બિશ્નોઈ અને ફાસ્ટ બોલર અવેશ ખાનને બુમરાહ અને હર્ષલ પટેલ માટે જગ્યા કરવી પડી હતી. અશ્વીન અને બિશ્નોઈ વચ્ચે સ્પર્ધા થઈ શકે પણ અશ્વિનનો અનુભવ અને ઓલરાઉન્ડર ક્ષમતા તેને સ્થાન માટે મદદરૂપ થઈ.

ટી-20 રેન્કિંગ : કોહલી બેટ્સમેનોમાં 18 સ્થાનનાં જમ્પ સાથે 1પમાં ક્રમે

દુબઈ

એશિયા કપ સુપર ફોરની આખરી મેચમાં અફઘાનિસ્તાન સામે ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ અણનમ 122 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેની આ ત્રણ વર્ષમાં સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય સદી હતી, જ્યારે ટી-20 ઈન્ટરનેશનલમાં તેણે આ પ્રથમ સદી ફટકારી હતી. કોહલીએ ફોર્મ બતાવતા તેને રેન્કિંગમાં પણ ફાયદો થયો છે અને તે 18 સ્થાનના જમ્પ સાથે ટી-20 બેટ્સમેનોની યાદીમાં 1પમાં ક્રમે આવી પહોંચ્યો છે.

આઈસીસી ટી-20 બેટિંગ રેન્કિંગમાં ભારતના સૂર્યકુમારે ચોથો ક્રમ જાળવી રાખ્યો છે. તે ભારતનો ડાઈ રેન્ક ધરાવતો

ખેલાડી છે. જ્યારે ટોચના ત્રણ સ્થાન પર અનુક્રમે રિઝવાન, માર્કરમ અને બાબર યથાવત્ છે. એશિયા કપ ટી-20ના સમાપન બાદ બેટ્સમેન અને બોલર્સની ટોપ-10ની યાદીમાં મેજર ફેરફાર થયો નથી. કોહલીએ એશિયા કપની પાંચ ટી-20માં 206 રન ફટકાર્યા હતા. તેની આગળ રોહિત શર્મા છે, જેને 17મો ક્રમ મળ્યો છે, તેના 106 પોઈન્ટ્સ છે.

જ્યારે બોલર્સની યાદીમાં ડેલ્લવૂડ ટોચ પર છે. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના શમ્સી, ઈંગ્લેન્ડના રાશિદ, ઓસ્ટ્રેલિયાના ઝમ્પા અને અફઘાનિસ્તાનના રાશિદ ખાનને તક મળી છે. જ્યારે ભુવનેશ્વર એક સ્થાનની પડતી સાથે સાતમા ક્રમે ફેંકાયો છે.

પાક.ના પૂર્વ ક્રિકેટ અમ્પાયર અસદ રઉફનું નિધન



લાહોર: પાકિસ્તાનના ભૂતપૂર્વ અમ્પાયર અસદ રઉફનું 66 વર્ષની વયે હૃદય રોગના હુમલા બાદ નિધન થયું છે. તેમના પરિવારજનોએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત સારી નહોતી રહેતી અને દુકાનથી વહેલા આવી જતા હતા. રઉફની કારકિર્દીનો અંત વિવાદાસ્પદ રહ્યો હતો. આઈપીએલમાં અમ્પાયરિંગ કરવા દરમિયાન તેઓ આઈસીસીએ અમ્પાયરો માટે જે આચારસંહિતા ઘડી છે તે પ્રમાણે કાર્ય નહતા કરતા. તેઓ ભેટસોગાદો સ્વીકારતા હતા અને અમુક નિર્ણયોની ટીકા થતા ભારતીય ક્રિકેટ બોર્ડે અસદ રઉફ પર 2016માં પ્રતિબંધ મૂક્યો હતો અને તે સાથે જ આઈસીસીની પેનલમાંથી પણ તેઓની બાદબાકી થઈ હતી.

ટી-20 વર્લ્ડ કપની ભારત-પાક. વચ્ચેની મેચમાં એક લાખથી વધુ પ્રેક્ષકો હશે

મેલબોર્ન: આવતા મહિને ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી-20 વર્લ્ડકપની ભારતની પ્રથમ મેચ બેંગાલુરુ પાકિસ્તાન સામે ૧૬ થી ૨૩ ઓક્ટોબરે એટલે કે દિવાળીના આગલા દિવસે મેલબોર્નમાં રમાનાર છે. વર્લ્ડકપનું સૌથી મોટું આકર્ષણ આ મેચ ૧૬ થી ૨૩ ઓક્ટોબરે તો મોટી સંખ્યામાં એશિયનોની વસ્તી છે ૧૬ પાલ કેટલીક પસંદગીની મેચ બેવા માટે વિશ્વભરના ચાહકો ઓસ્ટ્રેલિયા આવવાના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ અને હવે પણ ખૂબ માંગ હોઈ આયોજકોએ પ્રદક્ષકો ઊભા રહીને પણ મેચ બોઈ શકે તેવી વ્યવસ્થા કરવાનું નક્કી કર્યું છે. એક સ્ટેન્ડ તો ઊભા થઈને બોઈ શકાય તે માટેનું બુકિંગમાં ઓપન કર્યું હતું તે પણ ભરચક થઈ જતા વધુ સ્ટેન્ડ બનાવવાઈ રહ્યા છે. એક અંદાજ પ્રમાણે એક લાખ ૧૦ હજારથી વધુ ચાહકો મેચ બેવા આવશે તેમ મનાય છે.

ભારતીય ટીમના સ્ટાર ઓપનર રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ કરી ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત

નવી દિલ્હી: ભારતીય ટીમના સ્ટાર ઓપનર રહી ચુકેલા રોબિન ઉથપ્પાએ ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. રોબિન ઉથપ્પાએ ક્રિકેટના તમામ ફોર્મેટ અને ભારતીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. ટીમ ઈન્ડિયા જ્યારે T20 વર્લ્ડ કપની પ્રથમ એટલે કે, 2007ની સીઝન જીત્યું હતું ત્યારે ઉથપ્પા ટીમના સ્ટાર ઓપનર હતા. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની ટીમના કેપ્ટન હતા. તે ટુર્નામેન્ટમાં ઉથપ્પાએ પાકિસ્તાન સામેની 'બોલ આઉટ' સુધી પહોંચેલા મુકાબલામાં ભારતને વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યાર બાદ તેઓ ખૂબ જ લોકપ્રિય બની ગયા હતા. ઉથપ્પા IPLમાં ધોનીની કેપ્ટનશિપમાં જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે અંતિમ મેચ રમ્યા હતા.



Sri Radha Krishna Temple

1960 Ellesmere Road Unit 9 Scarborough ON M1H 2V9

srkt2000@gmail.com 416-431-3311 www.sriradhakrishnatemple.ca

અભિનંદન!

તમામ ગુજરાતી પરિવારોના માત્ર અને માત્ર અંગેજી ભાષા સમજનાર સંતાનો અને સ્નેહીજનો માટે શ્રી રાધા-કૃષ્ણ મંદિર તરફથી વાસ્તવિક જીવનને પ્રતિબિંબિત કરતા અને જીવનને પ્રગતિના રસ્તે લઈ જતા ક્રાંતિકારી પુસ્તકનું અદ્યતન પ્રકાશન હવે ઉપલબ્ધ છે. આ પુસ્તકની નકલ મેળવવા અને પુસ્તકને સ્પોન્સર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાવવા આજે જ સંપર્ક કરો:

શ્રી. શર્માજી (ફોન. નં. : ૪૧૬-૪૩૧-૩૩૧૧)



FOREWORD


“Parents : Our Treasure” is a wonderful and very valuable collection of great firsthand experience and priceless thoughts and comments of Parents and Grandparents themselves in an interesting sequence. Particularly for the children and grand children of the immigrant children of the immigrant families living abroad, this book is an eye opening as well as soul searching and thought provoking masterpiece written by Sh. Niranjana Shah. The best part of this book is that you can open the book on any page and read as much you want to read at a time.

Parents and Grandparents are our Precious and Priceless Treasure, Cherish and treasure your time with your parents. Treasure your parents and grandparents in time, lest it is too late. Parents and Grandparents are inspiration. They sow the seeds of greatness. They are the most special and loveliest people on the earth, or in the three worlds for that matter. They guide, they inspire, they encourage, they love you even if you are wrong. Don't imagine life without their Ashirvad (blessings). Parents and Grandparents are a family's greatest assets and should be honoured, valued and celebrated for everything they have done and for what they are.

Specially for the immigrant families Parents and Grandparents are a strong and stable foundation for keeping family together. They are trunks of the family tree and heritage. They have a wealth experience, skills and wisdom of life. You have to overcome the challenge of the long-distance relationship in foreign countries and in the home country. Even if the grandparents live here or in India, visit them often and ignore the cultural gap and language barrier.

Foster a healthy positive relationship between grandparents and grandchildren. Create opportunities as possible for grandparents to spend their quality time with their grandchildren. Encourage grandchildren to know and love their grandparents, before it is too late.

Prof. Ratnakar Narale Parent and Grandparent, Toronto, Canada.



800 કરોડના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ

વિપુલ ચૌધરીના પત્ની અને પુત્ર વિરૂદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો, કૌભાંડના નાણાંનું સેટલમેન્ટ કરવા માટે 31 ડી સી કંપનીઓ બનાવી

અમદાવાદ

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ૮૦૦ કરોડના કૌભાંડના અનુસંધાનમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેમનાં પત્ની ગીતા ચૌધરી, પુત્ર પવન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. એસીબીએ દાખલ કરેલી ફરિયાદ મુજબ કૌભાંડના નાણાંની ઉચાપત કરવા માટે વિપુલ ચૌધરીએ ૩૧ જેટલી ડી સી કંપનીઓ બનાવી હતી. જેમાં તમામ નાણાં ખોટી એન્ટ્રી બતાવીને ટ્રાન્સફર કરાયાં હતા. આ કેસની તપાસમાં દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણી પણ બહાર આવી શકે તેવી શક્યતા

અર્બુદા સેના રોષમાં, આંદોલનની ચીમકી



વિપુલ ચૌધરીની અટકાયત બાદ અર્બુદા સેનામાં ભારે રોષ વ્યાપ્યો છે અને અર્બુદા સેનાના તમામ સભ્યો વિપુલ ચૌધરીના નિવાસ સ્થાને એકત્રિત થયા હતા. તેઓ સૌ સરકારે જે રીતે વિપુલ ચૌધરીની અટકાયત કરી તેનાથી રોષે ભરાયા છે અને સરકાર સામે બાથ ભીડવાની તૈયારી કરી રહ્યા છે. અર્બુદા સેનાના સદસ્યોના કહેવા પ્રમાણે રાજ્યના પૂર્વ ગૃહમંત્રીની આ પ્રકારે ધરપકડ કરવી તે યોગ્ય નથી અને અર્બુદા સેના આ મામલે સરકાર સામે આંદોલન પર ઉતરશે.

એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરી હતી. જે દુધસાગર ડેરીમાં થયેલા ભ્રષ્ટાચારના ગુનામાં કેસ અંગે એસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર મકરંદ બુધવારે મોડી રાત્રે ડેરીના પૂર્વ ચેરમેન અને ચૌધરી જણાવ્યું કે વિપુલ ચૌધરી વર્ષ ૨૦૦૫થી વર્ષ ૨૦૧૬ સુધી દૂધસાગર ડેરીના ચેરમેન

પટે હતા તે દરમિયાન તેમણે સત્તાનો દુરપયોગ કરીને રૂપિયા ૮૦૦ કરોડના નાણાંકીય કૌભાંડ આચર્યા હતા. જે અનુસંધાનમાં મહેસાણા એસીબી ખાતે વિપુલ ચૌધરી, તેમના પત્ની ગીતાબેન ચૌધરી, પુત્ર પવન ચૌધરી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શૈલેષ પરીખ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આ સમગ્ર કૌભાંડ ૮૦૦ કરોડ રૂપિયાનું છે. તેમણે સત્તાનો ગેરઉપયોગ કરીને ટેન્ડરની પ્રક્રિયા કર્યા વિના જ મોટા પ્રમાણમાં બટર મિલ્ક કૂલરની ખરીદી કરી હતી. સાથે તેમણે ડેરીના અધિકારીઓની પરવાનગી વિના જ ઊંચા રેટ આપનાર એજન્સીને કામ આપીને અંગત આર્થિક ફાયદો લીધો હતો.

ગુજરાત રાજ્યમાં સપનાના વેપાર કરનારને સફળતા નહિ મળે : શાહ

ગાંધીનગર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 1 વર્ષ પૂર્ણ કરવા પર અભિનંદન આપતા કહ્યું કે, તેમણે તેમની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવનારાઓને પોતાના કામ દ્વારા જવાબ આપ્યા છે.

અમિત શાહે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કોંગ્રેસના રાજમાં ગુજરાતમાં તોફાનો, બોમ્બ ધડાકા અને કફરૂં જોવા મળતું હતું પરંતુ ભાજપના રાજમાં આ તમામ ઘટનાઓ ગુમ થઈ ગઈ છે. અમિત શાહે ડ્રગ્સ મામલે ગુજરાત સરકાર

દ્વારા કરવામાં આવેલી કામગીરી બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

અમિત શાહે દિલ્હીના CM કેજરીવાલ પર પણ પ્રહારો કર્યા હતા. તેમણે ભરોસો વ્યક્ત કર્યો હતો કે, કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલી મફતની ઘોષણાઓની જનતા પર કોઈ અસર નહીં થશે. અમિત શાહે સપનાના વેપાર કરનારને સફળતા નહીં મળે એમ કહી કેજરીવાલ પર પ્રહાર કર્યો હતો. અમિત શાહે એવો પણ દાવો કર્યો છે કે, ભાજપ 2/3 બહુમતી સાથે ફરી સરકાર બનાવશે.

અમદાવાદમાં એસ્પાયર-ટુના બાંધકામ સમયે સ્લેબનું માળખું તૂટી પડતાં 8 શ્રમિકનાં મોત

અમદાવાદ



અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક એસ્પાયર-ટુ નામના બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું હતું. આ સમયે માંચડો તુટી પડતા આઠ શ્રમિકોનાં મોત થયા હતા. આ ઘટનાની આઘાતજનક બાબત તો એ હતી કે, તેરમા માળથી બેઝમેન્ટના માર્બલ - ટુ સુધી આઠ શ્રમિકો પડ્યા હતા. આઠ શ્રમિક પૈકી માત્ર એક શ્રમિક હાલ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. શ્રમિકોને કામગીરીમાં મદદ મળી રહે એ માટે વચ્ચે બાંધવામાં આવેલી નેટ પણ

આ શ્રમિકોને બચાવી શકી નહોતી. દુર્ઘટનાની જાણ પોલીસ અને ફાયર વિભાગને પણ કરવામાં આવી નહોતી. ફાયર વિભાગને મિડીયા દ્વારા જાણ થતાં ઘટના સ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચી હતી. એ સમયે એક પણ ઓફિસ બેરર સ્થળ ઉપર હાજર નહોતો. આ

બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ડેવલપરને આપવામાં આવેલી બાંધકામની મંજૂરી રદ કરવી જોઈએ એવી કોંગ્રેસની માંગ છે.

મૃતક શ્રમિકોમાં કોણ-કોણ?

૧. અશ્વિન નાયક	ઉ.વર્ષ-૨૦
૨. સંજય નાયક	ઉ.વર્ષ-૨૦
૩. જગદીશ નાયક	ઉ.વર્ષ-૨૧
૪. મુકેશ નાયક	ઉ.વર્ષ-૨૫
૫. રજમલ ખરાડી	ઉ.વર્ષ-૨૫
૬. સંજય નાયક	ઉ.વર્ષ-૨૪
૭. શૈલેષ નાયક	ઉ.વર્ષ-૨૦

જખૌના દરિયામાંથી રૂ. 200 કરોડનું 40 કિલો હેરોઈન જપ્ત : 8 જણાની ધરપકડ

પકડાયેલાઓમાં 6 પાકિસ્તાની : પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબદુલ્લાએ ડ્રગ્સ મોકલ્યું હતું

અમદાવાદ

ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા મંગળવારે રાતના સમયે જખૌના મધદરિયે આઈએમબીએલ પરથી એક પાકિસ્તાની ફીસીંગ બોટને ઝડપીને તેમાંથી રૂપિયા ૨૦૦ કરોડની કિંમતનું ૪૦ કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. જે અંગે કરાચીમાં રહેતા છ પાકિસ્તાનીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અમૃતસરની જેલમાંથી ભારતના ડ્રગ્સ માફિયાએ પાકિસ્તાનના અબ્દુલ્લા

નામના ડ્રગ્સ ડીલરે આ ડ્રગ્સ ભારત મોકલ્યું હતું. આ દરમિયાન એટીએસની એક ટીમ દ્વારા આ ડ્રગ્સની ડીલેવરી લેવા આવેલા બે વ્યક્તિઓને પણ અમદાવાદથી ઝડપી લીધા હતા. જે અંગે કોસ્ટ ગાર્ડની ઈન્વેસ્ટિગેશન વિંગ અને એટીએસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી કે કે પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે પાકિસ્તાનના કરાચી સ્થિત અબ્દુલ્લા

નામના ડ્રગ્સ માફિયાએ કરાચી પોર્ટથી મોટાપ્રમાણમાં હેરોઈન ડ્રગ્સ જખૌના દરિયાકિનારેથી ગુજરાતમાં ઘુસારીને ત્યાંથી પંજાબ અને ઉત્તર ભારતમાં મોકલવાનું છે. જે બાતમીને આધારે પોલીસની ટીમ જખૌ બંદર પહોંચી હતી અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે ટીપ ઓફના આધારે સાથે મળીને જોઈન્ટ ઓપરેશન કરવામાં આવ્યું હતું. મધદરિયે ઈન્ટરનેશનલ મેરીટાઈમ બ્રાઉન્ડ્રી લાઈન પર વોચ રાખવામાં આવી હતી.

ભાજપના સપનામાં ભરમાતા નહિ, લોકો જ CM નક્કી કરશે: કેજરીવાલ

અમદાવાદ

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. ત્યારે તેમણે ગુજરાતની જનતા માટે વધુ એક ગેરેન્ટી આપી અને કહ્યું કે, બે મહિના બાકી છે, બીજેપી જઈ રહી છે અને આમ આદમી પાર્ટી આવી રહી છે. હું છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાતમાં ફરું છું, તેમજ વકીલો, ઓટો ડ્રાઈવરો, ખેડૂતો, વેપારીઓ, મને મળ્યા.. દરેકે કહ્યું કે, ગુજરાતમાં ખૂણે ખૂણે ભ્રષ્ટાચાર વ્યાપી ચૂક્યો છે. જો તમારે કોઈપણ સરકારી વિભાગમાં કામ કરાવવું હોય તો તમારે પૈસા ચૂકવવા પડે છે. નીચલા

સ્તરે પણ ભ્રષ્ટાચાર છે, ઉપરના સ્તરે પણ આક્ષેપો થયા છે.

જો તમે તેમની સામે અવાજ ઉઠાવો તો ધમકાવે છે વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો હું ગુજરાતની જનતાને મફત વીજળી આપવાની વાત કરી રહ્યો છું, તો ભાજપ શા માટે તેનો વિરોધ કરી રહી છે? જો હું શાળા હોસ્પિટલ સુધારવાની વાત કરું છું તો ભાજપને શું વાંધો છે, શા માટે વિરોધ કરી રહ્યા છે? તેમણે કહ્યું હતું કે ભાજપના સપનામાં ભરવાશો નહીં, રાજ્યની જનતા જ નક્કી કરશે કે સીએમ કોણ બનશે.

વકફ એક્ટની ગેરકાયદે જોગવાઈ રદબાતલ જાહેર કરવા હાઈકોર્ટમાં રિટ

અમદાવાદ

વકફ એક્ટ-૧૯૯૫ની બંધારણીય કાયદેસરતાને પડકારતી મહત્વની રિટ અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે, જેમાં વકફ એક્ટની જોગવાઈઓનો ગંભીર પ્રકારે દુરપયોગ થઈ રહ્યો છે અને બંધારણીય જોગવાઈઓ અને મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું હોઈ આ કાયદાને ગેરકાયદે અને રદબાતલ જાહેર કરવા દાદ માંગવામાં આવી છે. આ કેસમાં મહત્વના કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરાયા હોઈ કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ હાઈકોર્ટ આ રિટ અરજી રૂલ(દાખલ) કરી હતી. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

ગુજરાતમાં ફિલ્મ સીટી બનશે! સરકાર 'સિનેમેટિક ટુરિઝમ પોલિસી' બનાવશે

અમદાવાદ

ગુજરાત 'પોલિસી ડ્રિવન સ્ટેટ' તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી 'સિનેમેટિક ટુરિઝમ પોલિસી-2022-2027' જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી પણ ઉપસ્થિત

રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી 'સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027' ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

ગોમતીપુરમાં ભાજપના પ્રમુખ ઉપર AAPના કાર્યકરોનો છરીથી હુમલો

અમદાવાદ

આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે અમદાવાદના ગોમતીપુરમાં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીના ગોમતીપુર વોર્ડના યુવા મોરચાના પ્રમુખ પવન કુમાર તોમર ઉપર આમ આદમી પાર્ટીના કાર્યકર્તા સાહિલ ઠાકોરે છરીથી હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર અર્થે શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોમતીપુર પોલીસે હોસ્પિટલ પહોંચીને ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

કાશ્મીર પોલીસ ભરતી કૌભાંડ : ગુજરાત સહિત દેશના 33 સ્થળે CBIના દરોડા

બોર્ડના પૂર્વ ચેરમેન, DSP, CRPFના અધિકારી, ઉમેદવારો સહિત 33 સામે કાર્યવાહી શ્રીનગર/નવી દિલ્હી

જમ્મુ કાશ્મીરના સબ-ઇન્સ્પેક્ટર રિક્રૂટમેન્ટ પરીક્ષા કૌભાંડની તપાસ સીબીઆઈ કરી રહી છે. આ ભરતી કૌભાંડને લઈને સીબીઆઈએ ગુજરાત, દિલ્હી, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોના દેશભરમાં ૩૩ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જે સ્થળોએ દરોડા પડ્યા છે તેમાં જમ્મુ કાશ્મીર સર્વિસ સિલેક્શન બોર્ડના પૂર્વ ચેરમેન ખાલિદ જેહાંગીર અને જમ્મુ કાશ્મીરના ડીએસપી તેમજ સીઆરપીએફના અધિકારીનો પણ સમાવેશ થાય છે.

જે સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે તેમાં ગુજરાતના ગાંધીનગરમાં, જમ્મુ કાશ્મીરના જમ્મુ, શ્રીનગર, હરિયાણાના કર્નાલ, મહેન્દ્રગઢ, રેવાડી, દિલ્હી, ઉત્તર



પ્રદેશના ગાઝિયાબાદ, કર્ણાટકના બેંગાલુરુનો પણ સમાવેશ થાય છે. આ શહેરો ઉપરાંત કુલ ૩૩ જેટલા સ્થળોએ સીબીઆઈ તપાસ કરી હતી. આ સમગ્ર કૌભાંડમાં કુલ ૩૩ લોકોની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

હૈદરાબાદની હોટેલમાં આગ 7 લોકોનાં મોત, ૬૧ ઘાયલ

અન્ય 10 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હૈદરાબાદ

સિકંદરાબાદમાં ઈલેક્ટ્રિક બાઈક શોરૂમમાં લાગેલી આગ ઉપરના માળે આવી આવેલી હોટેલમાં ફેલાઈ જતાં એક મહિલા સહિત આઠ લોકોનાં મોત થયા છે. અન્ય ૬૧ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે. મોટા ભાગના પીડિતોના મોત ગૂંગળામણને કારણે થયા હતાં.

હોટેલમાં રોકાયેલ એક વ્યક્તિના જણાવ્યું હતું કે તેણે ભોંયરામાંથી જોયો આગ અને ધુમાડો નીકળતો જોયો હતો. આ જ વ્યક્તિએ થોડાક સમય

પછી પોલીસ ફરિયાદ કરી હતી. આ વ્યક્તિ અન્ય ચાર લોકો પાંચમાં માળેથી બાજુની બિલ્ડિંગમાં કૂદી ગયા હતાં અને ૧૦૦ નંબર પર મદદ માટે ફોન કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેલંગણાના પ્રધાન કે ટી રામારાવે મૃત્યુ પામેલા લોકો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. બંનેએ કેન્દ્ર અને રાજ્ય સરકાર વતી મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી હતી. હોટેલ રૂબી પ્રાઈડની નીચે ઈલેક્ટ્રિક બાઈકનો શોરૂમ છે. આ શોરૂમમાં લાગેલી આગ ઉપરના માળે હોટેલમાં પ્રસરી ગઈ હતી.

પુણેમાં ઓનલાઈન એપના રૂપિયા ચૂકવવા પૌત્રી દ્વારા દાદીની હત્યા

મુંબઈ
મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓનલાઈન લોન એપના પૈસા ચૂકવવા માટે એક પૌત્રીએ પોતાની દાદીની હત્યા કરી નાખી છે. ૭૦ વર્ષીય સુલોચના ડાંગેની હત્યા તેની ૨૪ વર્ષીય પૌત્રીએ એક લોન એપને ૧૫,૦૦૦ રૂપિયાનું વળતર ચૂકવવા માટે કરી દીધી હતી. પોલીસની પુછપરછ દરમિયાન આકાશનગરની ગૌરી ડાંગેએ તેની દાદી સુલોચના ડાંગેનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી છે. વરજે-માલવાડી પોલીસના જણાવ્યા પ્રમાણે તે જ ઘરમાં રહેતી ગૌરીએ પહેલા તેની દાદીનું ગળું

પત્નીને જીવતી સળગાવી દેનાર શિવસેના નેતા સાવંતની ધરપકડ

મુંબઈ
શિવસેના નેતા સુકાંત સાવંત ઉર્ફે ભાઈ સાવંતની પોતાની બીજી પત્નીને જીવતી સળગાવી મૂકવાના આરોપમાં ધરપકડ કરાઈ છે. રત્નાગિરી વિસ્તારના અસ્થિયોને સમુદ્રમાં વહાવી દીધી હતી જેથી કોઈ પુરાવા ન રહે અને તેઓ આ અપરાધથી નિર્દોષ બચી જાય. સુકાંત ઉપરાંત તેના બે સહયોગીઓ રૂપેશ ઉર્ફે છોટા સાવંત અને પ્રમોદ ઉર્ફે પામ્યા ગાવનાંગની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય વિરુદ્ધ હત્યા, પુરવા મિટાવવા અને ષડયંત્ર રચવા હેઠળ IPCની અલગ-અલગ ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.

‘ભારત જોડો’ યાત્રા વચ્ચે હવે ‘કોંગ્રેસ છોડો’ ગોવામાં આઠ ધારાસભ્ય ભાજપમાં સામેલ

ગોવાની વિધાનસભામાં હવે કોંગ્રેસ પાસે ત્રણ જ ધારાસભ્યો બચ્યા, ભાજપ પાસે 28 બેઠક

પણજી
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિગંબર કામત સહિત કોંગ્રેસના આઠ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. કોંગ્રેસ એક તરફ કન્યાકુમારીથી જમ્મુ કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહી છે જ્યારે બીજી તરફ તેને ગોવામાં મોટું નુકસાન થયું છે. ગોવામાં કોંગ્રેસના માત્ર ૧૧ જ ધારાસભ્યો હતા અને તેમાંથી આઠ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હોવાથી હવે માત્ર ત્રણ



જ ધારાસભ્યો રહ્યા છે. રાજીનામા આપનારા આ ૮ ધારાસભ્યો બાદમાં ભાજપમાં સામેલ થય હતા. આ ધારાસભ્યો સામેલ ગોવાના મુખ્યમંત્રી

પ્રમોદ સાવંત અને ભાજપ પ્રદેશ પ્રમુખ સદાનંદ શેત તનાવડે પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ રાજીનામાને શરમજનક અને ગદારીની ચરમસીમા ગણાવી હતી. આ ધારાસભ્યોના પક્ષપલટા બાદ હવે ગોવામાં ૪૦ બેઠકો ધરાવતી વિધાનસભામાં ભાજપ પાસે ૨૮, એમજીપી પાસે બે, અપક્ષ ત્રણ, કોંગ્રેસના ત્રણ અને આપના બે તેમજ જીએફપીના એક, આરજીપીના એક ધારાસભ્ય બચ્યા છે.

એર ઈન્ડિયા વિમાનના એન્જિનમાં ધુમાડો, 145 યાત્રીઓને ઉતારી દેવાયા

નવી દિલ્હી
નવી દિલ્હી : એર ઈન્ડિયા એક્સપ્રેસના બોઈંગ ૭૩૭ મસ્કટથી કોચીન સુધી નિયમિત ઉડાણ ભરે છે. તેના વિમાનમાં બુધવારે ટેઈકઓફ દરમિયાન વિમાનના એન્જિનમાંથી ધુમાડો અને ભડકા નીકળતા તમામ યાત્રીકોને ઉતારી દેવાયા હતા અને વિમાનના બંને એન્જિન બંધ કરી દેવાયા હતા. આ માહિતી આપતા ડીરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશનએ જણાવ્યું હતું કે ‘મસ્કટ કોચીન વચ્ચે થતા ઉડ્ડયનો પૈકી એર ઈન્ડિયા એક્સપ્રેસ B 737ફ્લાઈટ મસ્કટથી કોચીન આવવા ઉડ્ડયન ભરી રહી હતી તે દરમિયાન જ મસ્કટના રન-વે ઉપર જ વિમાનના એન્જિન નંબર-૨માંથી ધુમાડા નીકળતા તમામને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.

ફિચે ૨૦૨૨-૨૩ માટે આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૭% કર્યો

નવી દિલ્હી
મોંઘવારી અને તેને ડામવા કરવામાં આવી રહેલ વ્યાજદર વધારાની અસર ભારત સહિત વિશ્વના અર્થતંત્ર પર પડવાની આશંકાઓ વધતી જઈ રહી છે. ભારત સરકારના રદિયા છતા રેટિંગ એજન્સીઓને ભારતના વિકાસ પથ પર આશંકા સેવી રહી છે. દિગ્ગજ રેટિંગ એજન્સી ફિચે ભારતના જીડીપી વૃદ્ધિ અનુમાનમાં ઘટાડો કર્યો છે ફિચે તાજેતરના રિપોર્ટમાં કહ્યું કે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે ભારતની આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૭ ટકા કર્યો છે. જૂન ૨૦૨૨માં આ અનુમાન ૭.૮ ટકા અંદાજવામાં આવ્યું હતું. આ સાથે એફવાય૨૪ માટે વૃદ્ધિનો અંદાજ ઘટાડીને ૬.૭ ટકા કરવામાં આવ્યો છે,

ન્યૂઝ ટ્રિફ

રાજસ્થાનમાં ફરી સચિન પાયલટ અને અશોક ગેહલોતના સમર્થકો સામસામે

જયપુર : રાજસ્થાનમાં ફરીથી સચિન પાયલટ અને અશોક ગેહલોતના સમર્થકો આમને-સામને આવી ગયા છે. ગેહલોત કેમ્પના ખેલ મંત્રી અશોક ચાંદનાએ સચિન પાયલટ પર તીખા પ્રહાર કર્યા છે. અશોક ચાંદનાએ કહ્યું છે કે, હું લડીશ તો એક જ બચશે. અજમેર જિલ્લાના પુષ્કરમાં એક કાર્યક્રમમાં ચાંદનાનું સચિન પાયલટના સમર્થકોએ વિરોધ કરતા તેમની તરફ ચંપલ ફેંક્યા હતા. કાર્યક્રમમાં સચિન પાયલટ જિંદાબાદના નારા લાગ્યા હતા. આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા ચાંદનાએ ટ્વીટ કર્યું કે મારા પર ચંપલ ફેંકાવીને જો સચિન પાયલટ મુખ્યમંત્રી બનવા માંગે તો જલ્દીથી બની જાવ કારણ કે, આજે મારુ લડવાનું મન નથી. જે દિવસે હું લડીશ ત્યારે કોઈ એક જ બચશે અને તે હું નથી ઈચ્છતો.

આસામમાં ઇમામ સહિત બે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરાઈ

ગુવાહાટી : આસામમાંથી બે શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શંકાસ્પદો અંસારુલ્લાહ બાંગલા ટીમ એબીટી સાથે જોડાયેલા છે. અને તેમના નામ મુસાદિક હુસૈન અને ઇક્રામુલ ઇસ્લામ છે. એક શંકાસ્પદ ઇમામ છે અને તેને નાગાંવ જિલ્લામાંથી ઝડપી લેવાયો હતો. ગત મહીને મોરાંગાંવ જિલ્લા પ્રશાસને મોઘરાબારીમાં મદદેસાને ધ્વંસ કરી દીધું હતું. આ સમયે પોલીસે મદદેસામાં એક આતંકી મોડચૂલનો પણ પુલાસો કર્યો હતો. જે બાદ આ મદદેસાને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધી આસામમાં આતંકી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ત્રણ મદદેસાને તોડી પાડવામાં આવ્યા છે. જ્યારે ૪૦થી વધુ લોકોની ધરપકડ પણ કરવામાં આવી ચુકી છે. એક મદદેસાને લોકોએ જ તોડી પાડ્યું હતું અને તેમાં પણ આતંકી લિંક હોવાના પુરાવા મળ્યા હતા તેવો દાવો સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચે વધુ ૮૬ અસ્તિત્વ વગરના રાજકીય પક્ષોને ડિલીસ્ટ કર્યા

નવી દિલ્હી : ચૂંટણી પંચે વધુ ૮૬ અસ્તિત્વ વગરના રજિસ્ટર્ડ ગેરકાયદે રાજકીય પક્ષોને પોતાની યાદીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે. ચૂંટણી નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહેવાના કારણે ૫૬ કાર્યવાહી પક્ષોની સંખ્યા વધીને ૫૩૭ થઈ ગઈ છે. ચૂંટણી પંચે એક નિવેદનમાં જણાવ્યું છે કે વ્યાપક જનહિતની સાથે સાથે ચૂંટણી લોકશાહી જળવાઈ રહે તે માટે તાત્કાલિક સુધારાત્મક ઉપાય કરવાની જરૂર છે. આ નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ચૂંટણી પંચે આજે ૮૬ અસ્તિત્વહીન રજિસ્ટર્ડ ગેરકાયદે રાજકીય પક્ષોને પોતાની યાદીમાંથી દૂર કર્યા છે. અન્ય ૨૫૩ને નિષ્ક્રિય આરયુપીપી બંધ કરવામાં આવ્યા છે. નિવેદન અનુસાર નિયમોનું પાલન ન કરતા ૩૩૯ આરયુપીપી વિરુદ્ધ કાર્યવાહી પછી આ પ્રકારના આરયુપીપીની સંખ્યા ૫૩૭ થઈ ગઈ છે.

સોનાલી ફોગટ હત્યા કેસની તપાસ CBI પાસે કરાવવા ગૃહ મંત્રાલયનો આદેશ

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોનાલી ફોગટ હત્યા કેસમાં સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. ૨૩મી ઓગસ્ટે ટિકટોક સ્ટાર અને ભાજપની નેતા સોનાલી ફોગટની ગોવામાં હત્યા થઈ હતી. એ મુદ્દે ગોવા પોલીસે સોનાલીના પીએ સહિત પાંચ આરોપીઓની ધરપકડ પણ કરી છે. સોનાલીના પરિવારે સીબીઆઈ તપાસની માગણી કરી હતી. સોનાલી ફોગટ હત્યા કેસની સીબીઆઈ તપાસનો કેન્દ્રીય મંત્રાલયે આદેશ આપ્યો છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અગાઉ ગૃહ મંત્રાલયને પત્ર લખીને સોનાલી ફોગટ હત્યા કેસની સીબીઆઈ તપાસ કરાવવા રજૂઆત કરી હતી. પ્રમોદ સાવંતે ઉમેર્યું હતું કે ગોવા પોલીસે આ કેસમાં સારી તપાસ કરી છે. બધા જ પાસાઓ બાબતે વિચારાવું છે, કેટલાક પુરાવા મળ્યા છે.

કાશ્મીરના પૂંચમાં બસ પલટી જતાં 11ના મોત, 29 ઘાયલ

બસ 250 ફીટ ઊંડી ખીણમાં પથ્થરો પર પડી: લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 5 લાખનું વળતર જાહેર કર્યું

જમ્મુ

જમ્મુ કાશ્મીરના પૂંચમાં બુધવારે ખીચોખીચ ભરેલી મીની બસ ઊંડી ખીણમાં પલટી ખાઈ જતા 11 લોકોના મોત થયા હતા જ્યારે 2૯ લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં ૪ મહિલાઓ સામેલ છે. અધિકારીઓના મતે બસ જ્યારે ગલી મેદાનથી પૂંચ તરફ જતી હતી ત્યારે બરારી નાલ્લાહ પાસે અકસ્માત થયો હતો. આર્મી, પોલીસ અને ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ, અકસ્માતમાં ઘાયલ થયેલાં ૨૯ની હાલત અત્યંત ગંભીર છે. જેમાંથી ૬ ને ખાસ સારવાર માટે એરલિફ્ટ કરીને જમ્મુની સરકારી મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા

છે. બસ ૨૫૦ ફીટ ઊંડી ખીણમાં પડી હતી અને મોટા પથ્થરો પર પટકાઈ હતી, જેના કારણે મીની બસનો કચ્ચરઘણ વળી ગયો હતો. આ બસમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ સામેલ હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ, વાઈસ પ્રેસિડેન્ટ જગદીપ ધનકર સહિતના નેતાઓએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, પૂંચમાં અકસ્માતને લીધે થયેલ જાનહાનિ ખુબ જ દુઃખદાયક છે. મારા વિચારો આ દુઃખની ઘડીમાં પોતાના પ્રિયજનો ગુમાવનાર સાથે છે. આ સાથે જ તેમણે રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના પરિવારજનોને રૂપિયા ૨ લાખ અને ઘાયલો ને રૂપિયા ૫૦,૦૦૦ના વળતરની જાહેરાત કરી હતી.



બેગુસરાય ફાયરિંગની ઘટના બદલ ૭ પોલીસકર્મી સસ્પેન્ડ

ઘટનામાં ભોગ બનેલા 11 પૈકી 1નું મોત થયું હતું

પટના

બિહારના બેગુસરાઈ ખાતે મોટરસાઈકલ પર સવાર ૨ બદમાશોએ શહેરના ૩૦ કિમી વિસ્તારમાં આરોહક ફાયરિંગ કરીને ૧૧ લોકોને ભોગ બનાવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે બાકીના ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ પ્રકારની ગતિવિધિ દ્વારા દહેશત ફેલાવવા ઈચ્છતા હતા પરંતુ સ્થાનિક પોલીસની પણ ચૂક કહેવાય માટે ૭ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં

આવ્યા છે. બેગુસરાઈના એસપી યોગેન્દ્ર કુમારે આ ગુનામાં સામેલ બંને બાઈકસવારોની તસવીર જાહેર કરીને લોકોને તે અંગે કોઈ માહિતી હોય તો જણાવવા માટે અપીલ કરી છે. પોલીસે નારંગી શર્ટમાં બાઈક પર સવાર શખ્સ અને તેની પાછળ બેઠેલા શકમંદ અંગેની સાચી માહિતી આપનારને ૫૦,૦૦૦ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. સાથે જ આ પ્રકારે માહિતી આપનારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે.

પશ્ચિમ બંગાળમાં ફરીથી રાજકીય હંગામો ભીષણ હિંસા, આગચંપી અને પથ્થરમારો

ભાજપ, ટીએમસી, પોલીસ વચ્ચે તકરાર : બંગાળમાં કોરિયા જેવી સ્થિતિ: શુભેન્દુ અધિકારી

કોલકાતા

પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી વચ્ચે ચાલી રહેલી તકરાર ઓછી થવાનું નામ નથી લઈ રહી. બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ સાથે શરૂ થયેલ હિંસા આજે પણ બંગાળની સડકો પર જોવા મળે છે. હવે મંગળવારે બીજેપીના વિરોધ પ્રદર્શનથી રાજ્યમાં ફરી હિંસા ભડકી ઉઠી છે. કેટલીક જગ્યાએ ભાજપની પોલીસ સાથે તકરાર થઈ તો કેટલાક વિસ્તારોમાં ટીએમસી કાર્યકર્તાઓ સાથે હિંસક અથડામણ પણ

થઈ છે. મમતા સરકાર ઘણા સમયથી સતત ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહી છે. આ આક્ષેપોને લઈને ભાજપે રસ્તા પર ઉતરવાની તૈયારી કરી હતી. કોલકાતામાં સચિવાલય સુધી કૂચ કાઢવાની હતી. પરંતુ પોલીસને પહેલાથી જ આ વાતની જાણ હોવાથી પહેલાથી જ મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઈ હતી. પોલીસે હાવડાથી સચિવાલય તરફ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડિંગ લગાવી દીધું હતું. આવી સ્થિતિમાં જ્યારે પ્રદર્શન

શરૂ થયું ત્યારે ભાજપના નેતા શુભેન્દુ અધિકારી, લોકેટ ચેટર્જી અને રાહુલ સિન્હાને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઉપરાંત ભાજપના અન્ય ઘણા કાર્યકરોને પણ કસ્ટડીમાં લેવાયા હતા. ત્યારબાદ રસ્તાઓ પર હંગામો વધી ગયો અને બડાબજાર પોલીસ સ્ટેશનની બહાર એક પોલીસ વાનને સળગાવી દેવામાં આવી. બીજી તરફ પૂર્વ મિદનાપુર અને તામલુક વિસ્તારોમાં ભાજપ અને ટીએમસીના ઘણા કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા.

મુંબઈમાં બેંકોના ખાનગી લોકરોમાંથી 47 કરોડનું 431 કિલો સોનું-ચાંદી જપ્ત

રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના ચાર સ્થળોએ ઇડીએ દરોડા પાડ્યા

નવી દિલ્હી

કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ બુધવારે કથિત બેંક લોન છેતરપિંડી કેસમાં મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે બુલિયન કંપનીના ખાનગી લોકરોની તપાસ કર્યા પછી ૪૭ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું સોનું અને ચાંદી જપ્ત કર્યું છે.

કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે પારેખ એલ્યુમિનેક્સ લિમિટેડ નામની કંપની

સામેના કેસ સંદર્ભે રક્ષા બુલિયન અને ક્લાસિક માર્બલ્સના ચાર સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઈડીએ પાડેલા દરોડાની કાર્યવાહી બુધવારે સમાપ્ત થઈ છે. આ સિકેટ લોકરોમાં તપાસ એજન્સીએ કુલ ૪૩૧ કિલો સોનું ચાંદી જપ્ત કર્યું છે. દરોડા દરમિયાન બુલિયન કંપનીના પરિસરમાંથી કેટલાક ખાનગી લોકરોની ચાવીઓ મળી આવી હતી. પ્રાઈવેટ લોકરોની શોધખોળ કરતાં જાણવા મળ્યું

હતું કે લોકરો યોગ્ય ધારાધોરણોને અનુસર્યા વિના ચલાવવામાં આવી રહ્યા હતા. કોઈ કેવાયસી નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું અને પરિસરમાં કોઈ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. સંકુલમાં ૭૬૧ લોકર હતા, જેમાંથી ત્રણ રક્ષા બુલિયનના હતા. તેમણે જણાવ્યું કે લોકરોની તપાસ કરતા માલૂમ પડ્યું કે બે લોકરમાં ૮૧.૫ કિલો ગોલ્ડ બાર અને ૧૫૨ કિલો ચાંદી મળી આવી હતી.

ભોપાલમાં નર્સરીની બાળકી પર સ્કૂલ બસના ડ્રાઈવર દ્વારા રેપ

ભોપાલ

મધ્ય પ્રદેશમાં માત્ર ચાર વર્ષની નર્સરીમાં અભ્યાસ કરતી બાળકી પર રેપની ઘટના સામે આવી છે. ભોપાલમાં નર્સરી અભ્યાસ માટે જે બસમાં દરરોજ લઈ જવાતી હતી તે જ બસના ડ્રાઈવર દ્વારા તેના પર બસમાં જ બળાટકાર ગુજારવામાં આવ્યો હતો. જેને પગલે હવે સ્કૂલ પ્રશાસનની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બીજી ડ્રાઈવરનું ગેરકાયદે મકાન તોડી પડાવ્યું હતું. બળાટકારની આ ઘટનાની જાણકારી બાળકીના માતા પિતા દ્વારા પોલીસને આપવામાં આવી હતી. જે

બાદ પોલીસે બસના ડ્રાઈવર અને એક મહિલાની ધરપકડ કરી હતી. બાળકીના માતા પિતાએ જણાવ્યું હતું કે જ્યારે રેપની આ ઘટના બની ત્યારે બસમાં ડ્રાઈવર ઉપરાંત ધરપકડ કરાયેલી મહિલા પણ હાજર હતી. સ્કૂલ પ્રશાસન દ્વારા આ મામલાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવા અંગે જ્યારે મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે સ્કૂલ પ્રશાસને આરોપી સામે કાર્યવાહીમાં માતા પિતા અને પોલીસને શું મદદ કરી અને શું પગલા લીધા તેની તપાસ ચાલી રહી છે.

દેશમાં સોલાર સંચાલિત ઈલેક્ટ્રિક ટોલનાકાઓનું નિર્માણ થશે : નીતિન ગડકરી

નવી દિલ્હી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી સમયમાં સોલાર સંચાલિત ઈલેક્ટ્રિક રસ્તાઓનું નિર્માણ કરશે. તેનાથી ટોલ ટેક્સ સહિતની સિસ્ટમ સમૂળગી બદલી જશે. વાહન ચાલકોને ટોલનાકાએ ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. તે ઉપરાંત ઈલેક્ટ્રિક નંબર પ્લેટ પણ વાહનોમાં લગાવાશે. નીતિન ગડકરીએ કહ્યું હતું કે દેશનું જાહેર પરિવહન સોલાર સંચાલિત ઈલેક્ટ્રિક સિસ્ટમથી સજ્જ થશે. તેનાથી માલવાહક વાહનો અને જાહેર પરિવહનની બસોનું ચાર્જિંગ સરળ બનશે. દેશમાં આવા ૨૬ હાઈવે બનાવાશે, જેનાથી રોજગારીની નવી તકો સર્જાશે.

ડાયાબિટીસ, HIV, ટીબીની દવા સસ્તી થશે: 384 દવાઓની યાદી બહાર પડાઈ

7 વર્ષ બાદ બહાર પડાઈ યાદી, 26 દવા યાદીમાંથી બહાર કરાઈ

નવી દિલ્હી

સ્વાસ્થ્ય મંત્રાલય સામાન્ય લોકોને વ્યાજબી અને સુલભ સ્વરૂપમાં આવશ્યક દવાઓ ઉપલબ્ધ કરાવવા પર સતત ભાર આપી રહ્યું છે. આરોગ્ય મંત્રાલયે હવે આવશ્યક દવાઓની નવી રાષ્ટ્રીય યાદી બહાર પાડી છે, જેમાં ૩૮૪ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ યાદી જાહેર કરવામાં આવી છે. મંગળવારે કેન્દ્ર સરકારે ૭ વર્ષ બાદ આવશ્યક દવાની

સુધારેલી યાદી જાહેર કરી હતી જેમાં ૩૪૪ દવાઓ ઉમેરો કરવામાં આવ્યો હતો અને સામે ૨૬ દવાઓને આ યાદીમાંથી પડતી મૂકવામાં આવી હતી. આ યાદી જાહેર થયા બાદ ડાયાબિટીસ, એચઆઈવી, ટીબી, કોન્ટ્રાસેપ્ટિવ, હોર્મોનલ, એન્ટિ-કેન્સર ઉપરાંત દરેક પ્રકારના ઉપચારમાં કામ લાગતી એન્ટિ બાયોટિક્સ દવાઓ સસ્તી થશે. સરકાર પેઈનકિલર, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરેપી પ્રોડક્ટ્સની કિંમતોમાં ઘટાડો કરે તેવું અનુમાન છે.

નવી પાર્ટીનું ગઠન કરી રહેલા ગુલામનબી આઝાદને આતંકી સંગઠન દ્વારા ધમકી મળી

શ્રીનગર

જમ્મુ-કાશ્મીરમાં નવી પાર્ટીનું ગઠન કરી રહેલા ગુલામ નબી આઝાદને આતંકવાદી સંગઠન દ્વારા ધમકી મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેના સંબંધિત પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ તેમાં આઝાદની હાલની રાજકીય ગતિવિધિઓને સુનિયોજિત બતાવવામાં આવી રહી છે. ત્યારબાદ તેમણે જમ્મુ-કાશ્મીરમાં રાજકીય રૂપે સક્રિય થવાની વાત કહી હતી. લશ્કર-એ-તૈયબ સાથે જોડાયેલા જૂથ રેઝિસ્ટન્સ ફ્રન્ટ ટેરરે આઝાદને ધમકી આપી છે. મહત્વની વાત એ છે કે, આઝાદ મિશન કાશ્મીરના ભાગરૂપે રેલીઓ કાઢવા જઈ રહ્યા છે.

યુઝરની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખનારા ગૂગલ-ફેસબુકને 7.2 કરોડ ડોલરનો દંડ ગ્રાહકોના ડેટાનો બેફામ ઉપયોગ કરી ટાર્ગેટ્સ એડ દ્વારા નાણાં રળવાનો કારસો

સિઓલ

દક્ષિણ કોરિયાના પ્રાઈવસી વોચડોગ પર્સનલ ઈન્ફોર્મેશન એન્ડ પ્રોટેક્શન કમિશન દ્વારા ગૂગલ અને ફેસબુકની પેરેન્ટ કંપની મેટાને ગ્રાહકોના ઓનલાઈન વર્તન પર તેમની મંજૂરી વિના નજર રાખવા બદલ અને તેમના ડેટાનો ઉપયોગ ટાર્ગેટ્સ એડવર્ટાઈઝ માટે ઉપયોગ કરવા બદલ ને કંપનીઓને કુલ ૧૦૦ અબજ વોન એટલે કે ૭.૨ કરોડ અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાના અંગત માહિતી રક્ષણ પંચે જણાવ્યું હતું કે કંપનીની બિઝનેસ કરવાની રીતોને કારણે પ્રાઈવસીનો ગંભીર ભંગ થતો હોવા બાબતે બેઠકમાં અધિકારીઓ વચ્ચે સંમતિ સધાવાને પગલે ગૂગલને ૬૯.૨ બિલિયન વોન એટલે કે ૫૦ બિલિયન અમેરિકન ડોલરનો અને મેટાને



૩૦.૮ બિલિયન વોન એટલે કે ૨૨ બિલિયન અમેરિકન ડોલરનો દંડ કરવામાં આવ્યો છે. દક્ષિણ કોરિયામાં પ્રાઈવસીના કાયદાના ભંગ બદલ કરવામાં આવેલો આ સૌથી મોટો દંડ છે.

ખાસ વિમાન દ્વારા લંડન પહોંચ્યું મહારાષ્ટ્રી એલિઝાબેથનું તાબૂત

મૃતદેહ ચાર દિવસ માટે વેસ્ટમિસ્ટર હોલમાં રાખવામાં આવશે

લંડન

બ્રિટનના મહારાષ્ટ્રી એલિઝાબેથ દ્વિતીયાના તાબૂતને સ્કોટલેન્ડના એડિનબરાથી લંડન લઈ જતા સમયે ટ્રાન્સપોર્ટ વિમાન પર આશરે ૬૦ લાખ લોકોની નજર હતી. ઈતિહાસમાં પ્રથમવાર જોવા મળ્યું છે કોઈ ફ્લાઈટ પર આટલા લાખ લોકોની નજર હતી. પાછલો રેકોર્ડ ૨૨ લાખ લોકો દ્વારા વિમાનને ટ્રેક કરવાનો હતો. વેબસાઈટ ફ્લાઈટરડારર૨૪ એ બુધવારે આ જાણકારી આપી છે. મહારાષ્ટ્રી એલિઝાબેથ દ્વિતીયાના તાબૂતને એડિનબરાથી લંડન લઈ જવા માટે બ્રિટિશ રોયલ એર ફોર્સ ટ્રાન્સપોર્ટ

વિમાન આરએએફ ગ્લોબમાસ્ટર સી-૧૭૦નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્રીના તાબૂતને મંગળવારે સાંજે એડિનબરાના સેન્ટ ગાઈલ્સ ચર્ચથી અહીં લાવવામાં આવ્યું હતું. અમેરિકી પ્રતિનિધિ સભાના અધ્યક્ષ નેન્સી પેલોસીને પાછલા મહિને તાઈવાન લઈ જતા અમેરિકી સૈન્ય વિમાનને ફ્લાઈટરડારર૨૪ પર ત્યારે ૨૨ લાખ લોકો જોઈ રહ્યાં હતા. વેબસાઈટ કહ્યું કે મંગળવારે એડિનબરાથી આરએએફ નોર્થોલ્ટ જઈ રહેલા બ્રિટિશ સૈન્ય વિમાનના ઉડાન ભરવાની પ્રથમ મિનિટ દરમિયાન આશરે ૬૦ લાખ લોકોએ તેને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારત ઉપર હવે આતંકી હુમલા કરો: ISની મુસ્લિમોને ઉશ્કેરણી

આઈએસના પ્રવક્તા મુઝાહિરે ૩૨ મિનિટનો ઓડિયો રીલિઝ કર્યો

કાબુલ

આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટના પ્રવક્તા અબુ-ઉમર-અલ મુઝાહિરે ૩૨ મિનિટનો ઓડિયો રીલિઝ કરીને ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ-મલેશિયા જેવા દેશોના મુસ્લિમોની ઉશ્કેરણી કરીને ભારત પર આતંકી હુમલા કરવા કહ્યું હતું. ધર્મને આગળ કરીને આ આતંકી સંગઠને મુસ્લિમ નાગરિકોને ઉશ્કેર્યા હતા. અનક્રિપ્ટેડ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉશ્કેરણીજનક મેસેજ પાઠવાયો હતો. એમાં ધર્માઠવા

ફેલાવવામાં આવી હતી. પોતાને આઈએસના પ્રવક્તા ગણાવતા અબુ-ઉમર અલ મુઝાહિરે ૩૨ મિનિટના ભાષણમાં ભારતના મુસ્લિમ નાગરિકોની ઉશ્કેરણી કરતા કહ્યું હતું: ૩૨ તમને ખાઈ ગયો છે એટલે તમારામાં ધર્મની રક્ષા કરવાની હિંમત જ બચી નથી. તમારામાં દુશ્મનો સામે લડવાની તાકાત પણ રહી નથી. અરબી ભાષાના આ ઓડિયો મેસેજમાં ભારતના મુસ્લિમોને સરકાર સામે તેમ જ ભારતના લોકો સામે લડવાની ઉશ્કેરણી કરવામાં આવી હતી.

અઝરબૈજાનનો ફરી હુમલો : આર્મેનિયાના 49 સૈનિકોના મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત

આર્મેનિયાના લશ્કરે મોટાપાયા પર ઉશ્કેરણી કરતા હુમલો કર્યાનો દાવો કરાયો

યેરેવન

અઝરબૈજાનના લશ્કરી દળોએ આર્મેનિયાના વિસ્તાર પર મોટાપાયા પર કરેલા હુમલામાં તેના કમસેકમ ૪૯ સૈનિકો મૃત્યુ પામ્યા છે અને આ આંકડો વધારે મોટો પણ હોઈ શકે છે આ ઉપરાંત અનેક લોકો ઘાયલ છે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. અઝરબૈજાન અને આર્મેનિયા વચ્ચે નાગોર્નો-કરાબખને લઈને દાયકા કરતાં વધારે સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ વિસ્તાર અઝરબૈજાનનો હિસ્સો



છે, પરંતુ ત્યાં રહતા આર્મેનિયનોને આર્મેનિયાનો ટેકો મળતા ત્યાં અલગતાવાદી યુદ્ધ ચાલ્યું હતું. આ યુદ્ધ ૧૯૯૪માં પૂરું થયું હતું. તેના પછી ૨૦૨૦માં છ સપ્તાહ સુધી ચાલેલા

યુદ્ધમાં અઝરબૈજાને નાગોર્નો કરાબખનો હિસ્સો પરત મેળવ્યો હતો. આ યુદ્ધમાં ૬,૬૦૦થી વધુના મોત થયા હતા અને રશિયાએ બંને વચ્ચે શાંતિ સ્થાપવામાં મધ્યસ્થીની ભૂમિકા અદા કરી હતી. આ ડીલના ભાગરૂપે મોસ્કોએ ત્યાં બે હજારના દળો પીસકીપર તરીકે ગોઠવ્યા છે. પરંતુ તે હજી કેટલો થયો તેની જાણ નથી. અઝરબૈજાનના દળોએ સોમવારે રાત્રો આર્મેનિયાના કેટલાય વિસ્તારો પર ડ્રોન હુમલા કરતા ફરીથી યુદ્ધની ભીતિ છેડાઈ હતી.

પાકિસ્તાનમાં પૂરનો પ્રકોપ: પાણીનો નિકાલ થતાં ૩થી ૬ મહિના નીકળી જવાની સંભાવના

ઈસ્લામાબાદ

પાકિસ્તાન હાલમાં પૂરની ખૂબ જ ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. ત્યાં પૂરના કારણે હાહાકાર મચી ગયો છે. ચારે બાજુ પાણી-પાણી દેખાઈ રહ્યું છે. લોકો ખાવા-પીવા માટે તરસી રહ્યા છે. WHOનું પણ કહેવું છે કે, પાકિસ્તાનમાં હેલ્થ સિસ્ટમ ધરાશાયી થઈ ચૂકી છે. આ દરમિયાન પાકિસ્તાન સરકારે જણાવ્યું કે, કઈ રીતે પાણી તાંડવ મચાવી રહ્યું છે અને એ પણ જણાવ્યું કે, શહેરોમાંથી પાણીનો નિકાલ કરવામાં ૬ મહિના લાગી શકે છે. બીજી તરફ આ પૂરમાં લગભગ ૩ કરોડ લોકો બેઘર થઈ ગયા છે.



પૂરના પાણીને રોકવા માટે સંઘર્ષ ચાલ્યું છે. સિંધ પ્રાંત પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત છે જ્યાં સૌથી વધુ લોકોના મોત થયા છે. દશભરમાં થયેલા 1396 મૃત્યુમાંથી માત્ર સિંધમાં જ 578 મૃત્યુ થયા હતા.

યુએસમાં ક્રિપ્ટોના સૌપ્રથમ ઈનસાઈડર ટ્રેડિંગના કેસમાં ભારતીય દોષિત

ન્યૂયોર્ક

અમેરિકામાં ક્રિપ્ટોકોરન્સીના સૌપ્રથમ ઈન્સાઈડર ટ્રેડિંગ કેસમાં ૨૬ વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઈન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને દસ લાખ ડોલરથી પણ વધુ રકમનો ગેરકાયદેસરનો નફો મેળવ્યો હતો. ભારતનો નાગરિક નિખિલ વાહી સીયેટલમાં રહે છે. તેના પર કોઈનબેઝડ એક્સ્ચેન્જમાં કઈ ક્રિપ્ટો એસેટ્સ નોંધાવવાની છે તેની ખાનગી માહિતીના ઉપયોગના આધારે ઈનસાઈડર ટ્રેડિંગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે. કોઈનબેઝ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સ્ચેન્જમાં એક છે. અમેરિકામાં ક્રિપ્ટોકોરન્સી માર્કેટ્સમાં પ્રથમ વખત જ આવો કેસ નોંધાયો છે.

મસ્કની માલિકી કંપની સહિત અન્ય 5 સામે ફરિયાદ ડોજેકોઇનનો પ્રચાર કરવો મસ્કને ભારે પડી ગયો, 26,000 કરોડ ડોલરનો દાવો

ન્યૂયોર્ક

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કને ક્રિપ્ટો ડોજકોઇનનું પ્રમોશન ખૂબ મોંઘુ પડી શકે છે. ડોજકોઇનની પિરામિડ સ્કીમને પ્રમોટ કરવા બદલ મસ્ક પર ૨૫.૮ હજાર કરોડ ડોલરનો દાવો માંડવામાં આવ્યો છે. મસ્ક સામેના આ દાવામાં હવે નવા રોકાણકારો પણ જોડાયા છે. આ કેસમાં મસ્કની ટનલ કન્સ્ટ્રક્શન કંપની ધ બોરિંગ કંપની સહિત અન્ય પાંચ લોકોને પણ આરોપી

બનાવવામાં આવ્યા છે. મસ્ક સમયાંતરે ડોજકોઇનના સમર્થનમાં ટ્વિટ કરતા જોવા મળ્યા છે અને મસ્ક દ્વારા આ ક્રિપ્ટોમાં રસ વધતા અન્ય નાના-મોટા રોકાણકારોનો ઘસારો પણ ડોજકોઇનમાં વધી રહ્યો હતો. ન્યૂઝ એજન્સી રોયટર્સના અહેવાલ અનુસાર દાવો માંડનારાઓની સંખ્યામાં વધારો થવાને કારણે મંગળવારે રાત્રે મેનહટન ફેડરલ કોર્ટમાં મસ્ક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ઉમેરો કરવામાં આવ્યો છે.

કતારમાં એક સ્કૂલ બસમાં મલયાલી પરિવારની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત

કતાર

કતારની રાજધાની દોહામાં એક સ્કૂલ બસમાં મલયાલી પરિવારની ચાર વર્ષની બાળકીનું શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. તે સમયે બાળકી સ્કૂલ બસમાં એકલી હતી. પ્રાથમિક તપાસ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે બસમાં વધુ પડતી ગરમીના કારણે યુવતીનું શ્વાસ રૂંધાવાથી મોત થયું છે. આ મામલાને ગંભીરતાથી લઈને કતાર સરકારે તપાસના આદેશ આપ્યા છે. મૃતકની ઓળખ ચાર વર્ષની મિન્સા મરિયમ જેકબ તરીકે થઈ છે, જે સ્પ્રિંગફીલ્ડ સ્કૂલમાં LKG-1ની વિદ્યાર્થીની હતી. મરિયમના પિતા અભિલાષ યાકો અને સૌમ્યા કેરળના કોટ્ટાયમના ચિંગાવનમના વતની છે.



ગુજરાતમાં સેમીકન્ડક્ટરનું ઉત્પાદન કરવા વેદાન્તા અને ફોકસકોન ડોલરનું રોકાણ કરશે

અમદાવાદ

દેશમાં કોલસો, કુડ ઓઈલ, કોપર, ઝીંક, એલ્યુમીનીયમ જેવા ક્ષેત્રે સૌથી અગ્રણી જૂથ વેદાન્તાએ તેના ૨૦ અબજ ડોલરના સેમીકન્ડક્ટર પ્લાન્ટ માટે ગુજરાત ઉપર પસંદગી કરી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સત્તાવાર જાહેરાત મંગળવારે કંપનીના ચેરમેન અનિલ અગ્રવાલ દ્વારા કરવામાં આવે એવી શક્યતા છે. આ ૨૦ અબજ ડોલરના કુલ પ્રોજેક્ટમાં વેદાન્તા તરફથી લગભગ ૮.૪ અબજ ડોલરનું રોકાણ થશે અને બાકીના વિશ્વની અગ્રણી કંપની ફોકસકોન દ્વારા કરવામાં આવશે એવું



સુત્રોએ જણાવ્યું હતું. ભારત સરકારે આત્મનિર્ભરતા માટે અને કોરોના કાળ પછી વિશ્વમાં વધી રહેલી સેમીકન્ડક્ટરની અછત સમયે ભારતમાં સ્થાનિક ઉત્પાદન શરુ થાય તેના માટે પ્રયાસ હાથ ધર્યા છે. ભારતમાં સેમીકન્ડક્ટર અને તેની વેફર માટે ૨૦૦૯થી પ્રયાસ ચાલી

રહ્યા હતા. સરકારના અનેક પ્રયત્ન અને રોકાણ પ્રોત્સાહન પછી પણ જોકે આ દિશામાં કોઈ સફળતા મળી નથી. લંડન સ્ટોક એક્સચેન્જ ઉપર પોતાની કંપનીના લીસ્ટિંગમાં સફળ રહેલા પ્રથમ ભારતીય અનિલ અગ્રવાલ અને તાઈવાનની અગ્રણી સેમીકન્ડક્ટર કંપની ફોકસકોમના સંયુક્ત સાહસના સ્વરૂપે આ કંપની ગુજરાતમાં આ ઉત્પાદન હાથ ધરવામાં આવશે એવી શક્યતા છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાના સહીતના રાજ્યો સાથે વાટાઘાટ કર્યા પછી વેદાન્તાએ ગુજરાત ઉપર પસંદગી ઉતારી હોવાનું જાણવા મળ્યું છે.

માતા-પુત્રીના શંકાસ્પદ મોતથી હોબાળો ધાનેરામાં દફનાવી દેવાયેલા મૃતદેહ બહાર ફાટી પીએમ માટે મોકલાયા

બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં થોડા દિવસ અગાઉ માતા-પુત્રીના મોતની ઘટના સામે આવી હતી. બંનેના મૃતદેહોની દફનવિધિ કરાયા બાદ પિયર પક્ષને સમગ્ર મામલે શંકા જતા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના પગલે માતા-પુત્રી બંનેના દફન કરાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. ધાનેરાના જોરાપુરા ગામે માતા-પુત્રીના પાણીની ટાંકીમાં પડી જવાથી મોત નીપજ્યાં હતા. પરિવારે વિધિ વિધાનથી બંનેની દફન વિધિ કરી હતી.

જોકે, આ મામલે પિયર પક્ષને શંકા જતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી. આજે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં બંને (માતા-પુત્રી)ના દફન કરાયેલા મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. હાલ પોલીસ દ્વારા માતા-પુત્રીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલે ખુલાસો થશે એવું કહેવામાં આવી રહ્યું છે.

આખરે ગુજરાતના લીસ્ટેડ બુટલેગર વીજુ સિંધી વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ

અમદાવાદ

બુટલેગર વિજય સિંધી સ્ટેટ મોનીટરીંગથી બચવા માટે દુબઈમાં છુપાયો ગયો હતો. જે બાતમીને આધારે મોનીટરીંગ સેલના અધિકારીઓએ વિજય સિંધી વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરવાની કાર્યવાહી કરી હતી. જેને ઈન્ટરપોલે મંજૂરી આપીને રેડ કોર્નર નોટીસ ઈસ્યુ કરતા હવે વીજુ સિંધીને ઝડપી લેવાની શક્યતા પ્રબળ બની છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજરાતના લીસ્ટેડ બુટલેગરોની યાદી તૈયાર કરીને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરીને વિદેશી દારૂના નેટવર્કને તોડવા માટે કામગીરી કરવામાં આવી હતી. જે અનુસંધાને કુખ્યાત બુટલેગર નાગદાન ગઢવીની ધરપકડ બાદ ગુજરાતના સૌથી મોટા બુટલેગર વિજય ઉર્ફે વીજુ મુરલીધર સિંધી (રહે. વડોદરા)ની ચોંકાવનારી વિગતો ખુલી હતી.

અમદાવાદમાં વિદેશ જવા માટે વિઝા બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો

બે કમ્પ્યુટર, પ્રિન્ટર, 4 મોબાઈલ, પાંચ લાખની રોકડ જમ

અમદાવાદ

દિલ્હી દરવાજા ખાતેના બી.જી.ટાવરમાં આવેલી કોષ્ટી એસોસિએટ્સમાં એસઓજીની ટીમે રેડ કરીને વિદેશના વિઝા મેળવવા માટે ફેક ડોક્યુમેન્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કરી પિતા-બે પુત્રની ત્રિપુટી સહિત પાંચ આરોપીની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે સોમવારે મોડી રાત્રે કોષ્ટી એસોસિએટ્સની ત્રણ ઓફિસમાં રેડ કરીને બે કમ્પ્યુટર, પ્રિન્ટર, ચાર મોબાઈલ અને પાંચ લાખની રોકડ રકમ મળીને કુલ રૂ. ૮,૧૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસને ઓફિસમાંથી જૂદી જૂદી સરકારી કચેરીઓના સ્ટેમ્પ, પાસપોર્ટ,

જૂદી જૂદી વ્યક્તિના બેંક સ્ટેટમેન્ટની પ્રિન્ટ અને કોરા પેજની કોપીઓ પણ મળી આવી હતી. એસઓજીએ કોષ્ટી એસોસિએટ્સના માલિક સુર્યપ્રકાશ હરીલાલ કોષ્ટી (ઉ,૫૨), તેના બે પુત્ર અભિષેખ (ઉ,૨૬) અને નિશીત (ઉ,૨૨) ત્રણે રહે, સન રિયલ હોમ્સ, સાવન બંગલો પાસે, ન્યુ રાણીપ, ઉદયપ્રકાશ ચેલુવેયા પૂજારી (ઉ,૪૨) રહે, પરમસુખ સોસાયટી, રાણીપ અને જયેશ નટવરલાલ કાષ્ટી (ઉ,૨૮) રહે, ઓતમંબા સોસાયટી, બાપુનગર વિરૂદ્ધ ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કલમો હેઠળ ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.

ગુજરાતના 120 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો

સાબરકાંઠા


ગુરૂવારે રાજ્યના આશરે ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં ભુજ અને બારડોલીમાં સવા ૪ ઈંચ તેમજ વેરાવળ અને વાસંદામાં ૩-૩ ઈંચ, જ્યારે વાપીમાં પોણા ૩ ઈંચ અને કોડીનાર, પલસાણામાં, ધરમપુરમાં સવા ૨ ઈંચ વરસાદ પડ્યો છે. તો ઉપલેટા, લિલિયા અને નાંદોદ સહીતના અનેક વિસ્તારોને આજે મેઘરાજાએ ધમરોળ્યા છે. બીજી તરફ આજે દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ ત્રાટક્યો હતો. જેને લઈને ભાટીયાના નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા હતા. આથી ઘરવખરી અને અનાજ સહીતનો જથ્થો પલડી ગયો હતો. વધુમાં મુક્તેશ્વર મહાદેવ મંદિરનું વિશાળ તળાવ છલોછલ ભરાયું હતું. તો દ્વારકામાં ભારે વરસાદથી ખેડુતો ચિંતામાં છે. વલસાડ જિલ્લામાં અવિરત વરસાદથી જંગલ વિસ્તારમાં નદી-નાળા ફરી જીવંત થયા હતા.

સમૃદ્ધિને ટકાવવા સંપત્તિનો દુર્વ્યય અટકાવો

જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ તે ટીપે ટીપે ખાલી પણ થાય. તેથી તેને ભરેલું રાખવા એક ટીપુંયે ન વેડફાય તેનો ખ્યાલ રાખવો જરૂરી. આ જ રીતે ઘરમાં સમૃદ્ધિનું સરોવર છલકતું રાખવા ઘરની સંપત્તિનો દુર્વ્યય અટકાવવો આવશ્યક. આવી કરકસર કમાણી બરાબર જ કહેવાય. અંગ્રેજીમાં કહેવાયું છે કે, **A penny saved is a penny earned.** વસ્તુ અને સંપત્તિનો બેફામ ઉપયોગ દરિદ્રતાનો દરવાજો ખોલી આપનારી બાબત છે. તે જીવનમાં પ્રવેશે તો કુબેરને પણ કંગાલ થતાં વાર ન લાગે. તેથી જ શાણા માણસો આ અંગે ઘણા સતર્ક જોવા મળે છે. બીજા વિશ્વયુદ્ધ વખતે ભારતનું મોટાભાગનું લોખંડ શસ્ત્રોના નિર્માણ પાછળ વપરાઈ ગયેલું. તેથી તેની તંગી ઊભી થતાં ઓફિસોમાં વપરાતી ટાંકણીઓનીયે અછત વર્તાવા લાગી. તે કારણે તેના ભાવ ઉછળ્યા, તો મોંઘા ભાવે મળતી ટાંકણીઓ પણ હલકી કક્ષાની કટાઈ જાય તેવી મળે. આ હાલાકી સૌ લાચાર બની સહન કરી રહ્યા હતા. આવા સમયે ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તેઓની કચેરીમાં જોયું તો કાગળ સાથે ટાંકણીઓ પણ કચરાપેટીમાં જતી હતી. તેથી તેઓએ બીજે દિવસે દેવીપૂજકોના મુખીને બોલાવી કહ્યું : તમે દાતણ કાપી શૂળો ફેંકી દો છો તે ફેંકવાની નહીં. સારી, મજબૂત અને કાગળમાં ભરાવવામાં કામ આવે તેવી શૂળોના બંડલ બનાવી રોજ સાંજે અહીં પહોંચાડવી.

આ પ્રમાણે શૂળો હાજર થવા માંડતાં સૌ ટાંકણીના સ્થાને તેનો ઉપયોગ કરવા લાગ્યા. બે વર્ષ પછી રાજાએ દીવાન પાસે આંકડો કઢાવ્યો તો આ પગલાંને કારણે રાજ્યની તિજોરીમાં ૧,૨૦,૦૦૦ રૂપિયા જમા થઈ ચૂકેલા ! નાની-શી કરકસરનો કેટલો મોટો ફાયદો ! તેથી જ ગુજરાતીમાં કહેવત પડી હશે ને કે, ત્રેવડ ત્રીજો ભાઈ.

૧૯૭૭ના જુલાઈ મહિનાની પચીસમી તારીખે ઈંગ્લેન્ડના નીટન નગરમાં પધારેલા પ્રમુખસ્વામી મહારાજ અહીં એક સત્સંગીના ઘેર ભોજનથી પરવાર્યા. તે વખતે અન્ય સહયાત્રીઓ જમવા બેઠા ત્યારે સ્વામીજી એક સોફા પર બેસી એકત્રિત સમુદાયને જ્ઞાનવાર્તા સંભળાવવા લાગ્યા. થોડી વારમાં સહપ્રવાસીઓનું ભોજન પૂરું થતાં આગળના કાર્યક્રમમાં જોડાવા માટે પ્રમુખસ્વામી મહારાજ ઊભા થયા. તે વખતે તેઓને



જેમ જેમ ઊંચી પદવી મળતી જાય તેમ તેમ પણ કરકસરની ભાવના ઘસાતી જાય. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ આવી આડઅસરોથી અસ્પૃશ્ય રહ્યા

અપાયેલી દાંત ખોતરવાની સળી સરતચૂકથી નીચે પડી. તે જોઈ સામે બેઠેલા એક સંતે નવી સળી સ્વામીજી સમક્ષ ધરી, ત્યારે પ્રમુખસ્વામી મહારાજ તે સળી હાથમાં ન લેતાં જૂની સળી શોધાવી તેને જ ઉપયોગમાં લીધી.

સામાન્ય રીતે એવું જોવા મળે છે કે, જેમ જેમ જાહોજલાલી વધે તેમ તેમ કરકસરની વૃત્તિ ઘટતી જાય. વળી, જેમ જેમ ઊંચી

પદવી મળતી જાય તેમ તેમ પણ કરકસરની ભાવના ઘસાતી જાય. પરંતુ પ્રમુખસ્વામી મહારાજ આવી આડઅસરોથી સર્વથા અસ્પૃશ્ય રહેલા.

તેઓ કાગળનો ટુકડો પણ જરૂરિયાતથી વધુ ન વાપરે. તેઓ પર રોજના પચાસ-સાઠની સરેરાશથી પત્રો આવતા. તે દરેકના જવાબ સ્વામીજી રોજરોજ પાઠવે. પરંતુ આ ટપાલોમાં જો અડધા પાનાંનું જ લખાણ લખાયું હોય, તો બાકીનો કોરો અડધો ભાગ તેઓ પત્ર-પરિચારક પાસે ફડાવી તેનો યોગ્ય ઉપયોગ કરે.

પ્રમુખસ્વામી મહારાજ પોતાના દૈનિક વપરાશની વસ્તુઓમાં સાધારણનું ધોરણ જાળવી રાખતા. પરંતુ આ સાધારણ ચીજોને પણ તેઓ પૂરેપૂરો કસ કાઢી વાપરે.

તા.૨/૧૨/૧૯૭૪ના રોજ પ્રમુખસ્વામી મહારાજને બુલવાયોથી જોડાનિસબર્ગ જવાનું હતું. તે માટે બપોરના એક વાગ્યે અંરપોર્ટ પર પહોંચી જવું જરૂરી હતું. છતાં સ્વામીજી બાર વાગ્યે તેઓના ઉતારે બાલુભાઈ નામની એક વ્યક્તિની રાહ જોઈ બેઠેલા. એક સ્થાનિક સંસ્થા આશ્રમના આ વ્યવસ્થાપકને તેઓએ પોતાના જોડા સંધાવી લાવવાનું કામ સોંપેલું.

પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આ કામ સોંપાયું ત્યારે આ મુરબ્બીને ઘણું જ આશ્ચર્ય થયેલું. તેઓ વિચારી રહેલા કે, હજારો વીધાની જમીનના માલિકો જેઓના શિષ્ય છે, મોટા ઔદ્યોગિક ગૃહો ચલાવનારા જેઓના આશ્રિત છે, જેઓ સ્વયં એક વિશ્વવ્યાપી સંસ્થાના અધ્યક્ષ છે, એવા આ પ્રમુખસ્વામી મહારાજ જૂના જોડા સંધાવવાની પળોજણ મૂકીને નવા જોડા શા માટે લેતા હોય ?!

આ વિચાર સાથે નીકળેલા મુરબ્બીને જોડા લઈને આવતા બપોર થઈ ગઈ હતી. જે પછી પેલા સંધાયેલા જોડા પહેરી સ્વામીજીએ વિદાય લીધી.

તેઓએ તા.૨૪/૪/૧૯૮૭ના રોજ કહેલું કે, પરિસ્થિતિ અનુસાર આપણે સંકોચ રાખવો પડે એમાં કંજૂસાઈ નહીં, પણ કરકસર કરવાની વાત છે. ટીપે-ટીપે સરોવર ભરાય. પંખા-લાઈટો વગેરેનો પણ ગણતરીપૂર્વક ઉપયોગ કરીએ તો બાર મહિને વીસ-પચીસ હજાર રૂપિયા બચે. આમ, કરકસર એ કમાણીનું જ એક નવું સાધન છે. આજના મોંઘવારીના જમાનામાં તે અપનાવવા જેવું તો ખરું જ.

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક ગ્રુપ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અહેવાલ મુજબ સ્માર્ટ કોન્ટ્રાક્ટની ચકાસણી કરતી વખતે Ethereum બ્લોકચેન પર 47 થી વધુ ઝીરો-ડે નબળાઈ જોવા મળી છે. સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સ એ બ્લોકચેન પર સંગ્રહિત પ્રોગ્રામ્સ છે. જે કરારની એન્કોડ કરેલી શરતોના આધારે પૂર્વનિર્ધારિત શરતો પૂરી થાય ત્યારે આપમેળે એક્ઝિક્યુટ થાય છે. તે કેન્દ્રીય સત્તાની જરૂરિયાત વિના અનામી પક્ષો વચ્ચે વિશ્વસનીય વ્યવહારો અને કરારો કરવાની મંજૂરી આપે છે.


વધુમાં કહીએ તો, આ કોડ પોતે રજૂ કરે છે કે તે સોદો અંતિમ મધ્યસ્થથી બનાવ્યો છે. પ્રોગ્રામ અમલીકરણના તમામ પાસાઓને નિયંત્રિત કરે છે. આ પ્રોગ્રામને ટ્રેક કરી શકાય છે. જેથી ઓડિટ પ્રક્રિયા સરળતાથી થઈ શકે. જો કોડમાં નબળાઈ રહેલી હોય તો ભારે નુકશાન પણ થઈ શકે છે.

હાલમાં જ DAO અને MonoX બંને વિરોધીઓએ ગેરકાયદેસર રીતે ભંડોળને બહાર કાઢવા માટે છટકબારીનો ઉપયોગ કર્યો હતો તેની પરથી સ્પષ્ટ થાય છે કે, સ્માર્ટ કોન્ટ્રાક્ટના વધતા જતા ઉપયોગના કારણે વિનાશ પણ થઈ શકે છે.

સંશોધકો જણાવે છે સ્માર્ટ કોન્ટ્રાક્ટ સરળતાથી અપગ્રેડ કરી શકાય તેવા ન હોવાથી કોન્ટ્રાક્ટના

સેઇલફિશ સિસ્ટમ

સોર્સ પ્રી-ડિપ્લોયમેન્ટનું ઓડિટ કરવું અને બગ-ફી કોન્ટ્રાક્ટનો ઉપયોગ પરંપરાગત સોફ્ટવેર પર કરવું વધુ મહત્વપૂર્ણ છે. સેઇલફિશનો ઉદ્દેશ્ય સ્માર્ટ કોન્ટ્રાક્ટ્સમાં કામ વિસંગતતાની નબળાઈઓને પકડવાનો છે. જે એટેકરને



વ્યવહારોના એક્ઝિક્યુશન ઓર્ડર સાથે છેડછાડ કરવા અથવા એક જ વ્યવહારની અંદર ફરી પ્રવેશીને નિયંત્રણ પ્રવાહને કબજે કરવાની મંજૂરી

આપે છે.

સ્માર્ટ કોન્ટ્રાક્ટ સેઇલફિશ કોન્ટ્રાક્ટને ડિપેન્ડન્સી ગ્રાફમાં રૂપાંતરિત કરે છે. જે સ્ટોરેજ વેરિયેબલ્સ અને સ્માર્ટ કોન્ટ્રાક્ટની અવસ્થા બદલતી સૂચનાઓ વચ્ચેના નિયંત્રણ અને ડેટા ફ્લો સંબંધોને કેપ્ચર કરે છે. તેનો ઉપયોગ કરી મેલીસીયસ એક્સેસ પ્રાપ્ત કરીને સંભવિત ખામીઓ ઓળખે છે અને અમલમાં મુકે છે. બે અલગ-અલગ એક્ઝિક્યુશન પાથ ઓછામાં ઓછા એક રાઈટ ઓપરેશન હોવાને કારણે સમાન સ્ટોરેજ વેરીએબલ પર કાર્ય કરે છે. જે નિર્ધારિત ગ્રાફ ક્વેરીઝ કરે છે.

સંશોધકોએ ઈથરસ્કેનમાંથી મેળવેલા 89,853 કોન્ટ્રાક્ટ પર સેઇલફિશનું મૂલ્યાંકન કર્યું હતું. જેમાં 47 ઝીરો-ડેની ખામીઓ ઓળખી કાઢવામાં આવી હતી. જે ઈથરને દૂર કરવા અને એપ્લિકેશનના વિશિષ્ટ મેટાડેટાને મેલીસીયસ કરી હાની પહોંચાડવામાં માટે લાભમાં લઈ શકાય છે. આમાં હાઉસિંગ ટ્રેકરનો અમલ કરતા નબળા કોન્ટ્રાક્ટનો પણ સમાવેશ થાય છે. જેનો દુરુપયોગ એવી રીતે

થઈ શકે છે કે ઘરના માલિક પાસે એક કરતાં વધુ સક્રિય સૂચિ હોઈ શકે છે.

સપ્ટેમ્બર 2020 માં, ચાઈનીઝ સંશોધકોએ દરેક ભૂલો માટે શોધ માપદંડ પ્રદાન કરવાના ધ્યેય સાથે સ્માર્ટ કોન્ટ્રાક્ટમાં જાણીતી નબળાઈઓને વર્ગીકૃત કરવા માટે એક માળખું ડિઝાઇન કર્યું હતું.

beinghumanmj

શીર્ષક : સ્ત્રીની કવિતા
કવયિત્રી : હિના મોદી

એક સ્ત્રીને મન,
કવિતા એટલે-
કપડાં ઘોટી વેળા ખળખળ વહેતા પાણીમાં
ઝરણાનો નિનાદ...
રસોઈ કરતી વેળા ફૂકરની સીટીમાં
શ્રીકૃષ્ણનાં બંસરીનાં સૂર...
ઘરની સારસંભાળમાં
ઈશ્વરની ભક્તિનો અનુનાદ...
પતિદેવની આજ્ઞામાં
સંપૂર્ણ ભાગવદગીતાનો સાર ...
પુરુષને મન,
'સ્ત્રીની કવિતા' એટલે-
પસ્તીનાં કાગળનો એક ફૂલો !

ખોટા થયેલા લિપસ્ટિકના શેડનો કરો સ્માર્ટ ઉપયોગ

ઘણી વખત મેકઅપ પ્રોડક્ટ્સ ખરીદ્યા પછી આપણે જ્યારે તેને ચહેરા ઉપર અપ્લાય કરીએ છીએ ત્યારે એ આપણી સ્કિન ટોનને મેચ કરતી નથી. એમાંય ખાસ કરીને લિપસ્ટિકનો શેડ્સ ખરીદતી વખતે આવી ભૂલ થઈ જતી હોય છે. લિપસ્ટિકનો ખોટો શેડ પસંદ થઈ ગયા બાદ તેનો ઉપયોગ કરવાનું ટાળીએ છીએ અને પછી તે આપણાં મેકઅપ બોક્સમાં એક ખૂણામાં પડી રહે છે. આવું ન થાય એટલે તમે એને ડિફરન્ટ રીતે યૂઝ કરી શકો છો. તો આજે લિપસ્ટિકના ખોટા શેડનો સ્માર્ટ ઉપયોગ કઈ રીતે કરી શકાય એ અંગે આપણે જાણીએ.



લિપસ્ટિક શેડ વધારે ડાર્ક છે

તમે લિપસ્ટિકનો જે શેડ ખરીદ્યો છે એ વધારે પડતો ડાર્ક છે અને તમારા ચહેરા પર બિલકુલ શૂટ નથી કરતો તો એને તમે લાઇટ ઇફેક્ટ આપી શકો છો. ડાર્ક કલરની લિપસ્ટિકને લાઇટ કરવા માટે તમે પિંક અને પીચ શેડ્સનો ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ડાર્ક કલરની લિપસ્ટિક લગાવ્યા બાદ એના ઉપર પિંક કે પીચ શેડ્સની લિપસ્ટિક લગાવવાથી લિપસ્ટિકનો શેડ બદલાઈ જાય છે અને તે પહેલાં કરતાં વધારે સારી લાગે છે. આ ઉપરાંત તમે ડાર્ક લિપસ્ટિકને કન્સીલરની સાથે બ્લેન્ડ કરીને પણ લગાવી શકો છો.

લિપસ્ટિકનો શેડ વધારે લાઇટ છે

લિપસ્ટિકનો શેડ વધારે પડતો લાઇટ આવી ગયો છે. જે તમારા ચહેરા પર દેખાતો નથી, તો લાઇટ શેડને ડાર્ક ઇફેક્ટ આપી અપ્લાય કરી શકો છો. લાઇટ કલરની લિપસ્ટિક લગાવતાં પહેલાં અથવા પછી લિપ લાઇનરનો ઉપયોગ કરીને તમે નવો શેડ ક્રિએટ કરી શકો છો. આ સિવાય તમે ડાર્ક શેડની લિપસ્ટિક પણ મિક્સ કરી બ્રશ દ્વારા લિપ્સ ઉપર અપ્લાય કરી શકો છો.

લિપસ્ટિક બહુ ગ્લોસી છે

ક્યારેક ક્યારેક અમુક લિપસ્ટિક વધારે ગ્લોસી મળી જાય છે. તેથી તેને લગાવવાની બિલકુલ ઇચ્છા થતી નથી. તમે તમારી ગ્લોસી લિપસ્ટિકને મેટ લુક આપવા એની ઉપર લિપ લાઇનર અપ્લાય કરો. આમ કરવાથી મેટ લુક ક્રિએટ કરી શકાય છે. આ રીતે લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી પણ રહે છે.

લિપસ્ટિક ડ્રાય હોય

અત્યારે મેટ લિપસ્ટિક ઘન ટ્રેન્ડ છે. જ્યારે આપણે મેટ લિપસ્ટિક ખરીદીએ છીએ ત્યારે તે કેટલી મેટ હશે એનો આપણને અંદાજ હોતો નથી. ઘણી બધી મેટ લિપસ્ટિક વધારે પડતી ડ્રાય હોય છે. જો આવી જ કોઈ લિપસ્ટિક તમારી પાસે પણ છે તો એને લગાવ્યા બાદ એક લેયર લિપ ગ્લોસનું લગાવી દો. તમારી પાસે લિપ ગ્લોસ ન હોય તો બ્રશથી પેટ્રોલિયમ જેલી લગાવી દો. એનાથી તમારા હોઠ શોફટ અને શાદની લાગશે.

દરેક વ્યક્તિને પોતાની જાતને ફિટ અને સ્લિમ રાખવા માટે જિમમાં જવાનો સમય મળતો નથી. ઘણી વખત ટ્રેસની પસંદગી યોગ્ય રીતે ન કરવામાં આવે તો પણ હેવી બોડી લાગે છે. જો કપડાંની પસંદગી યોગ્ય રીતે કરવામાં આવે તો તમે ફિટ લાગશો. ડ્રેસિંગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, જેથી સ્લિમ લુક મેળવી શકાય એ અંગે વાત કરીએ.

એકદમ સ્લિમ અને ટ્રિમ દેખાવા દ્રાય કરો સ્ટાઈલિંગ ટ્રિક્સ

- **કપડાંનું ફીટિંગ :** કપડાંની પસંદગી કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એ વધારે ઢીલાં ન હોય અને વધારે ટાઈટ પણ ન હોય. તમે જે પણ ટ્રેસ પહેરો તેનું ફીટિંગ પરફેક્ટ હોવું જોઈએ. એનાથી તમે સ્લિમ દેખાશો.
- **ડાર્ક રંગ :** લાઈટ રંગ કરતાં ડાર્ક રંગના આઉટફિટમાં સ્લિમ લુક મળે છે. એનાથી બોડી શેપ યોગ્ય લાગે છે. તમે બ્લેક, ગ્રે, બ્રાઉન મરુન વગેરે રંગનાં કપડાંની પસંદગી કરો.
- **કોન્ટ્રાસ્ટ કપડાં :** પેટનો પોર્શન અને લોઅર પાર્ટ વધારે હોય તો તેને છુપાવવા મલ્ટિ કલરનાં કપડાં ક્યારેય ન પહેરો. મલ્ટિ કલરથી ફેટ હોય એના કરતાં વધારે દેખાય છે અને ઓવર પણ લાગે છે. એક જ રંગનાં કપડાં પહેરીને તમે પાતળા દેખાઈ શકો છો. તેથી તમે એક જ રંગનું ટોપ અને બોટમ ટ્રેસ કેરી કરો.
- **મોટી પ્રિન્ટ :** તમે મોટી પ્રિન્ટવાળા કપડાં પહેરશો તો એમાં તમે વધારે પહોળા અને વિશાળ દેખાશો તેથી નાની પ્રિન્ટ પહેરવાનું પસંદ કરો. તમારો અપર પાર્ટ ઓછો અને લોઅર પાર્ટ વધારે હોય તો જિન્સ ઉપરનું ટોપ મોટી પ્રિન્ટવાળું પહેરી શકો પરંતુ લોઅરમાં પ્લેન પહેરો.
- **હાઈટ અનુસાર ડ્રેસઅપ :** તમારી હાઈટ વધારે હોય તો ઘૂંટણથી નીચે સુધીના ટ્રેસ પહેરો, પરંતુ તમારું વજન વધારે હોય તો વધારે લાંબા ટ્રેસ પહેરવાનું ટાળો. ઓછી હાઈટવાળી યુવતીઓએ કુલ લેન્થ લેયર્ડ ટ્રેસ કેરી કરવાનું ટાળવું જોઈએ.
- **સ્ટ્રાઈપ ડ્રેસ :** સ્ટ્રાઈપ પેટર્નને તમે સ્લિમ લુક માટે ટ્રાય કરી શકો છો. ઓફિસ માટે સ્ટ્રાઈપ પેટર્ન દરેક રીતે બેસ્ટ છે. સૌથી સારી વાત એ છે કે તે ફેશનમાં હંમેશાં

- ઈન રહે છે. ડ્રેસીસથી લઈને શર્ટ, પેન્ટ, ટોપ દરેકમાં તમે પહેરી શકો છો. એમાં ફિગર પરફેક્ટ લાગે છે. ક્યારેય કોસ ચેક કે હોરિજન્ટલ લાઈનવાળા ટ્રેસ ન પહેરો. આવા ટ્રેસમાં તમે વધારે જાડા દેખાશો.
- **વી નેક ડ્રેસ :** સ્લિમ દેખાવા ઇચ્છો છો તો એવા ટ્રેસની પસંદગી કરો જેમાં નેક વી શેપનું હોય. એવા આઉટફિટ તમારા લુકને એટ્રેક્ટિવ અને સ્લિમ દેખાવામાં તમને મદદ કરશે.
- **હાઈ વેસ્ટ :** હાઈ વેસ્ટ આઉટફિટ્સનો ઓપ્શન સેફ એન્ડ બેસ્ટ છે. જેમાં તમે બિન્ધાસ્ત રીતે કેરી કરી શકો છો. આજકાલ હાઈ વેસ્ટ ટ્રેન્ડમાં પણ છે. એમાં તમે જિન્સ, પેન્ટ્સ, સ્કર્ટ ટ્રાય કરી શકો છો. એમાં તમે સ્લિમની સાથે સ્ટાઈલિશ દેખાશો.



અપનાવી જુઓ આ ઘરેલું હેલ્થ ટીપ્સ

- તલના તેલના માલિશથી સાંધાનો દુખાવામાં રાહત થાય છે
- મોઢામાં કાચમી ચીકાશ રહેતી હોય તો દરરોજ સવારે ગરમ પાણીમાં એક લીંબું નીચોવી ચપટી ખાવોનો સોડા ભેળવી પીવાથી, મળનો સડો અને ગેસ દૂર થાય છે.
- ઝખમ ચીરાવાથી થતા રક્તસ્ત્રાવમાં ઘા ઉપર હળદરની ભીકી દબાવી દેવાથી લોહીનો સ્ત્રાવ બંધ થઈ જાય છે. હળદર જંતુનાશક હોવાથી ઘા ઝાઝાય છે, પાકતો નથી
- ગાયનું ઘી માથમાં ચોળી એક કલાક બાદ વાળ ધોવાથી મુલાયમ, ચમકદાર અને કાળા થાય છે.
- રાતના બે ચમચા મધને પાણીમાં એક પ્યાલામાં ભેળવી હલાવીને પીવાથી શાંત અને ગાદ નિંદ્રા આવે છે.
- વાયુ કે કફ (આમ) દોષથી અંગ જકડાઈ ગયા હોય તો રાયની પોટીસ લગાડવી.
- દાંતમાં રસી કે અન્ય કારણે મોમાંથી દુર્ગંધ આવતી હોય તો મીઠાના પાણીમાં 3 વાર કોગળા કરવા.
- ખસખસ વાટીને દર્દી સાથે ભેળવી ખાવાથી ઝાડામાં રાહત થાય છે.
- ઠંડીની ઋતુમાં સાંધાના વાંકે આમ વાતને કારણે હાથ-પગના આંગળા જકડાઈ જાય કે સૂકી જાય તો સરસવલના તેલને ગરમ કરી માલિશ કરવું.
- સનર્ભનથી રાહત પામવા મુલતાની માટી, ચણાનો લોટ અને ગુલાબજળની પેસ્ટ બનાવી ચહેરા પર માસ્કની માફક લગાડી સુકાઈ જાય બાદ ઘોઈ નાખવું.
- જવના લોટને નાસ્તિયેળના તાજા દૂધમાં ભેળવી 30 મિનીટ રેફ્રિજરેટરમાં મૂકી ચહેરા અને ગરદન પર પેક લગાડી સુકાઈ જાય બાદ ઘોઈ નાખવું. ત્વચા ચમકીલી થાય છે.

કેનેડામાં 6 મહિનામાં 3 લાખ નવા ઈમિગ્રન્ટસનો પ્રવેશ

જુલાઈથી સિક્કથ ઓલ પ્રોગ્રામ એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રો અટકાવી દેવાયા : 2022ના અંત સુધીમાં એક વર્ષમાં 405, 330 ઈમિગ્રન્ટસનો વિક્રમ થઈ જશે

ઓન્ટેરિયો

સપ્ટેમ્બરની 14મી તારીખે ઈમિગ્રેશન રેફ્યુજિસ એન્ડ સિટીઝનશીપ કેનેડા (આઈઆરસીસી)એ 2૨૫૦ નવા એક્સપ્રેસ એન્ટ્રી ડ્રો માટે અરજી કરવા નિમંત્રણ આપ્યું હતું. જે જુલાઈની છટ્ટી પછીનું છટ્ટુ ઓલ પ્રોગ્રામ ડ્રોનો ભાગ હતો.

એને માટેની લઘુત્તમ ક્રમાંકન પધ્ધતિ (સીઆરએસ)માં પણ ઘટાડો કરાયો હોઈ, એ ૫૧૧નો રહ્યો છે. ડ્રો માટે કોઈ ચોક્કસ પ્રોગ્રામની જાહેરાત થઈ નથી. એટલે કે, ઉમેદવારે કેનેડીયન એકિસપીરીયન્સ કલાસમાંથી જ અરજી કરવી પડે. બીજો પ્રોગ્રામ ફેડરલ સ્કલ્ડ વર્કર પ્રોગ્રામ છે. એક્સપ્રેસ એન્ટ્રી કેનેડામાં પ્રવેશવા માટેનો એક માત્ર સરળ માર્ગ ગણાય છે. જેનો છેલ્લો ડ્રો ૩૧મી ઓગસ્ટે થયો હતો. દરેક ડ્રો સાથે ઉમેદવારને ૨૫૦ આઈટીએએસ પોઈન્ટ્સ મળે છે.



ગત અઠવાડિયે એ વધીને ૫૦૦ સુધી પહોંચ્યો હતો. આજના ડ્રોમાં પણ એ વધતો જવાની શક્યતા છે. એક તરફ સીઆરએસમાં ઘટાડો

થઈ રહ્યો છે. જે દરેક ડ્રો બાદ સરેરાશ આઠથી નવ પોઈન્ટ્સ જેટલો રહ્યો છે. જો કે, આ વખતે એ માત્ર ૫ પોઈન્ટ જેટલો જ છે. જુલાઈમાં એ ૫૫૭ જેટલો રહ્યો હતો. જો કે, સીઈસીના ડ્રો પણ સપ્ટેમ્બર, ૨૦૨૧થી બંધ હતા. ઈમિગ્રેશન મિનીસ્ટર સીન ફેસરે તાજેતરમાં જ કહ્યું હતું કે, ૨૦૨૨ના અંત સુધીમાં કેનેડા એક જ વર્ષમાં ૪૦૫,૩૩૦ ઈમિગ્રન્ટસનો વિક્રમ વટાવી જશે. જુનના અંત સુધીમાં કેનેડાએ ૩ લાખ નવા ઈમિગ્રન્ટસને પ્રવેશ આપી દીધો હતો. આ વર્ષમાં અત્યાર સુધીમાં કેનેડાએ અંદાજે ૪૩૨૦૦૦ ઈમિગ્રન્ટસને એક્સપ્રેસ એન્ટ્રીથી પ્રવેશ આપ્યો છે. જો આ ગતિ જળવાઈ રહે તો કેનેડા ૨૦૨૨ના અંત સુધીમાં ૪૩૨૦૦૦નો લક્ષ્યાંક જરૂરી વટાવી શકશે. જેને માટે વિભાગે અરજીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવા અને વધારાના ૧૨૫૦ કર્મચારીઓની નિમણૂક જેવા પગલા પણ લીધા છે.

કેનેડામાં રોજગારીની તકમાં ઘટાડો નોંધાયો, કુશળ કામદારોની તંગીની પણ સંભાવના

ઓન્ટેરિયો

અમેરિકામાં ગ્રેટ રેઝીગ્નેશન યોજનાના અમલના એક વર્ષ બાદ કેનેડા પણ પોતાની ગ્રેટ રીટાયરમેન્ટ યોજના માટે ઉત્સાહિત છે. કેનેડાના કામદાર બળમાં ઓગસ્ટ સુધી વધારો હતો. પણ એના અગાઉના બે મહિનામાં અંદાજે હજારો લોકોએ નોકરી છોડી દીધી હતી. જેનું કારણ નિવૃત્તિ વય મર્યાદા હતું. જેથી હજારો કેનેડિયનો નોકરી ગુમાવી ચુક્યા હતા.

સ્ટેટિસ્ટિક્સ કેનેડાના અહેવાલ મુજબ આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધારે છે. અહેવાલ મુજબ એવું નથી કે, પાંસઠથી વધુ વયના લોકો કામ કરવાનું બંધ કરે છે. પણ પંચાવનથી

ચોંસઠના વય જૂથના લોકો પણ નિવૃત્તિ પસંદ કરી રહ્યા છે એવું રેટામાં જણાઈ રહ્યું છે.

જેને કારણે કેનેડામાં કુશળ કામદારોની તંગીની સંભાવના વધી રહી છે. આ અંગે અર્થશાસ્ત્રીઓ માને છે કે આની અસર દેશની ઉત્પાદકતા ઉપર

પણ પડી શકે છે. રેસ્ટોર્ડન ગ્રુપ સાથે સંકળાયેલા અર્થ શાસ્ત્રી જીમી જેન કહે છે કે, આ વાતની સંભાવના ઘણા સમયથી ચાલી રહી હતી. કોવિડ-19 દરમિયાન નિવૃત્તિમાં વધારો

થયો હતો. પણ હવે પ્રતિબંધો ઓછા થયા બાદ હવે લોકો પોતાના પરિવાર સાથે વધુ સમય ગાળવા અને પ્રવાસ કરવા માંગે છે. જેને કારણે માનવબળમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

નિવૃત્તિને કારણે કામદારોની સંખ્યાને પણ અસર, પંચાવનથી

મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોને રાહત: પીએમ ટ્રુડો દ્વારા યોજના જાહેર

વેનકુવર

વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જીવન નિર્વાહના ઊંચા ખર્ચને પહોંચી વળવા કેનેડીયનોના લાભાર્થે એક યોજના જાહેર કરી છે. આ કાર્યક્રમ દ્વારા દેશની ગઈ એસ.ટી. ટેક્સ ક્રેડિટ અને કેનેડા હાઉસિંગ બેનિફિટમાં એક વખતનો વધારો આપવામાં આવશે.

અમારી સરકારે લાખો કેનેડીયનોને લાભ આપવા માટે સખત મહેનત કરી છે, એમ ટ્રુડોએ મંગળવારે લિબરલ દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે, અમે ચોક્કસ વર્ગના લાભ માટે હજુ વધુ પગલાં લેવાની યોજના બનાવી છે. જેની જાહેરાત ટૂંક

સમયમાં કરવામાં આવશે. મંગળવારે કરવામાં આવેલી જાહેરાતમાં 6 મહિના માટે ગઈ એસ.ટી. ક્રેડિટનો બેવડો લાભ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ રાહતથી સરકારને નુકસાન થશે અને 11 મિલિયન કેનેડીયનો ઉપર તેની અસર થશે. ટ્રુડોએ જાહેરાત કરી હતી કે, તેની સરકાર 12 વર્ષથી નીચેના બાળકો ધરાવતા હોય અને જેઓ પાસે ડેન્ટલ ઈન્સ્યુરન્સ ન હોય તેવા લોકોને માટે એક નવી ડેન્ટલ સ્કીમ

ટેક્સ ક્રેડિટ અને હાઉસિંગ બેનિફિટ યોજનાનો વધુ એક વખત ફાયદો થશે

અમલમાં મુકવામાં આવશે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો કે જેમની કુલ આવક 90000ડોલર હોય તેમને દર વર્ષે આગામી બે વર્ષ સુધી 650 ડોલરની સહાય કરવામાં આવશે.

HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



Beautiful Total Of 5 Br 4 Wr (2Br 1 Wr In The Basement) Luxury Detached 2 Story House With Backyard. Excellent Location In Markham! Bright & Spacious Open Concept, With High Ceilings, Brand Kitchen Appliances, Countertop. Huge Master Bedroom With Walk-In Closet And 5 Piece Washroom. Minutes To Highway 407, Grocery, Hospital, Shopping, Bank And Community Center. Park And School Are Close The House.



Welcome To 54 Freeston Cres, Located In Prestigious Pickering Village Neighbourhood In Ajax. Over 3300 Sq Feet Of Living Space On First 2 Levels, Features Large Family Kitchen W/ Breakfast Bar & Walk Out To Deck On 59+ Premium Lot. Formal Living/Dining Rms, Main Floor Office, Fam Room With F.P, 2 Master B.R W/ Ensuite Baths. This Home Is Meticulous, Prof Landscaped, Walking Distance To Golf Course And All Amenities.



Beautiful 4 Bedroom (2 Masters With Ensuite) 5 Bathroom Bungalow. Superior 3000 Sq Ft Floor Plan With Custom Finishings And Built-In, Sq Ft Added By Creating Main Floor Master + 2 Bath (Ideal For Elderly Family Members) Dramatic Entrance And Staircase, Hardwood And 9 Ft Ceiling On Main Floor, Cozy Front Porch And Back Deck, Spacious Upgraded Gourmet Kitchen With High-End Appliances, 2 Ovens, Corian Counter, And Tile Backsplash, Definitely A Chef Delight!

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative
teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Centurion Office

Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.